

શ્રી મહાવીરાય નમઃ

જ્યુ ગુરૂ નાના

જ્યુ ગુરૂ રામ

# જૈન સંરક્ષણ પાઠ્યકાન્ત્રિક

ભાગ - ૪



સાધ્યગ્ર દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ

પ્રકાશક :

શ્રી અભિલ ભારતવર્ષીય સાધુભાગી જૈન સંઘ  
બીડાનેર

# નમરકાર મહામંત્ર

## એભો અરિંદાણં

## એભો સિદ્ધાણં

## એભો આયરિયાણં

## એભો ઉવજ્ઞાચાણં

## એભો લોએ સવ્વસાહૂણં

એસો પંચ એભોક્કારો, સવ્વપાવષ્પણાસણો  
મંગલાણં ચ સવેસિં, પઢ્મ હવ્ય મંગલં



॥ श्री भृत्युराय नमः ॥  
॥ ज्य नानेश ॥ ॥ ज्य रामेश ॥

# जैन संस्कार पाठ्यक्रम

भाग-४



: प्रकाशक :

श्री अभिल भारतवर्षीय साधुभागी जैन संघ  
बीकानेर

## **જૈન સંરકાર પાઠ્યકાળ ભાગ-૪**

આવૃત્તિ - (ગુજરાતી આવૃત્તિ-૧) મે ૨૦૧૭

કોપી - ૧૦૦૦

કોંમટ - રૂપીયા : ૫/-

અર્થ સૌજન્ય :

શ્રીમતી મંગલીદેવી ધર્મપત્ની સ્વ. શ્રી જૂમરમલજી છક્ષાણી

અસાવરી/નઈ દિલ્હી

પુસ્તક તથા પરીક્ષા ફોર્મ પ્રાપ્તિ સ્થાન :

શ્રી અભિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ

સમતા ભવન, આચાર્ય શ્રી નાનેશ માર્ગ, નોખા રોડ, ગંગાશહેર, બીકાનેર (રાજ.)

ફોન. ૦૧૫૧-૩૨૯૨૯૭૭, ૨૨૭૦૨૬૨

આચાર્ય શ્રી નાનેશ ધ્યાન કેન્દ્ર

પચિની માર્ગ, રાણા પ્રતાપ નગર રોડ, ઉદયપુર (રાજ.)

ફોન. ૦૨૯૪-૨૪૬૦૩૦૬, ૨૪૬૦૭૧૭

પ્રકાશક :

શ્રી અભિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ

સમતા ભવન, આચાર્ય શ્રી નાનેશ માર્ગ, નોખા રોડ,

ગંગાશહેર, બીકાનેર (રાજ.)

ફોન. ૦૧૫૧-૩૨૯૨૯૭૭, ૨૨૭૦૨૬૨

મુદ્રક :

જ્યંત પ્રિન્ટરી એલએલપી, મુંબઈ - ૨.

ફોન : ૦૨૨-૪૩૬૬ ૭૧૭૧

## ભૂમિકા

શ્રી અધિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ દ્વારા અનેક ધાર્મિક તથા સમાજિક ગતિવિધિઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ધાર્મિક પરીક્ષા બોર્ડ પણ એક છે. સન ૧૯૭૪ થી આ પરીક્ષાઓ નિરન્તર ચાલી રહી છે. જેના માધ્યમે જ્ઞાનાર્જન કરવા વાળા ભાવિકો માટે પાઠ્યક્રમ નિર્ધારિત કરી પરીક્ષાઓ લેવામાં આવે છે. વિલિમ પ્રસંગો પર પરમાગમ રહુસ્યજ્ઞાતા, વ્યસનમુક્તિ પ્રાપ્તેતા ૧૦૦૮ શ્રદ્ધેય ગુરુવર આચાર્ય શ્રી રામલાલ જી મ.સા. થી તત્ત્વ ચર્ચાનો અવસર પ્રાપ્ત થતો રહ્યો છે. તે તત્ત્વ ચર્ચાઓના સમય બદલતા પરિવેશ અનુરૂપ નવા પાઠ્યક્રમની આવશ્યકતા અનુભૂત થઈ.

તેથી જ જૈન સંસ્કાર પાઠ્યક્રમના નામથી નવીન પાઠ્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાં ભાગ ૧ થી ૧૨ સુધી પ્રસ્તુત કરવામાં આવેલ છે. જે વર્ષ ૨૦૦૩ થી નિરન્તર ગતિમાન છે. આમાં જૈન ધર્મના મૂલ સિદ્ધાન્તોનું જ્ઞાન પ્રાપ્ત થાય તથા વિશેષ જ્ઞાનાર્જન પ્રાપ્ત કરી જીવનમાં કંઈક મેળવી શકાય તેવો ઉદેશ છે. પાઠ્યક્રમને સુરૂચીપૂર્ણ તથા સુખોધ બનાવા માટે સાહિત્યના વિવિધ પ્રકારો થી સમૃદ્ધ બનાવવામાં આવેલ છે. આમાં ૨૦૧૧ સુધીના સંશોધનો સમાહિત છે.

ધાર્ણા સમયથી ગુજરાતના ભાવિકો તરફથી માંગ હતી કે આ પાઠ્યક્રમનું ગુજરાતીમાં પ્રકાશન થાય તો ગુજરાતના અધ્યયનાર્થીઓ પણ તેનો સારી રીતે લાભ લઈ શકે. આ ભાવનાને ધ્યાનમાં રાખી ગુજરાતીમાં પાઠ્યક્રમનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે.

પાઠ્ય ક્રમના સંકલનમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે જેમનો પણ માર્ગદર્શન તથા સહયોગ મળેલ છે, તે તમામ નો ખરા હંદ્ય થી આભાર વ્યક્ત કરીયે છીયે.

તમામ શ્રી સંધો, ચાતુર્માસિક ક્ષેત્રો તથા ભાવિક ભાઈ-બહેનોને અનુરોધ છે કે વધુમાં વધુ આ પરીક્ષાઓ માં ભાગ લઈને જ્ઞાનની વૃદ્ધિ કરે એજ શુભેચ્છા સાથે.

: વિનીત :

સંયોજક - ધાર્મિક પરીક્ષા બોર્ડ

શ્રી અધિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ  
બીકાનેર

## પરીક્ષાના નિયમો

પરીક્ષા માં ભાગ લેવા વાળા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવા ફરજીયાત છે. ઓછા માં ઓછા ૧૦ પરીક્ષાર્થી થશે ત્યાં પરીક્ષા કેન્દ્ર ખોલી શકાશે.

- |                     |  |
|---------------------|--|
| ૧. પાઠ્યક્રમ        | - ભાગ ૧ થી ૧૨ સુધી   |
| ૨. યોગ્યતા          | - જ્ઞાનાર્જનની અભિલાષા   |
| ૩. પરીક્ષાનો સમય    | - આસો મહિનાનું કૃષ્ણપક્ષ   |
| ૪. શ્રેણી નિર્ધારણા | -  |
| ૬. પ્રથમ શ્રેણી     | - ૭૫ % થી વધુ  |
| ૭. બીજી શ્રેણી      | - ૫૦ % થી ૭૫ %   |
| ૫. પરીક્ષા ફલ       | - પરીક્ષા ફલનું પ્રકારાન શ્રમાણોપાસક પત્રિકામાં તથા પરીક્ષા કેન્દ્રો પર ઉપલબ્ધ થશે.  |
| ૬. પ્રમાણ પત્ર      | - સમ્બન્ધિત પરીક્ષા કેન્દ્રો પર પ્રમાણ પત્ર મોકલવામાં આવશે.  |
| ૭. પારિતોષિક        | - પ્રત્યેક પરીક્ષા માં પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા અન્ય પ્રોત્સાહન પુરસ્કાર.<br>- ૧૮ વર્ષ થી ઓછી વયના વિદ્યાર્થીઓ માટે ૭૧ % થી ૧૦૦ % પ્રથમ શ્રેણી.<br>- ૩૫ % થી ૭૦ % દ્વિતીય શ્રેણી. |

### પરીક્ષાર્થી ધ્યાન આપે

આ ધાર્મિક પરીક્ષા જ્ઞાનાર્જન તથા જીવન વિકાસ માટે છે. આમાં નકલ કરવી અથવા પુસ્તક આદિ જોઈને લખવું કે પૂછીને ઉત્તર લખવા નિયમ વિસ્તૃત છે. આ માટે પરીક્ષા નિરીક્ષક અનુશાસનાત્મક કાર્યવાહી માટે અધિકૃત છે.

# અનુક્રમણિકા

ક્રમાંક	વિભાગ/પાના નં.	માર્ક્સ	૧૦૦
૧.	સૂત્ર વિભાગ .....		૩૪
(૧)	સામાધિક પ્રતિકમાણ સૂત્ર (અર્થ-ભાવાર્થ સહિત).....	૬	
(૨)	પ્રતિકમાણ સંબંધી ધ્યાતવ્ય બિંદુ.....	૭૬	
(૩)	પ્રતિકમાણ પ્રશ્નોત્તર.....	૮૦	
૨.	તત્ત્વ વિભાગ.....		૨૫
(૧)	સમકિતના દ્વારા બોલ.....	૮૨	
(૨)	તીર્થકર પદ ગ્રામિના રૂપ બોલ.....	૮૮	
(૩)	પુરુષવાનને ગ્રામ ઉત્તમ સામગ્રી .....	૮૯	
૩.	કથા વિભાગ .....		૧૦
(૧)	ભગવાન ઋષભદેવ .....	૬૦	
(૨)	અર્જુનમાળી.....	૮૬	
(૩)	છંદાણ મુનિવર .....	૮૯	
૪.	કાવ્ય વિભાગ .....		૧૫
(૧)	ભક્તામર સ્તોત્ર (૩૨ ગાથા) .....	૧૦૧	
(૨)	રત્નાકર પચ્ચીશ્વી (૧૩ ગાથા) .....	૧૦૭	
(૩)	અરિહંત જય જય .....	૧૦૮	
(૪)	કર્મો કા ખેલ .....	૧૦૯	
(૫)	વીર વંદના .....	૧૧૦	
૫.	સામાન્ય જ્ઞાન વિભાગ.....		૧૫
(૧)	લેશ્યાનું સ્વરૂપ .....	૧૧૧	
(૨)	સંથારો (સમાધિ-મરણ) .....	૧૧૫	
(૩)	આત્મહત્યા અને સંથારામાં અંતર .....	૧૧૭	
(૪)	સમય .....	૧૨૦	
	નમૂનાનું પ્રશ્નપત્ર .....	૧૨૧	

## ૧. સૂત્ર વિભાગ

॥ શ્રી વીતરાગાય નમઃ ॥

### (૧) શ્રાવક - પ્રતિક્રમણ સૂત્ર

(અર્થ ભાવાર્થ સહિત)

સ્થપાનકમાં મહારાજ સાહેબ બિરાજતા હોય તો, તેને તિક્ખુતોના પાઠથી ગ્રાણ વાર વંદના કરવી. જો મહારાજ સાહેબ બિરાજમાન ન હોય તો ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને ત્રાણવાર વંદના કરવી. આચાર્ય ભગવાન (પોતે-પોતાના ધર્માચાર્યજીનું નામ લઈને)ની આજ્ઞા લઈને ચંડુલીસત્ત્યા<sup>■</sup> કરવો. જેવી રીતે-આચાર્ય પ્રવર પૂર્જ્ય ૧૦૦૮ શ્રી રામલાલજી મહારાજ સાહેબની આજ્ઞાથી દેવસિય પ્રતિક્રમણ તેમ જ ચંડુલીસત્ત્યો કરું છું/કરીએ છીએ. ચંડુલીસત્ત્યોમાં નવકાર મંત્ર, ઈચ્છાકારેણ, તસ્સ ઉત્તરીનો પાઠ બોલીને કાયોત્સર્ગ\* કરવો. કાયોત્સર્ગમાં બે લોગસસ મનમાં કહેવા. ‘નમો અહિંતાણાં’ કહીને કાયોત્સર્ગ પારવો. ફરિથી નવકારમંત્ર અને કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ (કાયોત્સર્ગમાં આર્તાધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયું હોય અને ધર્મધ્યાન, શુક્લધ્યાન ન ધ્યાયું હોય, મન, વચન, કાયાના યોગથી ચલિત થયો હોઉં તો તસ્સ મિરછામિ દુક્કં) બોલવો અને એક લોગસસ પ્રગટપણે બોલવો. આસન છોડીને ડાબો

■ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના રદમા અધ્યયન તેમ જ અનુયોગ દ્વાર સૂત્ર અનુસાર ચંડુલીસત્ત્યવની બદલે ચંડુલીસત્ત્ય છે.

\* કાયોત્સર્ગ કરવાની વિધિ-

(અ) તીબા રહીને કાયોત્સર્ગ કરવાની વિધિ

- (૧) બને પગોના અગ્રભાગમાં ચાર આંગુલ અને પાછળના ભાગમાં કાંઈક ઓછું અંતર રાખીને ઘૂંટાણો વાળ્યા વિના સીધી તીબા રહેવું.
- (૨) આંખોને બંધી રાખીને અથવા થોડી ખુલ્લી રાખીને નાસિકાશ પર ધ્યાન કરવું.
- (૩) ગરદનને થોડી ઝૂકાવીને રાખવી.
- (૪) હથેળીઓને તાણાવ વગર ખુલ્લી રાખવી. હથોને નીચે લટકતા રાખવા.
- (૫) તસ્સ ઉત્તરીનો પાઠ બોલતા ધ્યાનની મુદ્રા કરવી. ‘અપાણ વોસિરામિ’ મનમાં બોલીને કાયાને સ્થિર કરવી.
- (૬) જેનું ધ્યાન કરતા હો (લોગસસ, ૮૮ અતિચાર વગેરે) તેનું ધ્યાન કરવું. નમો અહિંતાણાં બોલીને ધ્યાન પારવું.

(બ) બેસીને કાયોત્સર્ગ કરવાની વિધિ.

સુખાસનમાં બેસીને કરોડરજુને સીધી રાખીને, નાભિ પાસે ડાબી હથેળી પર જમણી હથેળી (Right palm on the left palm) રાખીને કાયોત્સર્ગ કરવો જોઈએ.

ધૂંટણ ઊભો કરીને બે નમોત્થુણાં<sup>\*</sup> બોલવા. બીજા નમોત્થુણામાં ‘સંપત્તાણ’ ના સ્થાન પર ‘સંપાવિઉકમાણાં’ કહેવું. બે નમોત્થુણાં પછી “ધર્મગુરુ ધર્મચાર્યનો સ્તુતિપાઠ” કહેવો\* - “નમોત્થુણાં રામસ્સ ગળિંવરરસ્સ” મમ ધર્માયરિયસ્સ ધર્મોવાચેસગસ્સ” અને પછી ઊભા રહીને ત્રણવાર તિકખુતોના પાઠથી વંદના કરીને ‘ઈચામિણાં ભંતે’ નો પાઠ બોલવો.

## ૧. ઈચ્છામિ ણાં ભંતોનો પાઠ

(પ્રતિકમાણ - અનુજ્ઞા - સૂત્ર)

ઈચ્છામિ ણાં ભંતે ! તુખ્બેહિં અભમણુણણાએ સમાણો દેવસિય<sup>\*\*</sup> પડિક્કમણાં ઢાંચેમિ દેવસિય■ - ણાણા-દંસણા-ચરિતાચરિત-તવ-અઈયાર ચિંતાશતથં કરેમિ કાઉસગાં.

**નોંધ :** પુરુષોએ ઊભા રહીને જ કાયોત્સર્જ કરવો જોઈએ. શારીરિક અનુકૂળતા ન હોવી આદિ કરણોથી જેઓ ઊભા-ઊભા કાયોત્સર્જ ન કરી શકે તે બેસીને પણ કાયોત્સર્જ કરી શકે છે.  
● નમોત્થુણાં (શક્કસ્તવ) કરવાની વિધિ :-

(અ) આસનથી નીચે ઉત્તીર્ણે ઊભો ધૂંટણ ઊંચો કરીને બન્ને કોણોનો પેટ પર લગાવીને, હાથ જોડીને, મસ્તક નમાવીને, મસ્તક પર બન્ને હાથ રાખવા જોઈએ.

(૨) વિરામ સ્થળનું ધ્યાન રાખતા, ભાવસહિત બે વાર નમોત્થુણાનો પાઠ બોલવો. બીજા નમોત્થુણામાં ‘ણાણા-સંપત્તાણાં’ ના સ્થાન પર ‘ણાણાં સંપાવિઉકમાણાં’ કહેવું.

(૩) બે નમોત્થુણાં પછી પોતાના ધર્મગુરુ-ધર્મચાર્યનો સ્તુતિ પાઠ કહેવો..

\* શ્રી રાજપ્રશાનીય વગેરે અનેક આગમોમાં પ્રસંગોપાત સિધ્ધ તેમ જ અરિહંત પછી, પોતાના ધર્મચાર્યને નમસ્કાર કરવાનો ઉલ્લેખ જોવા મળે છે. બે નમોત્થુણાં પછી શ્રાવક-શ્રાવકિઓ દ્વારા પણ પોતાના ધર્મચાર્યની સ્તુતિ કરવી આગમિક વિધિ છે. આથી સર્વત્ર બે નમોત્થુણાં પછી ધર્મગુરુ-ધર્મચાર્યને સ્તુતિ પાઠ ઉચ્ચારણીય હોવાના કારણે આ પાઠને અહીં લેવામાં આવ્યો છે.

❖ અહીંયા પોત-પોતાના ધર્મગુરુ-ધર્મચાર્યના નામ લઈ શકાય છે.

\* અહીંયા રાત્રિ પ્રતિકમાણમાં ‘રાઈં’, પાંક્ષિક પ્રતિકમાણમાં ‘પદ્ધિખ્યં’, ચાતુર્માસિક પ્રતિકમાણમાં ‘ચાઉમ્માસિયં’, સાંવત્સરિક પ્રતિકમાણમાં ‘સંવચ્છરિયં’ શબ્દ બોલવો જોઈએ.

■ અહીં રાત્રિ પ્રતિકમાણમાં રાઈં, પાંક્ષિક પ્રતિકમાણમાં ‘પદ્ધિખ્ય’, ચાતુર્માસિક પ્રતિકમાણમાં ‘ચાઉમ્માસિય’, સાંવત્સરિક પ્રતિકમાણમાં ‘સંવચ્છરિય’ શબ્દ બોલવો જોઈએ.

ઈચ્છામિ	- હું ઈચ્છું છું.
ણં	- આ અવ્યવ છે, વાક્ય અલંકારમાં વપરાય છે.
ભંતે	- હે પૂજ્ય ! હે ભગવાન !!
તુબ્બેહિં	- આપની
અભિષ્ટશુષ્ણાઓ સમાણો	- આજ્ઞા ભળવા પર
દેવસિયં પડિક્કમણાં	- દિવસ સંબંધી પ્રતિકમણ
ઠાએમિ	- કરવાની
દેવસિય	- દિવસ સંબંધી
શાણા-દંસન	- જ્ઞાન-દર્શન (શ્રદ્ધા)
ચરિતાચરિત	- ચારિત્રાચારિત્ર (શ્રાવક ધર્મ)
તવ	- તપ (અના)
અઈયાર	- અતિયારો (દોષો)નું
ચિંતાશુટં	- ચિંતન કરવા માટે.
કરેમિ	- કરું છું.
કાઉસર્ગાં	- કાયોત્સર્ગ

**ભાવાર્થ :** - હે ભગવાન ! હું આપની આજ્ઞા લઈને, દિવસમાં લાગેલા દોષોથી નિવૃત્ત થવા ઈચ્છું છું. દિવસમાં જે જ્ઞાન, દર્શન, શ્રાવક વ્રત તથા તપમાં અતિયાર લાગ્યા હોય, તેનું ચિંતન કરવા માટે કાયોત્સર્ગ કરું છું.

**વિધિ :-** તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરીને પ્રથમ સામાયિક આવશ્યકની આજ્ઞા છે, એમ કહીને ઊભા ઊભા નવકારમંત્ર, કરેમિ ભંતેનો પાઠ બોલીને, ઈચ્છામિ ઠાઈઉનો પાઠ.

## ૨. ઈચ્છામિ ઠાઈઉનો પાઠ

(આત્મ-વિશુદ્ધિ-સૂત્ર)

ઈચ્છામિ ઠાઈઉ કાઉસર્ગાં જો મે દેવસિઓ\* અઈયારો કઓ કાઈઓ વાઈઓ

\* અહીં રાત્રિ પ્રતિકમણમાં ‘રાઈઓ’, પાદ્યિક પ્રતિકમણમાં ‘પાદ્યાઓ’, ચાતુર્માસિક પ્રતિકમણમાં ‘ચાઉમાસિયો’, સાવતસંરિક પ્રતિકમણમાં ‘સવંચણરિયો’ શબ્દ બોલવો જોઈએ.

માણસિઓ ઉસુતો ઉમ્મગ્ગો અકપો અકરણિજજો કુજગાઓ દુલ્વિચિંતિઓ આણાયારો અણિચિછયવો અસાવગ પાઉગ્ગો નાણેં દંસણે ચરિતાચરિતે સુએ સામાઈએ\* ચઉણું કસાયાણં પંચાણું મણુલ્વયાણં તિણું ગુણુલ્વયાણં ચઉણું સિક્ખાવયાણં બારસ વિહુસ્સ સાવગ ધમ્મરસ જં ખંડિય જં વિરાહિય તસ્સ મિચામિ દુક્કડં.

ઈચામિ ઠાઈઉ	- હું કરવાની ઈચ્છા કરું છું.
કાઉસ્સગ્ગાં	- એક સ્થાનમાં સ્થિર રહેવા રૂપ કાયોત્સર્ગ.
જો મે	- જો મે.
દેવસિઓ	- દિવસ સંબંધી.
અઈયારો કાઓ	- અતિચાર (દોષ) કર્યા હોય.
કાઈઓ	- કાયા સંબંધી.
વાઈઓ	- વચન સંબંધી.
માણસિઓ	- મન સંબંધી.
ઉસુતો	- સૂત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હોય.
ઉમ્મગ્ગો	- ઉન્માર્ગ (જૈન માર્ગથી વિપરીત) પ્રવૃત્તિ કરી હોય.
અકપો	- અકલ્પનીય (નહિ કરવા યોગ્ય) કર્યું હોય.
અકરણિજજો	- નહિ કરવા યોગ્ય કાર્ય કર્યું હોય.
કુજગાઓ	- દુષ્ટ ધ્યાન કર્યું હોય.
દુલ્વિચિંતિઓ	- દુષ્ટ ચિંતન કર્યું હોય.
આણાયારો	- અનાચારનું સેવન કર્યું હોય. નિયમોનો સર્વથા ભંગ કર્યો હોય.
અણિચિછયવો	- નહિ ઈચ્છવા કાર્ય કર્યું હોય.

● દુરિભદ્રીય આવશ્યકવૃત્તિ, આવશ્યક નિર્મુક્તિ, આવશ્યક ચૂણ્ણ, આવશ્યકાવચૂરિમાં ‘તહ’ શબ્દનો ઉલ્લેખ નથી. આથી શુદ્ધ મૂળ પાઠનું અનુસરણ કરતા ‘તહ’ શબ્દ આ પાઠમાં નથી રાખ્યો.

\* શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન ૩ ઉદ્દેશક એક (૧) માં ત્રણ ગુપ્તિ સંયમી મનુષ્યની બતાવી છે, આથી ત્રણ ગુપ્તિ સંબંધી પ્રતિકમણ શ્રાવકો માટે ન હોવાથી તિણું ગુતીણાં પાઠ રાખવામાં નથી આવ્યો. સમેલનમાં વિભિન્ન સંપ્રદાયોની પારસ્પારિક ચર્ચાઓની નિષ્કર્ષમાં પણ તિણું ગુતીણાં નો પાઠ નથી એવો ઉલ્લેખ છે.

અસાવગ પાઉંગો	- શ્રાવક વૃત્તિથી વિરુદ્ધ કાર્ય કર્યું હોય.
નાણો	- જ્ઞાનમાં.
દંસણો	- દર્શનમાં.
ચારિતાચારિતે	- ચારિત્રા-ચારિત્ર (શ્રાવક વ્રત)માં.
સુઅે	- સૂત્ર સિદ્ધાંતમાં.
સામાઈએ	- સમતાભાવકૃપ સામાયિકમાં.
ચાઉણુહું કસાચાણાં	- ચાર કષાય (કોધ-માન-માયા-લોભ)માં.
પંચાણુહું મજૂલ્વચાણાં	- પાંચ અણુવ્રત (સ્થૂલ હિંસાનો ત્યાગ, સ્થૂલ મૃખાવાદ - અસત્યનો ત્યાગ, સ્થૂલ અદ્ધતાદાન - ચોરીનો ત્યાગ, સ્થૂલ મૈથુન સેવનનો ત્યાગ, સ્થૂલ પરિચહુ પરિમાળના).
તિણુહું ગુણાવચાણાં	- ત્રણ ગુણવ્રત (દિશાવ્રત, ઉપભોગ-પરિભોગ પરિમાળ વ્રત, અનર્થદંડ ત્યાગ વ્રત)ના.
ચાઉણુહું સિક્ખાવચાણાં	- ચાર શિક્ષાવ્રત (સામાયિક, દેશાવકાશિક વ્રત, પૌષ્ઠ્રોપવાસ વ્રત, અતિથિ સંવિભાગ વ્રત) ના.
બારસ વિહુસ્સ	- એ બાર પ્રકારના.
સાવગ ધમસ્સ	- શ્રાવકધર્મનું.
જ ખંડિયં	- જે કાંઈ ખંડન કર્યું હોય (અદ્ય દોષ લગાડવા).
જ વિરાહિયં	- જે કાંઈ વિરાધના કરી હોય (અધિક દોષ) લગાડવા.
તસ્સ મિચામિ દુક્કડં	- તેનું મારું પાપ નિષ્ફળ થાઓ.

**ભાવાર્થ** - હું સ્થિર ચિત્ત થઈને કાયોત્સર્ગ કરવાની ઈચ્છા કરું છું, મેં મન-વચન-કાયાથી કોઈ અતિચાર કર્યા હોય, સૂત્ર વિરુદ્ધ કર્યું હોય, જૈનધર્મ પ્રતિકૂળ આચરણ કર્યું હોય, અકલ્પનીય કામ કર્યું હોય, નહિ કરવા યોગ્ય કામ કર્યું હોય, આત્મધ્યાન અને રૌદ્રધ્યાન ધ્યાયું હોય, મારી આત્મામાં દુષ્ટ વિચાર ઉત્પન્ન થયા હોય, શ્રાવકધર્મથી વિપરીત કામ કર્યું હોય, જ્ઞાન-દર્શન-શ્રાવકવ્રત-સૂત્ર તથા સામાયિક વગેરેમાં અતિચારનું સેવન કર્યું હોય, મન-વચન અને કાયાને વશમાં ન રાખ્યા હોય, કોધ-માન-માયા-લોભ આ ચાર કષાયોનું દમન ન કર્યું હોય, પાંચ અણુવ્રત, ત્રણ

ગુણવત અને ચાર શિક્ષાવ્રત આ પ્રકારે શાવકના ૧૨ વ્રતોનું અદ્યારોંશે ખંડન કર્યું હોય તથા અધિકાંશે વિરાધના કરી હોય તો, તેનાથી ઉત્પન્ન થયેલા મારા બધા પાપ નિષ્ફળ થાઓ.

**વિધિ :-** તસ્સઉત્તરીનો પાઠ બોલીને ૮૮ અનિયાર (આગમે તિવિહેથી નાની સંલેખના સુધીના બધા પાઠ) અને ૧૮ પાપસ્થાનનો પાઠ કાયોત્સર્ગમાં \* બોલવો. પાઠોમાં જ્યાં જ્યાં તસ્સ મિચ્છામિ દુક્કડ આવે ત્યાં ત્યાં કાયોત્સર્ગમાં તસ્સ આલોઉ બોલવું જોઈએ.

### ૩. આગામે તિવિહે સૂત્ર

## (શાનના અતિચારોનો પાઠ)

આગમે તિવિહુ પન્નતે તં જહા સુતાગમે અત્થાગમે તહુભયાગમે આ રીતે ગ્રાણ પ્રકારના આગમરૂપ જ્ઞાનના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય જં વાઈધ વચ્ચામેલિય હીણાફખરં અચ્યકખરં પયહીણાં વિષયહીણાં ઘોસહીણાં જોગહીણાં સુટકુદિનાં ફુટકુપડિચિછયં અકાલે કાઓ સજ્જાઓ કાલે ન કાઓ સજ્જાઓ \*અસજ્જાઈએ સજ્જાઈયં “સજ્જાઈએ ન સજ્જાઈયં ભાગુતા - ભાગુવતા

- \* આ સંશોધન પૂર્વે શ્રાવક પ્રતિકમાગુમાં ‘ઈચછામિ ડાઈઉ’નો પાઠ કુલ દ વાર તથા ‘૧૮ પાપ સ્થાન’નો પાઠ કુલ ચાર વાર મનનીય, ઉચ્ચારાણીય હતો. સમેલનમાં વિભિન્ન સંપ્રદાયોની પારસ્પરિક ચર્ચાઓના નિષ્કર્ષમાં ‘ઈચછામિ ડાઈઉ’ નો પાઠ પ્રતિકમાગુમાં ગ્રાગવારથી વધારે રાખવો નહિ એવો ઉલ્લેખ છે. આ દ્રષ્ટિથી ‘ઈચછામિ ડાઈઉ’ નો પાઠ જ્યાં જ્યાં નથી રાખ્યો તે- (૧) કાયોત્સર્ગમાં દ્વદ અતિયાર પછી (૨) મકટરૂપે બોલતી વખતે દ્વદ અતિયાર પછી (૩) મોટી સંલેખાગુા પછી. ૧૮ પાપસ્થાનના પાઠને મોટી સંલેખાગુા પછી નથી રાખવામાં આવ્યો. ઈચ્છામિ ડાઈઉના પાઠને જ્યાં જ્યાં રાખવામાં આવ્યો છે તે સ્થાન. (૧) પહેલા આવશ્યકમાં કાયોત્સર્ગથી પહેલા (૨) શ્રાવકસૂત્રમાં તેમ જ (૩) પાંચમા આવશ્યકમાં કાયોત્સર્ગથી પહેલા. ૧૮ પાપસ્થાનને જ્યાં જ્યાં રાખવામાં આવ્યા છે તે સ્થાન- (૧) કાયોત્સર્ગમાં દ્વદ અતિયાર પછી (૨) મકટરૂપે બોલતા દ્વદ અતિયાર પછી (૨) ‘ખામેમિ સંવે જીવા’ પછી.

- ❖ આવશ્યક ચૂર્ણ હારિભદ્રીય - આવશ્યકવૃત્તિ વગેરે અનેક પ્રાચીન ગ્રંથોમાં જોગહૃણાં ઘોસહૃણાં ને બદલે ઘોસહૃણાં જોગહૃણાં કમ છે. તેમ જ આ ગ્રંથોમાં અસજીઆનેના સ્થાન પર અસજીઆઈએ અને સજીઆનેના સ્થાન પર સજીઆઈએ પાડ છે, આથી શુદ્ધ કમ તેમ જ પાડ અનુસાર અહીં સંશોધન કર્યું છે.

ચિંતન કરતા જ્ઞાન અને જ્ઞાનવંત પુરુષોનો અવિનય અશાતના કરી હોય તો જો મે દેવસિયો\* અઈયારો કઓ તસ્સ ભિચ્છામિ ફુક્કડં.

આગમે	- આગમ.
તિવિહે	- ત્રણ પ્રકારે.
પન્નતે	- કલ્યા છે.
તં જણા	- જેમ કે.
સુતાગમે	- મૂળ પાઠ રૂપ આગમ
અત્થાગમે	- અર્થરૂપ આગમ.
તફુભયા તફુભયાગમે જં	- મૂળ અને અર્થ આ બન્ને રૂપ આગમ. - જે.
વાર્ધિક્ષં	- સૂત્રના અક્ષર આઘા-પાઠા ભાગ્યા હોય.
વચ્ચામેલિયં	- *એક જ શાખમાં અલગ અલગ સ્થાનો પર આવેલા સમાન અર્થવાળા પાઠો અથવા અસ્થાનમાં વિરામ લીધો હોય અથવા પોતાની બુદ્ધિથી શાખ સમાન સૂત્ર બનાવી આચારાંગ વગેરે સૂત્રોમાં લખીને વાંચ્યું હોય.
હીણક્ખરં	- અક્ષર ઓછો ભાગાયો હોય.
અર્થક્ખરં	- અધિક અક્ષર ભાગાયો હોય.
પથહીણં	- પદહીન ભાગાયું હોય.
વિણયહીણં	- વિનય - રહિત ભાગાયું હોય.
ઘોસહીણં	- ઉદાતા* આદિ સ્વર રહિત ભાગાયું હોય.
જોગહીણં	- યોગહીન (મન-વચન-કાયા આ ત્રણે યોગની એકાગ્રતા રહિત) ભાગાયું હોય.
સુટ્કુદિનં	- શિષ્યમાં શાખ ગ્રહણ કરવાની જેટલી શક્તિ હોય તેનાથી વધારે અપાયું હોય.

\* અહીં અને આગળ પાણ જ્યાં જ્યાં દેવસિઓ શર્બદ છે, ત્યાં ત્યાં રાત્રિ પ્રતિકમાળમાં રાઈઓ વગેરે પૂર્વાનુસાર સમજી લેવું.

ઝી શ્રી અનુયોગદાર સૂત્ર - ૧૩ મલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત ટીકાનુસાર આ અર્થ છે.

\* સ્વરના ત્રણ ભેદ છે - ઉદાત અનુદાત, સ્વરિત.

ઉચ્ચૈરૂપલભ્યમાન ઉદાત: નોચૈરનુદાત: સમવૃત્તા સ્વરિત: અર્થાત્ ઊચા સ્થાનથી બોલવાવાળા ઉદાત અને નીચા સ્થાનથી બોલવાવાળા અનુદાત તથા સમાન સ્થાનથી બોલવાવાળા સ્વરિત સ્વર કહેવાય છે. જે સ્વર જે સ્થાનથી બોલવો જોઈએ તેને તે સ્થાનથી ન બોલાય તો ઘોષહીણં અતિચાર લાગે.

દુષ્કૃપદિચ્છિયં	- આગમને દુષ્ટભાવથી ગ્રહણ કર્યું હોય.
અકાલે કાઓ	- જે સૂત્રોના જે કાળ શાખમાં સ્વાધ્યાય.
સજ્જાઓ	- માટે કથા હોય તે કાળમાં ન કરતા બીજા કાળમાં તે સૂત્રનો સ્વાધ્યાય કર્યો હોય.
કાલે ન કાઓ સજ્જાઓ -	કાળમાં સ્વાધ્યાય ન કર્યો હોય.
અસજ્જાઈએ સજ્જાઈયં	- અસ્વાધ્યાયિક સ્થાનમાં સ્વાધ્યાય કર્યો હોય.
સજ્જાઈએ ન સજ્જાઈયં	- સ્વાધ્યાય સ્થાનમાં સ્વાધ્યાય ન કર્યો હોય.
તસ્સ	- તેનાથી ઉત્પન્ન થયેલું.
મિચ્છામિ દુક્કડં	- માંનું પાપ નિષ્ફળ થાઓ.

**ભાવાર્થ -** મૂળપાઠ રૂપ, અર્થ રૂપ અને મૂળપાઠ - અર્થરૂપ આવી રીતે ત્રણ પ્રકારના આગમ-જ્ઞાનના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય, હું તેની આલોચના કરું છું. જો સૂત્રના અક્ષર આધા પાછા ભણાયા હોય, એક જ શાખમાં અન્યાન્ય સ્થાનો પર આપેલા એકાર્થક સૂત્રોને એક સ્થાન પર લાવીને ભણાયા હોય અથવા અસ્થાનમાં વિરામ લીધો હોય અથવા આચારાંગ આદિ સૂત્રોમાં સ્વભતિ રચિત સૂત્ર બનાવીને, પ્રક્ષેપ કરી વાંચ્યા હોય, હીનાધિક અક્ષર વાંચ્યા હોય, કેટલાક પદ ઓછા ભણાયા હોય, વિનય રહિત ભણાયા હોય, ઉદાત્તાદિ સ્વરરહિત ભણાયા હોય, શક્તિથી વધારે ભણાયું હોય, આગમ દુષ્ટભાવથી ગ્રહણ કર્યા હોય, અકાળમાં સ્વાધ્યાય કર્યો હોય, કાળમાં સ્વાધ્યાય ન કર્યો હોય, અસ્વાધ્યાયના સ્થાને સ્વાધ્યાય કર્યો હોય, સ્વાધ્યાયના સ્થાને સ્વાધ્યાય ન કર્યો હોય તથા વાંચતા, મનન કરતા, વિચારતા જ્ઞાન તથા જ્ઞાનવંત પુરુષોનો અવિનય, આશાતના કરી હોય તો મારા આ બધા પાપ નિષ્ફળ થાઓ.

## ૪. દર્શન સમ્યકૃતવનો પાઠ

(સમ્યકૃતવની શુદ્ધિધિનો પાઠ)

અરિહુંતો મહુદેવો, જાવક્ષીવંચે\* સુસાહુણો ગુરુણો ।  
જિણપણાતં તતં, ઈએ સમ્મતં મએ ગાહિયં ॥૧॥

\* આવશ્યક સંબંધી પ્રાચીન ગ્રંથોમાં ‘જાવક્ષીવાએ’ ના સ્થાન પર ‘જાવક્ષીવં’ શબ્દ છે, જાવક્ષીવાએ શબ્દ બોલવાથી છંદનો ભંગ થાય છે.

પરમત્થસંથવો વા સુદિટ્ઠ પરમત્થસેવણા વાવિ ॥  
વાવણા કુંદસણા વજજણા, ય સમૃત સદ્ગદણા ॥૨ ॥

ઇચ્છા સમૃતસસ પંચ અઈયારા પેયાલા જાળિયત્વા ન સમાયરિયત્વા તં જહા સંકા કંખા વિતિગિશછા પરપાસંડ પસંસા પરપાસંડ સંથવો આ પ્રકારે શ્રી સમકિત રતન પદાર્થના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તં જહા (૧) જિનવચનમાં શંકા કરી હોય (૨) પરદર્શનની આકંસા કરી હોય. (૩) ધર્મના ફળમાં સંદેહ કર્યો હોય. (૪) પરપાંખડીની પ્રશંસા કરી હોય. (૫) પરપાંખડીનો પરિચય કર્યો હોય. મારા સમ્યકૃત્વ રૂપ રતન વિષે મિથ્યાત્વરૂપી ૨૪ - મેલા લાગ્યો હોય તો જો મે દેવસિઓ અઈયારો કાઓ તસ્સ મિશછામિ દુક્કડં.

અરિહુંતો	- અરિહુંત ભગવાન
મહુ	- મારા
દેવો	- દેવ છે.
જાવજજીવં	- જીવન પર્યત
સુસાહુણો	- ઉતમ (નિગ્રન્થ) સાધુ
ગુરુણો	- ગુરુ છે.
જિણા પણણતં	- જિનેન્દ્ર પ્રરૂપિત
તત્તં	- તત્ત્વ (ધર્મ) છે.
ઈઅ	- આ પ્રકારે
સમૃતં	- સમ્યકૃત્વ
મઞે	- મેં
ગાહિયં	- ગ્રહણ કર્યું છે.
પરમત્થસંથવો વા	- જીવાદિ નવ તત્ત્વોનું સમ્યક જ્ઞાન.
સુદિટ્ઠ પરમત્થ સેવણા	- જેણે સારી રીતે જીવાદિ તત્ત્વોને
વા વિ	- જાણ્યા છે તેના સેવા તથા ગુણકીર્તન કરવા.
વાવણા કુંદસણા	- તથા સમ્યકૃત્વથી ભ્રષ્ટ અને મિથ્યાદાઢિ
વજજણા ય	- જીવોની સંગતિનો ત્યાગ કરવા રૂપ.

સમ્મત સદ્ગુરૂ	- સમકિતની શ્રદ્ધા.
ઈએ	- આ પ્રકારે
સમ્મતસ્સ	- સમ્યકૃત્વના
પંચ	- પાંચ
અઈચારા	- અતિચારો
પેચાલા	- પ્રધાન.
જાણિયત્વા	- જાણવા યોજ્ય, પરંતુ
ન સમાચારિયત્વા	- આચારણ કરવા યોજ્ય નથી.
તં જહા	- તે અતિચાર આ પ્રકારે છે.
સંકા	- વીતરાગના વચનમાં શંકા કરવી.
કંખા	- જે માર્ગ વીતરાગ કથિત નથી, તેની કંશા (ઈચા) કરવી.
વિતિગિચ્છા	- ધર્મકિયાના ફળમાં સંદેહ કરવો.
પરપાંસડપસંસા	- પરપાંખડીની પ્રશંસા કરવી.
પરપાંસડ સંથવો	- પરપાંખડીનો પરિચય કરવો.

**ભાવાર્થ -** જીવનપર્યંત અરિહંત મારા દેવ છે, ઉત્તમ સાધુ મારા ગુરુ છે. તથા વીતરાગ કથિત તત્ત્વ જ ધર્મ છે. આ પ્રકારે હું સમ્યકૃત્વને ગ્રહણ કરું છું. મને જીવાદિ પદાર્થોનો પરિચય છે. ભલી પ્રકારે જીવાદિ તત્ત્વોને તથા સિદ્ધાંતના રહસ્યને જાણવાવાળા સાધુની સેવા પ્રાપ્ત થાય સમ્યકૃત્વથી બ્રહ્મ તથા ભિથ્યાત્મી જીવોની સંગતિ કયારે પણ ન થાય, એવા સમ્યકૃત્વ વિશે મારી શ્રદ્ધા દૃઢ રહે. જો મેં વીતરાગના વચનમાં શંકા કરી હોય, જે માર્ગ વીતરાગ કથિત નથી, તેની કંશા-ઈચા કરી હોય, ધર્મકિયાના ફળમાં સંદેહ કર્યો હોય, પરપાંખડીની પ્રભાવના જોઈને તેની પ્રશંસા કરી હોય તથા પરપાંખડી સાથે પરિચય કર્યો હોય તો, હું તેની આલોચના કરું છું. મારા તે બધા પાપ નિષ્ફળ થાઓ.

## ૫. બાર પ્રતોના અતિચાર

પહેલા સ્થૂલ-પ્રાણાતિપાત-વેરમાણ વ્રતના વિષયમાં જ કોઈ અતિચાર લાગ્યા  
જૈન સંસ્કાર પાદ્યકુમ ભાગ-૪ ..... 15

હોય તો તં જઈ\* (૧) ગુસ્સાથી ત્રસ જીવોને ગાડે બંધન બાંધ્યા હોય, (૨) ત્રસ જીવોને લાકડી પ્રમુખના પ્રહાર કર્યા હોય, (૩) નાક, કાનાંદિ અવયવો (ચામડી આંદિ) છેદ્યાં હોય, (૪) અધિક ભાર ભર્યો હોય, (૫) આહાર-ભાત-પાણીની અંતરાય આપી હોય, આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડં.

**બીજા સ્થૂલ - મૃષાવાદ - વેરમણ ક્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તં જઈ\* (૧) સહસાકારં કોઈના પર ખોટો આરોપ લગાડ્યો હોય, (૨) એકાન્તમાં ગુપ્ત વાતચીત કરતા હોય, તે વ્યક્તિઓ પર ખોટો આરોપ લગાડ્યો હોય, (૩) પોતાની સ્ત્રીના\* મર્મ (ગુપ્ત વાત) પ્રકાશિત કરી હોય, ■ (૪) મૃષા (ખોટો) ઉપદેશ આપ્યો હોય, (૫) ખોટા લેખ લખ્યા હોય, આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડં.**

**ત્રીજા સ્થૂલ - અદત્તાદાન - વેરમણ ક્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તં જઈં (૧) ચોરની ચોરાઉ વસ્તુ લીધી હોય, (૨) ચોરને સહાયતા કરી હોય, (૩) રાજ્ય વિરુદ્ધ કામ કર્યું હોય, (૪) ખોટો તોલા, ખોટા માપ રાખ્યા હોય, (૫) વસ્તુમાં ભેળસેળ કરી હોય, આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડં.**

જી પ્રતિકમણના પાઠોના આરંભમાં આલોઉં શબ્દનું કોઈ પ્રયોજન નથી. પાઠના અંતમાં યથાસ્થાન તસ્સ આલોઉં (પ્રથમ આવશ્યકમાં કાયોત્સર્જમાં ૮૮ અતિચારોનું ચિંતન કરતી વખતે) અને તસ્સ મિચ્છામિ દુક્કડં કહેવામાં આવે છે. કાયોત્સર્જમાં તસ્સ આલોઉં દ્વારા દોપોની આલોચના કરતા તેમ જ ચતુર્થ આવશ્યકમાં દોપોને તસ્સ મિચ્છામિ દુક્કડં આપતા પ્રતિકમણના પાઠોના આરંભમાં આલોઉં બોલવાનું કોઈ પ્રયોજન નથી, તેથી આગમે તિવિષે, ૧૨ ક્રતોના અતિચાર અને ૧૮ પાપસ્થાનોના પાઠ આંદિના આરંભમાં આવવાવાળા આલોઉં શબ્દને નિષ્પ્રયોજન કાઢી નાખવામાં આવ્યો છે.

\* પ્રતિદિન દિવસના પ્રતિકમણમાં દિવસ સંબંધી, રાત્રિના પ્રતિકમણમાં રાત્રિ સંબંધી, પાક્ષિક પ્રતિકમણમાં પદ્ધભી સંબંધી, ચૌમાસી પ્રતિકમણમાં ચૌમાસી સંબંધી અને સંવત્સરી પ્રતિકમણમાં સંવત્સરી સંબંધી બોલવું જોઈએ.

❖ સમજયા વિચાર્યા વિના કરેલી મુવૃત્તિ.

\* સ્ત્રીએ પોતાનો પુરુષ કહેવું જોઈએ.

■ મૂળ પાઠમાં સદારમંતબેએ પાઠ અનુસાર અહીંયા પોતાની સ્ત્રીના મર્મ પ્રકાશિત કરેલા હોય એવો અર્થ કર્યો છે. ઉપલક્ષણથી કોઈપણ વ્યક્તિના મર્મ પ્રકાશિત કરવા અતિચાર છે, એવું સમજવું જોઈએ.

ચોથા સ્વદાર\* સંતોષ પરહાર વિવર્જન રૂપ સ્થૂલ મૈથુન વેરમણ વ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તં જહા - (૧) ઈતરિય પરિગૃહિયાંથી ગમન કર્યું હોય, (૨) અપરિગૃહિયાથી ગમન કર્યું હોય, (૩) અનંગકીડા કરી હોય, (૪) પરના વિવાહ કરાવ્યા હોય, (૫) કામભોગની તીવ્ર અભિલાષા કરી હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તરસ્સ મિચ્છામિ દુક્કડં.

પાંચમા-સ્થૂલ - પરિગૃહ - વેરમણ (પરિગૃહ પરિમાણ) વ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તં જહા - (૧) ખેત\* - વત્થું \*ના પરિમાણનું અતિકમણ (ઉલ્લંઘન) કર્યું હોય, (૨) હિરાય્ય-સુવાર્ણના પરિમાણનું અતિકમણ કર્યું હોય, (૩) ધન-ધાયના પરિમાણનું અતિકમણ કર્યું હોય, (૪) દુપદ-ચદુપદના પરિમાણનું અતિકમણ કર્યું હોય. (૫) કુપ્ય (કાંસા, પીતળ, તાંબું, લોખંડ વગેરે ધાતુ તથા તેનાથી બનેલા વાસણ અને શાયા, આસન, વસ્ત્ર વગેરે ધાતુ સંબંધી વસ્તુઓ) ના પરિમાણનું અતિકમણ કર્યું હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તરસ્સ મિચ્છામિ દુક્કડં.

છટા દિશાવ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તં જહા - (૧) ઊંચી દિશાના પરિમાણનું અતિકમણ કર્યું હોય, (૨) નીચી દિશાના પરિમાણનું અતિકમણ કર્યું હોય, (૩) તિર્યકી દિશાના પરિમાણનું અતિકમણ કર્યું હોય, (૪) ક્ષેત્ર વધાર્યું હોય, (૫) ક્ષેત્રનું પરિમાણ ભૂલી જવાથી, રસ્તાનો સંદેહ થવા છતાં આગળ

\* લીઓ સ્વપતિ સંતોષ પરયુદ્ધ વિવર્જન બોલવું જોઈએ.

● અપરિગૃહિયા - અપરિગૃહિતાની સાથે ગમન કર્યું હોય, એવું પુરુષે બોલવું જોઈએ. સ્વીને ઈતરિયપરિગૃહિય ઈત્વરપરિગૃહિત (થોડા સમય માટે પ્રતિકૃપથી સ્વીકાર કરેલ) અને અપરિગૃહિયં અપરિગૃહિત (પ્રતિકૃપથી સ્વીકાર નહિ કરેલ જાર વગેરે) પુરુષ સાથે ગમન કર્યું હોય એવું બોલવું જોઈએ.

ચોથા સ્થૂલની ટિપ્પણી - જે શાવકોએ જીવન પર્યંત સંપૂર્ણ મૈથુનનો પરિત્યાગ કરી દીધો હોય તેનું ચોથું બ્રત સ્વદાર સંતોષ પરદાર વિવર્જન ન થઈને સર્વ મૈથુન વેરમણ રૂપ હોય છે, પરંતુ પાઠમાં પરિવર્તન કરવું શક્ય નથી કારણ કે સર્વ મૈથુન વેરમણની પ્રતિજ્ઞાવાળા શાવકે સ્વખી ગમન સંબંધી અતિચારનું પ્રતિકમણ પણ કરવું જોઈએ. સ્વખીગમનને પાંચ અતિચારોમાં નથી લેવાયા. આથી તેમને માટે અતિચારોના પાઠમાં પણ બિન્નતા આવશે. જો કે પ્રતિકમણ સૂત્રમાં અગાર ધર્મના વ્રતો તેમ જ અતિચારો સંબંધી સમુચ્ચય પાઠ ગ્રહણ કરેલા છે, છતાં પણ પત્યેક વ્યક્તિની પ્રતિજ્ઞામાં જ ન્યૂનાવિકતા છે તેનો સમાવેશ પ્રતિકમણ સૂત્રમાં સંભવ નથી.

ঝી ખુલ્લી જમીન.

\* નિર્મિત મકાન, દુકાન આંદિ.

ચલાયું હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ ભિચ્છામિ દુક્કડં.

**સાતમા ઉપભોગ પરિભોગ - પરિમાણ ક્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તં જહા (૧) પચ્ચાફાળા ઉપરાંત સચેત વસ્તુઓનો આહાર કર્યો હોય, (૨) સચેત મ્રતિબધ આહાર કર્યો હોય, (૩) અપકવ આહાર કર્યો હોય. (૪) દુષ્પકવ આહાર કર્યો હોય, (૫) તુચ્છૌષધિ \*આહાર કર્યો હોય, આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ ભિચ્છામિ દુક્કડં.**

પંદર કર્માદાન<sup>ઝ</sup> સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તં જહા (૧) ઈંગાલ કર્મે (૨) વાળ કર્મે (૩) સાડી કર્મે, (૪) ભાડી કર્મે (૫) ફોડી કર્મે (૬) દંત વાળિજજે (૭) લફ્ફખ - વાળિજજે, (૮) રસ વાળિજજે, (૯) કેસ વાળિજજે (૧૦) વિસ વાળિજજે (૧૧) જંતપીલાળ કર્મે (૧૨) નિલંધાળકર્મે (૧૩) દવળિદાવાળયા (૧૪) સર\*-દહ - તલાગ પરિસોસાળયા (૧૫) \*અસરી - પોસાળયા, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ ભિચ્છામિ દુક્કડં.

- (૧) ઈંગાલ કર્મે - (અંગાર કર્મ) જંગલને ખરીદીને તેમ જ ઠેકો લઈને, કોલસા બનાવવા અને વેચવાનો ધંધો કરવો. ઈટ, ભટ્ટી વગેરે લગાવવા અંગારકર્મ છે. એમાં છકાયની હિંસા થાય છે.
- (૨) વાળકર્મે - (વન કર્મ) જંગલને ખરીદીને, વૃક્ષોને કાપીને વેચવા તથા તેનાથી આજીવિકા ચલાવવી તે વન કર્મ છે.
- (૩) સાડીકર્મે (શાકટિક કર્મ) - ગાડી, રથ, જહાજ આદિ વાહન બનાવવા અને વેચવાનો વ્યાપાર કરી, આજીવિકા ચલાવવી શાકટિક કર્મ છે.
- (૪) ભાડીકર્મે (ભાટિ કર્મ) - ગાડી આદિથી બીજાનો સામાન ભાડા પર લઈ જવો તથા બળદ, ઘોડા આદિને ભાડે આપવા આ પ્રકારે ભાડાથી આજીવિકા ચલાવવી ભાડી કર્મ છે.

\* જેમાં ખાવા યોગ્ય અંશ થોડા હોય અને ફેંકવા યોગ્ય વધારે હોય, તેને તુચ્છૌષધિ કહે છે. જેવી રીતે મૂંગની કાચ્ચી ફળી, સીતાકળા, શેરરી વગેરે.

ઝ અધિક હિંસાવાળા વ્યાપારથી આજીવિકા ચલાવવી કર્માદાન છે અથવા જે વ્યાપારથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવરાળીય વગેરે કર્મોનો બંધ થાય છે, તેને કર્માદાન કહે છે. આ શ્રાવકને જાળવા યોગ્ય છે. પરંતુ આચરણ કરવા યોગ્ય નથી.

\* શ્રી ભગવતી સૂત્ર હુરિલદીયાવશક વૃત્તિ, ઉત્તલિમિત આવશ્યકવ્યૂહરિમાં પરિસોસાળયા પાઠ છે.

❖ શ્રી ભગવતી સૂત્ર વગેરે ઉપર્યુક્ત ગ્રંથો તેમ જ નિર્યુક્તિ, દિપીકા, આવશ્યક ચૂર્જિમાં અસરીજાળ પોષાળયા પાઠની બદલે અસરી-પોષાળયા પાઠ છે.

- (૫) ફોડીકમ્બે (સ્ફોટક કર્મ) - સુરંગ આદિથી પૃથ્વીને ફોડવી અને ખાણમાંથી નીકળેલા પત્થર, માટી, ધાતુ વગેરે ખનીજ પદાર્થોને વેચીને આજીવિકા ચલાવવી અથવા જમીન ખરીદીને અથવા ઠેકો લઈને જમીન ખોદવી અને આ પ્રકારે આજીવિકા ચલાવવી સ્ફોટક કર્મ છે. એતો કરવી કર્મદાનમાં નથી આવતી.
- (૬) દંતવાણિજજે (દંત વાણિજ્ય) - હાથીદાંત, શંખ, ચામડા, ફર, હાડકા, શીંગડા આદિ ખરીદી-વેચવાનો વ્યાપાર કરી, આજીવિકા ચલાવવી દંત વાણિજ્ય કર્મ છે. આ વ્યાપાર કરવાવાળા લોકો હાથીદાંત વગેરે કાઢવાવાળાને પહેલાં જ રૂપિયા આપી દે છે અને તે લોકો હાથી આદિની હિંસા કરી, હાથીદાંત લાવીને આપે છે. આ પ્રકારનો વ્યાપાર પણ હિંસાકારી છે.
- (૭) લફ્ખવાણિજજે (લાક્ષા વાણિજ્ય) - લાખનો કય-વિકય કરી આજીવિકા ચલાવવી તે લાક્ષા વાણિજ્ય છે. તેમાં ત્રસ જીવોની મોટા પ્રમાણમાં હિંસા થાય છે.
- (૮) રસવાણિજજે (રસ વાણિજ્ય) - મટિરા આદિ બનાવીને વેચવાનો ધંધો કરી, આજીવિકા ચલાવવી રસ વાણિજ્ય છે. મટિરા બનાવવામાં હિંસા તો થાય જ છે, પરંતુ તેને પીવાથી ઘણા બધા દોષોની સંભાવના પણ છે.
- (૯) કેસવાણિજજે (કેશ વાણિજ્ય) - કેશવાળી સ્વીને ખરીદીને બીજી જગ્યાએ વધારે મૂલ્યમાં વેચવાનો ધંધો કરવો અથવા ફર વગેરેનો વ્યાપાર કરવો કેશ વાણિજ્ય છે.
- (૧૦) વિસવાણિજજે (વિષ વાણિજ્ય) - વિષ, અફીંગ વગેરે વેચવાનો ધંધો કરવો, કીડી-ઉંદર વગેરેને મારવાની દવા, પાવડરનો આદિનો વ્યાપાર વિષ-વાણિજ્ય છે. તેમાં ઘણાં બધા જીવોની હિંસા થાય છે.
- (૧૧) જંતપીલાણ કમ્બે (યંત્ર પીડન કર્મ) - તલ, શેરડી વગેરે પીલવાના યંત્ર, સંચા ચરખા આદિથી તલ, શેરડી વગેરે પીલવાના ધંધા કરવા યંત્ર પીડન કર્મ છે. તે સમયમાં પ્રાય : આ જ યંત્ર પ્રસિદ્ધ હતા. આજના યુગમાં મહાઆરંભ કરવાવાળા જેટલા પણ યંત્ર છે.... તેને પણ ઉપલક્ષણથી યંત્ર પીડન કર્મમાં સમાવેશ કરવામાં આવે છે.
- (૧૨) નિલંઘણકમ્બે (નિલંઘણ કર્મ) - બળદ, ઘોડા વગેરેને નયુંસક બનાવવાનો ધંધો કરવો નિલંઘણ કર્મ છે.

(૧૩) દવળિદાવણ્યા - (દાવાનિદાપનતા) - કેત્રાદિ સાફ કરવા માટે જંગલમાં આગ લગાડવી દાવાનિ - દાપનતા છે. એમાં લાખો જીવોની હિંસા થાય છે.

(૧૪) સર-દહુ-તલાય-પરિસોસણ્યા (સરોહુદતડાગ પરિશોષણતા) ઘઉં વગેરે અનાજ વાવવા માટે સરોવર, ઝૂવા, તળાવ, આદિ ને ઉલેચવા સરોહુદાતડાગ પરિશોષણતા છે.

(૧૫) અસર્દી - પોષણ્યા (અસતી પોષણતા) - આજીવિકા માટે દુશ્યરિત્ર સ્વીઓનું પોષણ કરવું અસતી પોષણતા છે.

આઈમા અનર્થદંડ (વેરમણ) વ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો તં જણા (૧) કામવિકાર ઉત્પન્ન થાય તેવી કથા કહેવી, (૨) ભંડ-કુચેષ્ટા કરી હોય, (૩) મુખરી વચન બોલ્યા હોય, (૪) અધિકરણ એટલે હિંસાકારી ઉપકરણો વસાવ્યા હોય, (૫) ઉપભોગ-પરિભોગમાં અતિ આસક્તભાવ રાખ્યો હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ મિચછા મિ દુક્કડં.

નવમા સામાયિક વ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો તં જણા - (૧-૩) મન-વચન અને કાયાના અશુભ યોગ પ્રવર્તાવ્યા હોય (૪) સામાયિકની સ્મૃતિ ન રાખી હોય (૫) સમય પૂર્ણ થયા પહેલા સામાયિક પારી લીધી હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ મિચછામિ દુક્કડં.

દસમા દેશાવકાસિક વ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો તં જણા - (૧) મર્યાદા બહારથી વસ્તુ મંગાવી હોય, (૨) મોકલાવી હોય, (૩) અવાજ કરીને મર્યાદાના બહારથી કોઈ બોલાવેલ હોય, (૪) રૂપ બતાવીને પોતાનો ભાવ પ્રગત કરેલ હોય, (૫) પથરો વગેરે ફેંકીને મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ મિચછામિ દુક્કડં.

અગિયારમા પ્રતિપૂર્ણ પૌષ્ઠ વ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો તં જણા (૧) પૌષ્ઠમાં શાયા-સંથારા ન જોયા હોય અથવા સારી રીતે ન જોયા હોય, (૨) પ્રમાર્જન ન કર્યું હોય અથવા સારી રીતે ન કર્યું હોય, (૩) ઉચ્ચાર-પાસવણ ભૂમિને જોઈ ન હોય અથવા સારી રીતે જોઈ ન હોય, (૪) પૂંજી ન હોય અથવા સારી રીતે પૂંજી ન હોય, (૫) ઉપવાસયુક્ત પૌષ્ઠનું સમ્યક પ્રકારે પાલન ન કર્યું હોય,

આ અતિયારોમાંથી મને કોઈ અતિયાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ મિચછામિ દુક્કડં.

બારમા અતિથિ સંવિભાગ વ્રતના વિષયમાં જે કોઈ અતિયાર લાગ્યો હોય તો તં જહા (૧) અચેત વસ્તુ સચેત પર રાખી હોય, (૨) અચેત વસ્તુને સચેતથી ઢાંકી હોય, (૩) સાધુઓને બિક્ષા આપવાનો સમય ટાળી દીધો હોય, (૪) દાન નહિ દેવાની બુદ્ધિથી પોતાની વસ્તુને બીજાની કહી હોય, (૫) ઈર્ઝા ભાવથી દાન આપ્યું હોય, આ અતિયારોમાંથી મને કોઈ અતિયાર લાગ્યો હોય તો આજના દિવસ સંબંધી તસ્સ મિચછામિ દુક્કડં.

## (૯) સંલેખનાના પાંચ અતિયારનો પાઠ

અપરિદ્ધિમ મારણાંતિય સંલેહણા જૂસણા આરાહણાએ પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા ઈહ લોગાસંસાપાંગો પરલોગાસંસાપાંગો જીવિયાસંસાપાંગો મરણાસંસાપાંગો કામભોગાસંસાપાંગો, જો મે દેવસિઓ અઈયારો કાંઈ તસ્સ મિચછામિ દુક્કડં.

અપરિદ્ધિમ	- અંતિમ.
મારણાંતિય	- મરણ સમય સંબંધી.
સંલેહણા	- સંલેખના-કખાય, શરીર અને મમત્વ વગેરેને કૃશા (દુર્બળ) કરવા માટે જે તપ વિશેષ થાય છે, તે સંલેખના છે.
જૂસણા	- સંલેખનાનું સેવન કરવું.
આરાહણાએ	- સંલેખનાનાં અંતિમ કાળ સુધી પાલન કરવા માટે....
ઈહલોગાસંસાપાંગો	- આ લોકમાં રાજા, ચક્રવર્તી વગેરેના સુખની કામના કરવી.
પરલોગાસંસાપાંગો	- પરલોકમાં દેવતા, ઈન્દ્ર આદિના સુખની કામના કરવી.
જીવિયાસંસાપાંગો	- મહિમા, પ્રશંસા ફેલાય તે માટે વધારે સમય સુધી જીવિત રહેવાની આકાંક્ષા કરવી.
મરણાસંસાપાંગો	- કષ્ટ આવવા પર જઈદી મરવાની ઈચ્છા કરવી.
કામભોગાસંસાપાંગો	- કામભોગની અભિલાષા કરવી.

ભાવાર્થ :- અંતિમ મરણ સમય સંબંધી સંલેખણાના વિષયમાં કોઈ દોષ લાગ્યો હોય તો મેં રાજા, ચક્રવર્તી આદિ આ લોક, દેવ, ઈન્દ્ર, આદિ પરલોક સંબંધી જૈન સંસ્કાર પાદ્યક્રમ ભાગ-૪ ..... 21

સુખની આકંક્ષા કરી હોય, પ્રશંસા થવા પર ઘણા સમય સુધી જવવાની ઈચ્છા કરી હોય, દુઃખમાં વ્યાકુળ થઈને જલ્દી મરવાની અભિલાષા કરી હોય તથા કામબોગની અભિલાષા કરી હોય તો હું તેની અલોચના કરું છું મારા તે બધા પાપ નિષ્ફળ થાઓ.

## ૭. અઠાર પાપસ્થાનનો પાઠ

અઠાર પાપસ્થાન - (૧) ગ્રાણતિપાત (૨) મૃષાવાદ (૩) અદતાદાન (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) કોધ (૭) માન (૮) માયા (૯) લોભ (૧૦) રાગ (૧૧) દ્વેષ (૧૨) કલાહ (૧૩) અભ્યાખ્યાન (૧૪) પૈશુન્ય (૧૫) પરપરિવાદ (૧૬) રતિ અરતિ (૧૭) માયા -મૃષાવાદ (૧૮) મિથ્યાદર્શન શલ્ય - આ અઠાર પાપસ્થાનોમાંથી કોઈનું સેવન કર્યું હોય, કરાવ્યું હોય અને કરતાને અનુમોદન આપ્યું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવલી ભગવાનની સાક્ષીએ તરસ્સ મિથ્યામિ દુક્કડ.

ગ્રાણતિપાત	- જીવહિસા, ગ્રાણીઓનો વધ.
મૃષાવાદ	- અસત્ય, ખોટું.
અદતાદાન	- ચોરી (આપ્યા વિના ગ્રહણ કરવું.)
મૈથુન	- અબ્રથયર્થ, કુશીલ
પરિગ્રહ	- મૂર્ખા, મમત્વ, ધનાદિ દ્રવ્ય.
કોધ	- રોષ, ગુસ્સો, કોપ.
માન	- અહંકાર, ધમંડ.
માયા	- છળ, કપટ.
લોભ	- લાલચ, તૃષ્ણા.
રાગ	- રાગ, માયા અને લોભજન્ય આત્માના વિભાવ પરિણામ.
દ્વેષ	- દ્વેષ, કોધ અને માનજન્ય આત્માના વિભાવ પરિણામ.
કલાહ	- કલેશ, ઝઘડા.
અભ્યાખ્યાન	- ખોટું આળ મૂકવું, કલંક લગાડવું.
પૈશુન્ય	- બીજાની ચુગલી કરવી, દોષ પ્રગટ કરવો.
પરપરિવાદ	- બીજાની નિંદા કરવી, બીજાનું વાંકું બોલવું.
રતિ	- ખરાબ કાર્યોમાં ચિત્તને લગાવવું, પાપના કામમાં ખુશ થવું.
અરતિ	- ધ્યાન, સંયમ આદિમાં ચિત્તને ન લગાવવું, ધર્મના કામમાં નાખુશ થવું.

- માયા-મૃષાવાદ** - કપટ સહિત ખોટું બોલવું.  
**મિથ્યાદર્શનશાલ્ય** - અતત્ત્વમાં તત્ત્વ અને તત્ત્વમાં અતત્ત્વની શ્રદ્ધા કરવી.  
 શ્રદ્ધાથી વિપરીત કરવું.

**વિધિ :-** કાયોત્સર્ગ પૂરો થવા પર ‘નમો અરિહંતાણાં’ બોલીને કાયોત્સર્ગ પારીને પછી નવકારમંત્ર તેમ જ કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. પછી ત્રાણવાર તિક્ખુતોના પાઠથી વંદના કરીને બીજા ચઉવીસત્યથ આવશ્યકની આજ્ઞા છે, એવું કહીને ઊભા ઊભા લોગસ્સ બોલવો. પછી ત્રાણવાર તિક્ખુતોના પાઠથી વંદના કરીને ‘ત્રીજા વંદના આવશ્યકની’ આજ્ઞા છે, એવું કહીને બે વાર ‘ઈચામિ ખમાસમણા’નો પાઠ બોલવો.

## ૮. ઈચ્છામિ ખમાસમણોનો પાઠ

ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જવણિજજાંએ નિસીહિયાએ અણુજાણાં મે મિઉગાંઠ નિસીહિ અહો કાય કાય સંફાસં ખમણિજજો બે કિલામો આપ્પકિલંતાણાં બહુસુભેણાં બે દિવસો વઈકંકતો<sup>૧</sup> જતા બે જવણિજજં ચ બે ખામેમિ ખમાસમણો દેવસિયં વઈકકમં<sup>૨</sup> આવસ્સિયાએ પડિકકમામિ, ખમાસમણાણાં દેવસિયાએ આસાયણાએ<sup>૩</sup> તિતીસન્નયરાએ જં કિ ચિ મિચ્છાએ મણદુકુકડાએ વયદુકુકડાએ કાયદુકુકડાએ કોહાએ માણાએ માયાએ લોહાએ સવ્વકાલિયાએ સવ્વમિચ્છોવયારાએ સવ્વધમ્માઈકમણાએ આસાયણાએ જો મે દેવસિઓ અઈયારો<sup>૪</sup> કાં તસ્સ ખમાસમણો પડિકકમામિ નિંદામિ ગારિહુમિ આપ્પાણાં વોસિરામિ.

**નોટ - રાઈય પ્રતિકમણામાં -** દિવસો વઈકંકતોના સ્થાન પર “રાઈય વઈકંકતો” દેવસિયં વઈકકમંના સ્થાન પર ‘રાઈય વઈકકમં’<sup>૨</sup> દેવસિયાએ આસાયણાએના સ્થાન પર રાઈયાએ આસાયણાએ<sup>૩</sup> દેવસિઓ અઈયારોના સ્થાન ‘પર રાઈઓ અઈયારો’ બોલવું.

પાણિક પ્રતિકમણાણાં દિવસો વઈકંકતોના સ્થાન પર પક્ખિઓ વઈકંકતો<sup>૧</sup>, દેવસિયં વઈકકમંના સ્થાન પર પક્ખિયં વઈકકમં<sup>૨</sup>, દેવસિયાએ આસાયણાએના સ્થાન પર પક્ખિયાએ આસાયણાએ<sup>૩</sup> દેવસિઓ અઈયારોના સ્થાન પર પક્ખિઓ અઈયારો<sup>૪</sup> બોલવું.

ચાતુર્માસિક પ્રતિકમણામાં દિવસો વઈકંકતોના સ્થાન પર ચાઉમાસાઓ વઈકંકતો<sup>૧</sup>, દેવસિયં વઈકપના સ્થળ પર ‘ચાઉમાસિયં વઈકકમં<sup>૨</sup>, દેવસિયાએ આસાયણાએના સ્થાન પર ચાઉમાસિયાએ આસાયણાએ<sup>૩</sup>, દેવસિઓ અઈયારોના સ્થાન પર ચાઉમાસિઓ અઈયારો<sup>૪</sup> તેમ જ સંવત્તસરી પ્રતિકમણામાં દિવસો વઈકંકતોના સ્થાન પર ‘સંવચ્છરો વઈકંકતો’ દેવસિયં વઈકકમંના સ્થાન પર ‘સંવચ્છરો વઈકકમં’<sup>૨</sup>, દેવસિયાએ આસાયણાએના સ્થાન પર ‘સંવચ્છરો આસાયણાએ’<sup>૩</sup> દેવસિયો અઈયારોના સ્થાન પર ‘સંવચ્છરિઓ અઈયારો’<sup>૪</sup> પાઠ બોલવો જોઈએ.

ઈચ્છામિ	- હું ઈચ્છું છું.
ખમાસમણો	- હે ક્ષમાવાન શ્રમણા!
વંદિં	- વંદના કરવા માટે
જવાણિજજાએ	- શક્તિ અનુસાર.
નિસીહિયાએ	- પાપ કિયાથી નિવૃત્ત થયેલા શરીરથી.
આણુજાણાહુ	- આજ્ઞા આપો.
મે	- મને
મિઉગ્ગાહું	- પરિમિત ભૂમિ (અવગ્રહ) માં પ્રવેશ કરવાની.
નિસીહિ	- પાપ કિયાને રોકીને.
અહો કાયં	- (આપના) ચરણોને.
કાય સંફકાસં	- મસ્તકથી સ્પર્શ કરું છું. મારા સ્પર્શથી.
ખમણિજજો	- ક્ષમાને યોગ્ય છું.
ભે	- આપને
કિલામો	- બાધા પીડા થઈ હોય.
અપ્પકિલંતાણં	- અદ્ય દેહ જ્વાનિવાળા
બહુસુભેણં	- ખૂબ શુભ કિયાઓથી
ભે	- આપનો.
દિવસો	- દિવસ
વઈકુંતો	- વ્યતીત થયો છે ?
જતા	- સંયમ યાત્રા
ભે	- આપની (નિર્બધ છે ?)
જવાણિજજં	- મન તથા ઈન્દ્રિયોના દોષ શાંત હોવાથી સ્વસ્થ છે. ?
ચ	- અને
ભે	- આપને
ખામેભિ	- ખમાવું છું.
ખમાસમણો	- હે ક્ષમાશ્રમણા !

નોટ - બીજા ખમાસમણોમાં આવરિસયાએ બોલવું નહીં.

દેવસિયં	- દિવસ સંબંધી
વઈકકમ્	- અપરાધની
આવસ્થિયાએ	- આવશ્યક કિયા કરતા જે પણ વિપરીત અનુષ્ઠાન થયા હોય તો તેનાથી.
પડિકકમાભિ	- નિવૃત્ત થાઉં છું.
ખમાસમણાણં	- આપ શ્રમાશ્રમણની
દેવસિયાએ	- દિવસ સંબંધી.
આસાયણાએ	- આશાતના દ્વારા.
તિતીસન્નયરાએ	- તેતીસમાંથી કોઈપણ
જં કિંચિ	- જે કાંઈપણ.
મિથ્યાએ	- મિથ્યા ભાવથી કરેલી.
મણા દુકકડાએ	- દુષ્ટ મનથી કરેલી.
વય દુકકડાએ	- દુર્વચનથી કરેલી.
કાય દુકકડાએ	- શરીરની દુષ્ટ ચેષ્ટાથી કરેલી.
કોહુએ	- કોધથી કરેલી.
માણાએ	- માનથી કરેલી.
માયાએ	- માયાથી કરેલી.
લોહુએ	- લોભથી કરેલી.
સત્વકાલિયાએ	- સર્વકાળમાં કરેલી. (સંબંધી)
સત્વમિથ્યોવયારાએ	- સર્વ મિથ્યા આચારથી પૂર્ણ.
સત્વધ્રમાઈકમણાએ	- પાંચ સમિતિ, ત્રણ ગુમિ અષ્ટ પ્રવચન ધર્મોનું ઉલ્લંઘન કરવાવાળા.
આસાયણાએ	- આશાતનાથી
જો	- જો
મે	- મે
દેવસિઓ	- દિવસ સંબંધી
અઈયારો	- અતિયાર
કાંઓ	- કર્યા હોય.

તસ્સ	- તેનું
ખમાસમણો	- હે ક્ષમાશ્રમાણ
પડિકકમાભિ	- પ્રતિકમાણ કરું છું.
નિંદાભિ	- (તેની) નિંદા કરું છું.
ગરિહાભિ	- ગુરુ સાક્ષીએ વિશેષ નિંદા કરું છું.
અપ્યાણ	- (આશાતના કરવાવાળા) પોતાના આત્માને.
વોસિરાભિ	- ત્યાગ કરું છું અર્થાત् પાપ વ્યાપારોથી અલગ કરું છું.

**ભાવાર્થ -** હે ક્ષમાવાન શ્રમાણ ! હું પોતાના શરીરને પાપકિયાથી દૂર કરીને, શક્તિ અનુસાર વંદના કરવા ઈચ્છું છું, માટે મને પરિમિત ભૂમિ (અવગ્રહ)માં પ્રવેશ કરવાની આજ્ઞા આપો. પાપકિયાને રોકીને હું આપના ચરણોને પોતાના મસ્તકથી સ્પર્શ કરું છું. મારો સ્પર્શ કરવાથી આપને બાધા થઈ હોય તો મને ક્ષમા કરજો. આપને અદ્ય જ્લાન અવસ્થામાં રહીને, ખૂબ શુભ કિયાઓમાં દિવસ વિતાવ્યો છે ? આપની સંયમ યાત્રા નિર્બાધ (બાધા-પીડા રહિત) છે ? અને આપનું શરીર મન તથા ઈન્ડ્રિયોના દોષો શાંત થવાથી સ્વસ્થ છે ? હે ક્ષમાવાન શ્રમાણ ! હું આપને દિવસ સંબંધી અપરાધ માટે ખમાવું છું અને આવશ્યક કિયા કરવામાં જો વિપરીત અનુષ્ઠાન થયું હોય તો તેનાથી નિવૃત્ત થાઉં છું. આપ ક્ષમાશ્રમાણની આજના દિવસમાં તેનીસમાંથી કોઈપણ આશાતના દ્વારા મારાથી જો અતિચારનું સેવન થયું હોય તો, તેનું હું પ્રતિકમાણ કરું છું તથા મિથ્યાત્વથી કરેલી, દુષ્ટ મન-વચન- અને કાયાથી કરેલી, કોધ, માન, માયા અને લોભથી કરેલી આશાતના દ્વારા જો મેં દિવસ સંબંધી અતિચારનું સેવન કર્યું હોય તેનું હું પ્રતિકમાણ કરું છું તથા સર્વકાળ સંબંધી, સર્વ મિથ્યા આચરણોથી પરિપૂર્ણ અને બધા પ્રકારના ધર્મનું ઉત્લંઘન કરવાવાળી આશાતનાથી જો મેં દિવસ સંબંધી અતિચાર કર્યો હોય, હે ક્ષમાશ્રમાણ ! તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તેની હું નિંદા કરું છું, ગુરુની સામે ગહ્ના કરું છું અને આત્માને પાપ સંબંધી વ્યાપારોથી નિવૃત્ત કરું છું.

**વિધિ :-** ઊભા રહીને ત્રાણવાર તિક્ખુતોના પાઠથી વિધિપૂર્વક વંદના કરીને ‘ચોથા પ્રતિકમાણ આવશ્યકની આજ્ઞા છે.’ એવું બોલીને ઊભા થઈને ધ્યાનમાં કહેલા બધા પાઠ પ્રગટ બોલવા.

તેના પછી પાઠ નં. ૮ “સમુચ્ચય પાઠ” તથા પાઠ નં. ૧૦ “તસ્સ સવ્વસ્સ”નો પાઠ બોલવો.

## ખમાસમાણોની વિધિ

ગીભા થઈને આસનથી નીચે ઉત્તરીને, બન્ને હાથ જોડીને, ઈચ્છામિ ખમાસમાણોનો પાઠ પ્રારંભ કરવો.

“અણુજાણાહ મે મિઉઝાહું” શબ્દ આવે ત્યાં થોડું નમીને, થોડુંક આગળ જઈને નિસ્સીહિ શબ્દ બોલતા ઉત્કુટક આસને (બન્ને ઘૂંટણો ગીભા કરીને) બેસવું. પછી બન્ને કોણીઓને ઘૂંટણની વચ્ચે રાખીને, બન્ને હાથ જોડી, મસ્તક નમાવી ‘અહો’ ‘કાયે’ ‘કાય’ આ છ અક્ષરોના ઉચ્ચારણ કરતા સમયે ત્રણ આવર્તન કરવા. ચરણ સ્પર્શની ભાવનાથી દસ આંગળીઓને ભૂમિ પર લગાડીને મંદ સ્વરથી ‘અ’ અક્ષરનું ઉચ્ચારણ કરવું, પછી દસ આંગળીઓને મસ્તક પર લગાડતા ‘હો’ અક્ષર ઊંચા સ્વરથી બોલું. આ પહેલું આવર્તન થયું. આ વિધિથી કા અને યં બંને અક્ષરોના ઉચ્ચારણથી બીજું આવર્તન કરવું. આ વિધિથી ‘કા’ અને ‘યં’ બન્ને અક્ષરોના ઉચ્ચારણથી ત્રીજું આવર્તન કરવું. તેના પછી સંફાસં બોલતા બન્ને હાથ લાંબા કરી દસ આંગળીઓથી ગુરુ મહારાજના ચરણ સ્પર્શ કરી અથવા ચરણ સ્પર્શ કરવાની ભાવના મનમાં લાવવી. પછી ખમણિજજીથી લઈને દિવસો વઈકકંતો સુધીનો પાઠ બોલવો. ત્યારપછી જતા બે જ વ હિં જજં ચ બે અક્ષરોનું ઉચ્ચારણ કરતા ત્રણ આવર્તન કરવા. ચરણ સ્પર્શની ભાવનાથી દસે આંગળીઓ ભૂમિ પર લગાવીને મંદ સ્વરથી ‘જ’ નો ઉચ્ચારણ, હાથોને મસ્તક તરફ લઈ જતા ‘તા’ ને મધ્યમ સ્વરથી તેમ જ દસે આંગળીઓ મસ્તક પર લગાડતા ઉચ્ચ સ્વરથી ‘ભે’ નો ઉચ્ચારણ કરે. આ ગ્રકારે અન્ય બે આવર્તન કરવા. તેના પછી “ખામેમિ ખમાસમાણો” બોલતા બન્ને હાથ લાંબા કરી દસે આંગળીઓથી ગુરુ મહારાજના ચરણ સ્પર્શ કરે અથવા ચરણ સ્પર્શની ભાવના મનમાં લાવવી. પછી બન્ને હાથોને જોડીને મસ્તક પર લગાવી, ‘દેવસિયં વઈકકમં’ બોલવું અને આવસ્થિસિયાએ બોલતા ગીભા થવું અને શેષ પાઠ પૂરો કરવો. આ વિધિથી ઈચ્છામિ ખમાસમાણોનો પાઠ બીજી વાર બોલવો.

ઉપર લખેલા અનુસાર જ છ આવર્તન કરવા, પરંતુ આ વખતે આવસ્થિસિયાએ શબ્દ ન બોલવો. તથા આવસ્થિસિયાએ શબ્દ આવતા ગીભા થવાને બદલો બેઠા-બેઠા જ ગુરુના અવગ્રહમાં પૂરો પાઠ બોલવો.

## C. સમુર્ચયય પાઠ

આ ગ્રકારે ૧૪ જ્ઞાનના, ૫ દર્શન (સમ્યકૃત્વ) ના, ૬૦ ૧૨ ક્રતોના, ૧૫ કર્માદાનના, ૫ સંલેખનનાના આ ૮૮ અતિચારોમાંથી કોઈપણ અતિચારનું જાણતા-અજાણતા મન, વચ્ચન, કાચાથી સેવન કર્યું હોય, કરાવ્યું હોય અને કરવાવાળાનું ભલ્યું જાણ્યું હોય તો અનંત સિદ્ધ કેવળી, ભગવાનની સાક્ષીએ તસ્સ મિર્ચામિ દુક્કડું.

## ૧૦. તરસ સત્ત્વરસનો પાઠ

તરસ સત્ત્વરસસ \* દેવસિયરસસ અઈયારરસસ દુઃખભાસિય દુઃખ્યંતિય દુઃખ્યદ્વિયરસસ  
આલોચનાનો પડિક્કમાબિ.

તરસ	- તે
સત્ત્વરસ	- સર્વ
દેવસિયરસ	- દિવસ સંબંધી
અઈયારરસ	- અતિયારની
દુઃખભાસિય દુઃખ્યંતિય	- દુર્વચન, દુષ્ટ વિચાર તથા કાયા દ્વારા
દુઃખ્યદ્વિયરસસ	- કરેલા દુષ્ટ વ્યવહારની
આલોચનાનો	- આલોચના કરતા
પડિક્કમાબિ	- નિવૃત્ત થાઉં છું.

ભાવાર્થ :- દુર્વચન બોલીને, મનમાં ખરાબ વિચાર ઉત્પન્ન કરીને તથા કાયા દ્વારા દુષ્ટ વ્યવહાર (પ્રવૃત્તિ) કરીને, આજના દિવસ સંબંધી મને જે કોઈ અતિયાર લાગ્યા હોય, તેની આલોચના કરતા, તે પાપોથી નિવૃત્ત થાઉં છું.

વિધિ - તિકખુતોના પાઠથી ત્રાણવાર વંદના કરીને શ્રાવકસૂત્રની આજ્ઞા છે. આ પ્રકારે કહુને બેસીને જમાણો ઘૂંટણ ઊંચો કરીને નવકાર મંત્ર, કરેભિ ભંતે બોલવું. તેના પછી ઊભા થઈને ચયતારિ મંગલનો પાઠ મહારાજ સાહેબ હોય તો તેની સાંભળવો. ન હોય તો મોટા શ્રાવકથી સાંભળવો, નહિતર પોતે બોલવો.

## ૧૧. ચતારિ મંગલનો પાઠ

ચતારિ મંગલાં, અરિહંતા મંગલાં, સિદ્ધા મંગલાં, સાહુ મંગલાં, કેવલિ પણણાતો ધર્મો મંગલાં,

ચતારિ લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા,  
કેવલિ પણણાતો ધર્મો લોગુતમો.

ચતારિ શરણાં પવજજાભિ, અરિહંતે શરણાં પવજજાભિ, સિદ્ધે શરણાં  
પવજજાભિ, સાહુ શરણાં પવજજાભિ, કેવલિ પણણાતં ધર્મં શરણાં પવજજાભિ.

\* અહીં રાત્રિ પ્રતિકમણમાં ‘રાઈયરસસ’, પાખી પ્રતિકમણમાં પક્કખ્યરસસ, ચાતુર્માસિક પ્રતિકમણમાં ‘ચાઉમાસિયરસસ’, સંવત્સરી પ્રતિકમણમાં ‘સંવચ્છરિયરસસ’ પાઠ બોલવો.

અરિહુંતો કા શરણા, સિધ્યો કા શરણા, સાધુઓ કા શરણા, કેવળી પ્રદૂષિત ધર્મ કા શરણા.

ચાર શરણા, ફુઃખ હુરણા, ઔર ન શરણા હોયા  
જો ભવિ મ્રાણી આદરે, અક્ષય અમર પદ હોયા॥

ચતારિ મંગલં	- ચાર મંગલ છે.
અરિહુંતા મંગલં	- અરિહુંત મંગલ છે.
સિધ્યા મંગલં	- સિધ્ય મંગલ છે.
સાધુ મંગલં	- સાધુ મંગલ છે.
કેવલિપણણાતો ધર્મો મંગલં	- કેવળી પ્રદૂષિત ધર્મ મંગલ છે.
ચતારિ લોગુતમા	- ચાર લોકમાં ઉત્તમ છે.
અરિહુંતા લોગુતમા	- અરિહુંત લોકમાં ઉત્તમ છે.
સિધ્યા લોગુતમા	- સિધ્ય લોકમાં ઉત્તમ છે.
સાધુ લોગુતમા	- સાધુ લોકમાં ઉત્તમ છે.
કેવલી પણણાતો ધર્મો લોગુતમો	- કેવળી પ્રદૂષિત ધર્મ લોકમાં ઉત્તમ છે.
ચતારિ શરણં પવજજામિ	- ચાર શરણા ગ્રહણ કરું છું.
અરિહુંતે શરણં પવજજામિ	- અરિહુંત ભગવાનનું શરણં ગ્રહણ કરું છું.
સિધ્યે શરણં પવજજામિ	- સિધ્ય ભગવાનનું શરણં ગ્રહણ કરું છું.
સાધુ શરણં પવજજામિ	- સાધુઓનું શરણં ગ્રહણ કરું છું.
કેવલિ પણણાતં ધર્મં શરણં	- કેવળી પ્રદૂષિત ધર્મનું શરણં ગ્રહણ કરું છું.
પવજજામિ	

ભાવાર્થ :- આ લોકમાં અરિહુંત, સિધ્ય, સાધુ અને કેવળી પ્રદૂષિત ધર્મ એ ચાર મંગલ છે તથા લોકમાં શ્રેષ્ઠ છે. હું આ ચારેના શરાણા લઈ છું.

વિધિ :- જમાણો ઘૂંટાણ ઊંચો રાખીને બેઠા-બેઠા ઈચ્છામિ પડિકકમિઉ\* (પાઠ નં. ૨) ઈચ્છાંકરેણાં, આગમે તિવિહે, દસંણ સમકિત ૧૨ વ્રતોના પાઠ (પાઠ નં. ૧૩) બોલે.

\* પ્રથમ સામાચિક આવશ્યક તથા પાંચમો કાયોત્ત્સર્વ આવશ્યક કરતા પહેલા પાઠ નં. - ૨ 'ઈચ્છામિ ઢાઈઉ કાઉસ્સળાં' બોલાય છે, પરંતુ ચોથા આવશ્યકમાં માંગાલિક પછી ઈચ્છામિ 'ઢાઈઉ કાઉસ્સળાં'ના બદલે 'ઈચ્છામિ પડિકકમિઉ' બોલવો જોઈએ.

## ૧૨. દંસણ સમકિતનો પાઠ

દંસણ સમ્મત પરમત્થસંથવો વા, સુદીટથપરમત્થ - સેવણા વાવિ વાવન્ન  
કુંદસણ - વજજણા ય સમ્મત - સદ્ગદહણા

એવં સમાણોવાસાંએણાં સમ્મતસ્સ પંચ અઈયારા પેયાલા જાળિયવ્વા ન  
સમાયરિયવ્વા તં જહા - સંકા કંખા વિતિગિરછા પરપાસંડ પસંસા પરપાસંડ સંથવો  
જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ ભિચ્છામિ દુક્કડં.

દંસણ સમ્મતા	- સમ્યક્ક દર્શન
એવં	- આ પ્રકારે
સમાણોવાસાંએણાં	- શ્રમાણોપાસક દ્વારા
સમ્મતસ્સ	- સમ્યક્ત્વના
પંચ અઈયારા	- પાંચ અતિચાર
પેયાલા	- પ્રધાન
જાળિયવ્વા	- જાળવા યોગ્ય છે.
ન સમાયરિયવ્વા	- આચરણ કરવા યોગ્ય નથી.

## ૧૩. બાર પ્રતોના અતિચાર સહિત પાઠ

પહેલું અણુક્રત થૂલાઓ પાણાઈવાયાઓ વેરમણાં ત્રસ જીવ બેંઠિય, તેઠીઠિય,  
ચઉરિઠિય, પંચિઠિય જાણીને ઓળખીને સંકલ્પ કરીને તેમાં સ્વસંબંધી શરીરની અંદર  
પીડાકારી સઅપરાધીને છોડી નિરપરાધીને આકુણી (હાણવાની) બુદ્ધિથી હાણવાના  
પચ્યક્ખાણ જાવજજલવાએ દુવિહુણાં ન કરેમિ ન કારવેમિ મણસા, વયસા,  
કાયસા એવા પહેલા થૂલ ગ્રાણતિપાત વેરમણાં પ્રતના પંચ અઈયારા પેયાલા જાળિયવ્વા  
ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં-બંધે વહે છવિછેણે અઈભારે ભતપાણ વોચ્છેણે  
જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ ભિચ્છામિ દુક્કડં.

અણુક્રત	- મહુક્રતની અપેક્ષા નાના વ્રત.
થૂલાઓ	- સથૂલ મોટા

\* વિચ્છેણે પાઠ અશુદ્ધ હોવાથી 'વોચ્છેણે' કર્યું છે.

પાણાઈવાયાઓ	- પ્રાણતિપાતથી-જીવહિંસાથી
વેરમણાં	- નિવૃત થવું. અલગ થવું
પરચ્યક્ખાણા	- ત્યાગ
પેચાલા	- પ્રધાન
બંધે	- બાંધવું.
વહે	- નિર્દ્યતાથી પીટવું, ઊડો ઘા આપવો.
છવિચ્છેએ	- શરીરની ચામડીનું છેદન કરવું.
અઈભારે	- અધિક ભાર ભરવો.
ભતપાણા-વોચ્છેએ	- ખાવા પીવામાં અંતરાય પાડવી.

**ભાવાર્થ :** - હું સ્વસંબંધી, શરીરમાં પીડાકારી તથા અપરાધી જીવોને છોડીને બેઈન્ડ્રિય, ટેઈન્ડ્રિય, ચૌરેન્ડ્રિય અને પંચેન્ડ્રિય ત્રસ જીવોની હિંસાનો સંકલ્પ કરીને મન-વચન અને કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ અને જો મેં કોઈ જીવને બંધનમાં બાંધ્યા હોય, ચાખુક, લાકડી આદિથી માર્યા હોય, પીટચા હોય, કોઈ જીવની ચામડીનું છેદન કર્યું હોય, અધિક ભાર ભર્યો હોય તથા અન્ન-પાણીમાં અંતરાય પાડી હોય તો તે મારા બધા પાપ નિષ્ફળ થાય.

**બીજું આણુક્રત-થૂલાઓ મુસાવાયાઓ વેરમણાં** - કન્નાલીએ ગવાલીએં ભોમાલીએ નાસાવહારો (થાપણમોસો) કૂડસફિઝજે (કૂડી સાખ) ઈત્યાદિ મોટું જૂંકું બોલવાના પરચ્યક્ખાણા, જાવજજીવાએ દુવિહં તિવિહેણાં ન કરેમિ ન કારવેમિ માણસા વયસા કાયસા એવા બીજા સ્થૂલ મૃષાવાદ વેરમણાં પ્રતના પંચ અઈયારા જાણિયત્વા ન સમાપ્તિયત્વા તં જહા તે આલોઉં - સહસ્રસભક્ખાણે રહુસ્રસભક્ખાણે સદારમંતભેએ+ મોસોવાએસે કૂડલેહકરણે જો મેં દેવસિઓ અઈયારો કાંઠો તસ્સ મિચ્છામિ દુક્કં.

મુસાવાયાઓ	- મૃષાવાદથી
કન્નાલીએ	- કન્યા, વર આદિ મનુષ્ય સંબંધી જૂઠ.
ગવાલીએ	- ગાય, બેંસ વગેરે પશુ સંબંધી જૂઠ.
ભોમાલીએ	- ભૂમિ સંબંધી જૂઠ.

\* હારિભદ્રીયાવશ્યકવૃત્તિ, આવશ્યક ચૂંઝી આદિ આવશ્યક સંબંધી મ્રાચીન ગ્રંથ અનુસાર ગોવાલીએ શુદ્ધ નથી ગવાલીએ શુદ્ધ છે.

+ શ્રાવિકાઓએ સદારમંતભેએ'ના સ્થાને 'સભતાર મંતભેએ' બોલવું.

નાસાવહુરો	-
(થાપણમોસો)	થાપણ ઓળવવા સંબંધી જૂઠ.
કુડસક્રિખજે	- જૂઠી સાક્ષી આપવી.
સહસરભક્ખાણે	- વિચાર્યા વિના કોઈ પર ખોટો આરોપ લગાડવો.
રહુસ્સસરભક્ખાણે	- એકાંતમાં મંત્રણા (સલાહ) કરતા વ્યક્તિઓ પર ખોટો આરોપ લગાવવો.
સદારમન્તબેઝે	- પોતાની સ્વીની ગુપ્ત વાત પ્રગટ કરવી.
મોસોવચેસે	- ખોટા ઉપદેશ આપવા.
કુડલેહકરણે	- ખોટા લેખ લખવા.

**ભાવાર્થ :-** હું જન્મપર્યંત મન-વચન-કાયાથી સ્થૂલ જૂઠ બોલીશ નહિ, બોલાવીશ નહિ. કન્યા-વરના સંબંધમાં, ગાય, ભેંસ આદિ પશુઓના વિષયમાં તથા ભૂમિના વિષયમાં ક્યારે પણ અસત્ય નહિ બોલું. કોઈની પણ રાખેલી થાપણ ઓળવીશ નહિ અને થાપણ ઓછી-વધારે આપીશ નહિ. કોઈને ખોટી ગવાહી (સાક્ષી) આપીશ નહિ. જો મેં કોઈના પર ખોટું કલંક લગાડ્યું હોય, એકાંતમાં મંત્રણા કરતા વ્યક્તિ પર ખોટો આરોપ લગાડ્યો હોય, પોતાની સ્વીની ગુપ્ત વાત પ્રગટ કરી હોય, મિથ્યા ઉપદેશ આપ્યા હોય, ખોટા લેખ લખ્યા હોય તો મારા તે બધા પાપ નિષ્ફળ થાઓ.

**ત્રીજું આશુવ્રત થૂલાઓ અદિનાદાણાઓ વેરમણાં -** ખાતરખાણી ગાંઢી છોડી તાળા પર કુંચીએ કરી માર્ગમાં ચાલતાને લુંટી પડી વસ્તુ ધણિયાતી જાણીને લેવી ઈત્યાદિ મોટા અદતાદાનના પચ્ચક્ખાણ સગાસંબંધી વ્યાપાર સંબંધી તથા નભરમી વસ્તુ ઉપરાંત અદતાદાનના પચ્ચક્ખાણ જવજજીવાએ દુવિહં - તિવિહેણાં ન કરેભિ ન કારવેભિ માણસા વયસા કાયસા એવા ત્રીજા થૂલ અદતાદાન વેરમણાં ગ્રતના પંચ અઈયારા જાણિયવ્યા ન સમાયરિયવ્યા તં જહા તે આલોઉં તેજાહુડે, તક્કરપ્પાંઓ ગે વિરુદ્ધરજજાઈક્કમે • કુડતુલ કુડમાણે તપ્પદિરુવગવવહારે જો મે દેવસિઓ અઈયારો કાંઈ તસ્સ મિચ્છામિ દુક્કડં.

અદિનાદાણાઓ	- અદતાદાનથી, સ્વામીની આજ્ઞા વિના વસ્તુ લેવી
નભરમી	- શંકા રહિત

\* આવશ્યક ચૂણી આદિ માચીન ગ્રંથોમાં ‘તુલ’ શબ્દની જગ્યાએ તુલ શબ્દ છે.

તેનાહુડે	- ચોર પાસેથી ચોરેલી વસ્તુ લેવી.
તકકરપ્પાગો	- ચોરને મદદ કરી હોય.
વિરુદ્ધરજજાઈકમે	- રાજ્ય વિરુદ્ધ અતિકમાણ (ઉદ્દંધન) કરવું. યુદ્ધના સમયે રાજ્યમાં આજ્ઞા વિના આવવું-જવું.
કુડતુલ કુડમાણે	- ખોટા તોલ રાખવા તથા ખોટા ગજ આદિ માપ રાખવા.
તપ્પડિરુવગવવહારે	- વધારે મૂલ્યની વસ્તુમાં ઓછા મૂલ્યની વસ્તુ ભેળવવી. ઉત્તમ વસ્તુ બતાડીને નરસી વસ્તુ આપવી.

**ભાવાર્થ :-** હું કોઈના મકાનમાં બાકારું પાડીને અર્થાત् ભીત તોડીને, ગાંઢી ખોલીને, તાણા પર કુંચી લગાવીને અથવા તાણા તોડીને કોઈની પણ વસ્તુ લઈશ નહિ, માર્ગમાં ચાલતા કોઈને લૂંટીશ નહિ ઈત્યાદિ રૂપથી, સગાં-સંબંધી, વ્યાપાર સંબંધી, તથા પેટીલી વસ્તુ શંકારહિત ઉપરાંત, સ્થૂલ ચોરીને મન-વચન-કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, જો મેં ચોરીની વસ્તુ લીધી હોય, ચોરને સહાયતા કરી હોય અથવા ચોરી કરવાના ઉપાય બતાવ્યા હોય, યુદ્ધના સમયે રાજ્ય વિરુદ્ધ રાજ્યની સીમામાં આવ-જા કરી હોય, ખોટા તોલ અથવા માપ રાખ્યા હોય, અધિક મૂલ્યની વસ્તુમાં ઓછા મૂલ્યની વસ્તુ નાખી હોય (ભેળસેળ કરી હોય) અથવા ઉત્તમ વસ્તુ બતાવીને નરસી વસ્તુ આપી હોય તો મારા આ કુકૃત્યો (ખરાબ કામો) ની આલોચના કરું છું અને ઈચ્છનું છું કે મારા આ બધા પાપો નિષ્ફળ થાઓ.

**ચોથું આણુવત્ત-થૂલાઓ-મેહુણાઓ વેરમણાં - સદારસંતોષિએ\*** અવસેસ મેહુણવિહિં પચ્ચાંખામિ જાવજજીવાએ દેવ-દેવી સંબંધી દુવિહિ તિવિહેણાં ન કરેમિ ન કારવેમિ માણસા વયસા કાયસા તથા મનુષ્ય તિર્યચ સંબંધી એગાવિહું એગાવિહેણાં ન કરેમિ કાયસા એવા ચોથા સ્વદાર સંતોષ પરદાર વિવર્જન રૂપ<sup>o</sup> સ્થૂલ મૈથુન વેરમાણ વ્રતના પંચ અઈયારા જાળિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં

● સ્વીઓએ ‘સભતરિસંતોષિ’એ બોલવું જોઈએ.

\* ‘સ્વદાર સંતોષ-પરદાર વિવર્જન’ એવું પુરુષે બોલવું જોઈએ અને સ્વીને ‘સ્વપતિ સંતોષ - પરપુરુષ વિવર્જન’ એવું બોલવું જોઈએ.

ઈતరિયપરિણાહિયાગમાણે • આપરિણાહિયાગમાણે અનંતકીડા પરવિવાહકરાણે,  
કામભોગતિવ્વાભિલાસા જો મે દેવસિઓ અઈયારો કાંઠો તસ્સ મિશા મિ દુક્કં.

સંપુર્ણ કાવ્ય

- પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ રાખવો.

અવસેસ મેહુણવિલ્લિ

- અન્ય સમસ્ત પ્રકારના મૈથુનના સેવનનો.

પરચક્ષામિ

- त्याग करूँ छूँ.

## એગાવિલું એગાવિલેણું

- એક કરણું, એક યોગથી.

## ઈતరિયપરિવ્વાહિયાગમણે

- કેટલાક સમય માટે આધીન કરેલી ખીને ઈત્વરપરિગૃહિતા કહેવાય છે, તેની સાથે કીંડા કરવા માટે આલાપ-સંલાપ આદિ કરવા. અથવા અલ્પવયવાળી અર્થાત્ જેની વય (ઉભર) ભોગ યોગ્ય નથી થઈ, એવી પોતાની વિવાહિતા ખી સાથે ગમન કરવા માટે આલાપ-સંલાપદિ કરવા.

અપરિવ્વાહિયાગમણે

- વેશ્યા, અનાથ કન્યા, વિધવા, પરિત્યક્તા વગેરે અપરિગૃહિતા કહેવાય છે. જેની સાથે કીડા કરવાની માટે આલાપ-સંલાપાદિ કરવા અથવા જે કન્યાની સાથે સગાઈ થઈ ચૂકી છે, પરંતુ હજુ વિવાહ નથી થયા, એવી કન્યા સાથે ગમન કરવા માટે આલાપ-સંલાપાદિ કરવા અતિયાર છે કારણ કે તે પોતાની હોવા છતાં પણ અગૃહિતા છે.

અન્ગાંકીડા

- કામ-સેવનના પ્રાકૃતિક અંગ સિવાય અન્ય અંગો કે જે કામ સેવન માટે અનંગ છે તેની સાથે કીડા કરવી અનંગકીડા છે. સ્વયંસી સિવાય અન્ય ખીઓ સાથે મૈથુનક્રિયા વર્જને અનુરોગથી તેનું આલિંગન આદિ કરવાવાળાના ક્રત મહિન થાય છે, માટે તેને અતિયાર માનવામાં આવ્યો છે.

ਪਰਵਿਵਾਹੁਕਰਣੇ

- પોતાના અને પોતાના સંતાન સિવાય બીજાના વિવાહ કરાવવા.

## કામભોગતિવાભિલાષા

- કામભોગોની ઉત્કષ્ટ અભિલાષા કરવી..

- શાવિકાઓ - ઈતરિય પરિગ્રહિયગમાણે, અપરિગ્રહિયગમાણે બોલવું જોઈએ.

**ભાવાર્થ :-** હું જન્મ પર્યત પોતાની વિવાહિત ખીમાં જ સંતોષ રાખીને શેખ બધા પ્રકારના મૈથુન સેવનનો ત્યાગ કરું છું અર્થાત् દેવ-દેવી સંબંધી મૈથુનનું સેવન મન-વચન-કાયાથી નહિ કરીશ અને નહિ કરાવીશ તથા મનુષ્ય અને તિર્યચ સંબંધી મૈથુન સેવન કાયાથી નહિ કરું. જો મેં ઈત્વરિક પરિગૃહિતા અથવા અપરિગૃહિતા સાથે ગમન કરવા માટે આલાપ-સંલાપ કર્યો હોય, પ્રકૃતિ વિરુદ્ધ અંગોથી કામ-કીડા કરવાની ચેખટા કરી હોય, બીજાના વિવાહ કરાવવા માટે ઉઘમ થયો હોઉં કામભોગની તીવ્ર અભિલાષા કરી હોય તો હું આ દુષ્કૃત્યોની આલોચના કરું છું કે મારા બધા પાપ નિષ્ફળ થાય.

પાંચમું આણુવ્રત થૂલાઓ પરિગૃહાઓ વેરમણાં - ખેતરવત્થુનું યથા પરિમાણ, હિરણ્ય સુવાણિનું યથા પરિમાણ ધન-ધાન્યનું યથા પરિમાણ દુપદ - ચરુપદનું યથા પરિમાણ કુવિયનું યથા પરિમાણ જે પરિમાણ કર્યું છે તે ઉપરાંત પોતાનો પરિગ્રહ કરી રાખવાના પચ્ચક્ખાણ જાવજજીવાએ- એગવિહું તિવિહેણં ન કરોમિ મણુસા વયસા કાયસા એવા પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વેરણામં વ્રતના પંચ અઈયારા જાણુયાયવા ન સમાયરિયવા તં જહા તે આલોઉં ખેતરવત્થુ પમાણાઈકક્મે હિરણ્યા સુવાણા પચાણાઈકક્મે, ધન ધાન્ય પમાણાઈકક્મે દુપદ ચરુપદ પમાણાઈકક્મે કુવિય પમાણાઈકક્મે જો મેં દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં.

**ખેતરવત્થુ પમાણાઈકક્મે**

- ખેતર અને ઘર આદિના પરિમાણ (મર્યાદા)નું ઉલ્લંઘન કર્યું હોય.

**હિરણ્ય-સુવાણા પમાણાઈકક્મે** - સોના-ચાંદીના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય.

**ધન-ધાન્ય પમાણાઈકક્મે** - ધન-રૂપિયા અને ધાન્યના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય.

**દુપદ - ચરુપદ પમાણાઈકક્મે**

- દાસ-દાસી તથા ગાય-ઘોડા-હાથી આદિના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય.

**કુવિય પમાણાઈકક્મે**

- કાંસા, પીતળ, તાંબું, લોખંડ આદિ ધાતુ તથા તેનાથી બનેલા વાસણો આદિ ઘર સંબંધી વસ્તુઓના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય.

**ભાવાર્થ :-** - ખેત, મહેલ, મકાન, સોના-ચાંદી, દાસ-દાસી, ગાય, હાથી, ઘોડા ચાર પગ આદિ ધન-ધાન્ય તથા તેના સિવાય કાંસા, પીતળ, તાંબું, લોખંડ આદિ ધાતુ તથા એનાથી બનેલા વાસણ અને શચ્ચા, વસ્ત્ર વગેરે ઘર સંબંધી વસ્તુઓનું મેં જૈન સંસ્કાર પાદ્યક્મ ભાગ-૪ ..... 35

જે પરિમાણ કર્યું છે, તે ઉપરાંત હું સંપૂર્ણ પરિગ્રહનો મન-વચન-કાયાથી જાવજજીવ ત્યાગ કરું છું, જો મેં ખેતર, મહેલ, મકાનના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય, દાસ-દાસી વગેરે દ્વિપદ અને હાથી ઘોડા વગેરે ચોપગાની સંખ્યાનું ઉલ્લંઘન કર્યું હોય, ધન-ધાન્યના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય, સોના-ચાંદીના સિવાય બીજી ધાતુના બનેલા વાસાએ તથા શાયા, આસન, વસ્ત્ર આદિની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય, તો હું તેની આલોચના કરું છું અને ઈચ્છણું છું કે મારા બધા પાપ નિષ્ફળ થાઓ.

**ઇહું દિસિ ક્રત -** ઉદ્ઘટિસિનું યથા પરિમાણ અહોદિસિનું યથા પરિમાણ તિરિયદિસિનું યથા પરિમાણ એ યથા પરિમાણ કીધું છે તે ઉપરાંત સ્વેચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાના પચ્ચેફખાણ જાવજીવાએ એગવિહું<sup>\*</sup> - તિવિહેણં - ન કરેભિ - માણસા વયસા કાયસા તેમ જ છદ્દા દિશા ક્રતના પાંચ અઈયારા જાળિયત્વા ન સમાયરિયત્વા તં જહા તે આલોઉં ઉદ્ઘટિસિ પમાણાઈકક્રમે અહોદિસિપમાણાઈકક્રમે તિરિયદિસિપમાણાઈકક્રમે ખેતવુદ્ધી સઈઅન્તરદ્વાએ જો મે દેવસિઓ અઈયારો કાઓ તસ્સ મિચ્છામિ દુક્કડં.

**ઉદ્ઘટિસિ પમાણાઈકક્રમે** - ઉર્ધ્વ (ગેંચી) દિશાના પરિમાણ (મર્યાદા)નું ઉલ્લંઘન કર્યું હોય.

**અહોદિસિ પમાણાઈકક્રમે** - અધો (નીચી) દિશાના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય.

**તિરિયદિસિ પમાણાઈકક્રમે** - તિર્છી દિશાના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય.

**ખેતવુદ્ધી** - ક્ષેત્ર વધાર્યું હોય.

**સઈઅન્તરદ્વા** - ક્ષેત્ર પરિમાણમાં સંદેહ થવા છતાં પણ આગળ ચલાયું હોય.

**ભાવાર્થ :-** ઉર્ધ્વદિશા, અધોદિશા, તિર્છી દિશાનું પરિમાણ કર્યું છે, તેનાથી વધારે ગમનાગમન આદિ કિયાઓ મન-વચન-કાયાથી કરીશ નહિ, મેં ઉર્ધ્વદિશા, અધોદિશા, તિર્છી દિશાના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય, ક્ષેત્રને વધાર્યું હોય, ક્ષેત્ર પરિમાણમાં સંદેહ પહ્યા છતાં પણ આગળ વધાર્યું હોય તો હું તેની આલોચના કરું છું કે મારા બધા પાપ નિષ્ફળ થાઓ.

- ‘એગવિહું તિવિહેણં ન કરેભિની જગ્યાએ કોઈ કોઈ દુંઘિં તિવિહેણં ન કરેભિ ન કારવેભિ બોલે છે.

ગેંચી-નીચી, તિર્યાં દિશાના ઉલ્લંઘનને અતિચાર કરે છે. તેનું તાત્પર્ય એ છે કે મર્યાદા કરેલી ભૂમિની બહાર જવાની દીર્ઘા કરે છે પરંતુ બહાર ગયા નથી, ત્યાં સુધી અતિચાર છે, બહાર જવા પર અનાચાર છે.

**સાતમું ક્રત -** ઉવભોગ પરિભોગ વિહિ પર્યક્ખાયમાણે (૧) ઉલ્લંઘિયાવિહિ (૨) \*\*દંતવાણવિહિ (૩) ફલવિહિ (૪) અભંગાણવિહિ (૫) \*\*ઉવહૃણાવિહિ (૬) મજજાણવિહિ (૭) વત્થવિહિ (૮) વિલેવાણવિહિ (૯) પુષ્ટવિહિ (૧૦) આભરણવિહિ (૧૧) ધૂવાણવિહિ (૧૨) પેજજવિહિ (૧૩) \*\*ભક્ખવિહિ (૧૪) ઓદાણવિહિ (૧૫) સૂવવિહિ (૧૬) વિગયવિહિ (૧૭) સાગવિહિ (૧૮) \*\*માહુરયવિહિ (૧૯) \*\*તેમાણવિહિ (૨૦) પાણીયવિહિ (૨૧) \*\*મુહુવાસવિહિ, (૨૨) વાહણવિહિ (૨૩) ઉવાણાહવિહિ (૨૪) સયાણવિહિ (૨૫) સચિતવિહિ (૨૬) દવ્વિહિ. આ ર૨૬ બોલોનું યથા પરિમાણ કીનું છે એ ઉપરાંત ઉપભોગ પરિભોગ વસ્તુને ભોગ નિમિતે ભોગવવાના પર્યક્ખાણ જાવજજીવાએ એગવિહિનું તિવિહેણાં ન કરેમિ મણસા વયસા કાયસા એવા સાતમા ઉવભોગ પરિભોગ દુવિહે પણશુંતે તં જહા - ભોયણાઓ ય કર્માં ય ભોયણાઓ સમાણોવાસએણાં પંચ એઈયારા જાળિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં સચિતાહારે સચિત પડિબદ્ધાહારે આપપુલિઓસહિભક્ખાણયા દુષ્પઉલિઓસહિભક્ખાણયા તુચ્છોસહિભક્ખાણયા કર્માંણાં સમાણોવાસએણાં પણારસ કર્મમાદાણાઈ જાળિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં - ઈંગાલકર્મે વાણકર્મે સાડીકર્મે ભાડીકર્મે ફોડીકર્મે દંતવાળિક્રે લક્ખવાળિક્રે રસવાળિક્રે કેસવાળિક્રે વિસવાળિક્રે જંતપીલાણકર્મે, નિંદણાણકર્મે દવળિદાવણયા સરદહતલાયપરિસોસણયા અસરી પોસણયા જો મે દેવસિઓ એઈયારો કાંઠો તસ્સ મિરછામિ દુક્કડં.

**(૧) ઉલ્લંઘિયાવિહિ** - શરીર લૂંછવાના અંગૂઢા, ટુવાલ આદિ વસ્ત્રોની મર્યાદા કરવી.

\*\* શુદ્ધ મૂળ પાઠ અનુસાર સાતમા પ્રતના અનેક શબ્દોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે જેમ- (૧) દંતવાણવિહિના સ્થાને દંતવાણવિહિ (૨) ઉવહૃણવિહિના સ્થાને ઉવહૃણાવિહિ (૩) ધૂવવિહિના સ્થાને ધૂવાણવિહિ (૪) ભક્ખાણવિહિના સ્થાને ભક્ખવિહિ (૫) સૂપવિહિના સ્થાને સૂવવિહિ (૬) માહુરવિહિના સ્થાને માહુરયવિહિ (૭) જમાણવિહિના સ્થાને તેમાણવિહિ (૮) મુહવાસવિહિના સ્થાને મુહવાસવિહિ.

- (૨) દંતવણવિહિ - દંતાળની જાત-દંતાળ ટૂથપેસ્ટ, બ્રશ વગેરે પદાર્થોની મર્યાદા કરવી.
- (૩) ફલવિહિ - આંબળા, અરીઠા આદિ ફળથી વાળ ઘોવાની મર્યાદા કરવી.
- (૪) અબંગણવિહિ - શરીર પર માલિશ કરવા માટે તેલાઈ દ્રવ્યોની મર્યાદા કરવી.
- (૫) ઉવટટણવિહિ - શરીર પર ઉબટન (પીઠી) આદિની મર્યાદા કરવી.
- (૬) મજજણવિહિ - સ્નાન માટે સ્નાનની સંખ્યા અને પાણીની મર્યાદા કરવી.
- (૭) વત્થવિહિ - વત્થની મર્યાદા કરવી.
- (૮) વિલેવણવિહિ - કીમ, પાવડર, ચંદન આદિના લેપ કરવાની મર્યાદા કરવી..
- (૯) પુષ્ટિવિહિ - ફૂલો તથા ફૂલમાળાની મર્યાદા કરવી.
- (૧૦) આભરણવિહિ - આભૂષણોની મર્યાદા કરવી.
- (૧૧) ધૂવણ વિહિ - ધૂપના દ્રવ્યોની મર્યાદા કરવી.
- (૧૨) પેજજવિહિ - દૂધ, શરબત, ચા આદિ પીવાની વસ્તુઓની મર્યાદા કરવી.
- (૧૩) ભક્ખવિહિ - ઘેવર આદિ પકવાનની મર્યાદા કરવી.
- (૧૪) ઓછણવિહિ - રાંધેલા ચોખા (ભાત), ઘઉં (થૂલી) આદિની મર્યાદા કરવી.
- (૧૫) સૂવવિહિ - મગ, ચણા આદિ દાળની મર્યાદા કરવી.
- (૧૬) વિગયવિહિ - ઘી, તેલ, દૂધ, દહીં આદિની મર્યાદા કરવી.
- (૧૭) સાગવિહિ - બથુઆ, તુરિયા આદિ શાકની મર્યાદા કરવી.
- (૧૮) માહુરયવિહિ - મધુર ફળોની મર્યાદા કરવી.
- (૧૯) જેમણવિહિ - જમણના પદાર્થોની મર્યાદા કરવી.
- (૨૦) પાણીયવિહિ - પીવાના પાણીની મર્યાદા કરવી.

(૨૧) મુલુવાસવિહિ	- લવિંગ, ઈલાયથી, સોપારી વગેરે મુખને સુગંધિત કરવાની વસ્તુઓની મર્યાદા કરવી.
(૨૨) વાહણવિહિ	- હાથી, ઘોડા, રથ, કાર, સ્કૂટર, બસ રેલ ગાડી આદિ વાહનોની મર્યાદા કરવી.
(૨૩) ઉવાણણ વિહિ	- જૂતા, મોજા આદિની મર્યાદા કરવી.
(૨૪) સયણવિહિ	- શચ્ચા, પલંગ આદિની મર્યાદા કરવી.
(૨૫) સચિતવિહિ	- સચેત વસ્તુઓની મર્યાદા કરવી.
(૨૬) દવ્વાવિહિ	- ખાવા-પીવામાં આવવાવાળા સચેત અથવા અચેત પદાર્થ, જે ઉપરના બોલોમાં નથી આવેલા તેની મર્યાદા કરવી. [ધર્મ સંગ્રહ અધિકાર - ૨, શ્લોક ૩૪ ટિકા]
ઉપભોગ*	- જે પદાર્થ એકવાર ભોગવવામાં આવે છે, જેવા અન્ન પાણી વગેરે.
પરિભોગ	- જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે છે જેમ કે વસ્ત્ર આભૂષણ ઈત્યાદિ.
કુવિહે	- બે ગ્રકારે
પન્તાં	- કદ્યા છે
તં જહા	- તે આ પ્રમાણે.
ભોયણાઓ	- ભોજનની અપેક્ષાથી
ય	- અને
કર્માં	- કર્મની અપેક્ષાથી
સમાણવાસઅનેણ	- શાવકને.

- \* ઉપભોગ - પરિભોગ શાબ્દોના ઉપર્યુક્ત અર્થ શ્રી ભગવતી સૂત્ર શાતક - ૭ ઉદ્ઘટેશક ર માં તથા હરિભક્તીયાવસ્થક અધ્યયન ક સૂત્ર ઉમાં કરેલા છે અને આ પ્રકારે પાણ કર્યો છે - વારંવાર ભોગવત્વાવાળા પદાર્થ ઉપભોગ અને અને એકવાર ભોગવત્વાવાળા પદાર્થ પરિભોગ કરેવાય છે.

પંચ અઈયારા	- પાંચ અતિયાર
જાગ્રિયત્વા	- જાગ્રવા યોગ્ય છે
ન સમાયરિયત્વા	- આચરવા યોગ્ય નથી
સચિતાહારે	- મર્યાદા* થી અધિક સચેત વસ્તુનું ભોજન કરવું.
સચિતપદિબધાહારે	- સચેત વૃક્ષ આદિ પર રહેલા ગુંદ, પાકા ફળ વગેરે ખાવા.
અપ્પટિલિ	- અન્ન વિના પાકેલી વસ્તુનો આહાર કરવો
ઓસહિભક્ખણાયા	- જેમાં જીવના મદેશોની સંભાવના હોય એવી તત્કાલ પીસેલી અથવા મર્દન કરેલી વસ્તુનું ભોજન કરવું.
કુપ્પટિલિઓસહિભક્ખણાયા	- અડવી પાકેલી વસ્તુનું ભોજન કરવું.
તુચ્છોસહિભક્ખણાયા	- તુચ્છ ઔષધિ (જેમાં સાર ભાગ ઓછો છે તે વસ્તુ) નું ભોજન કરવું.

**ભાવાર્થ :-** હું શરીર લૂંઘવાના અંગૂધા આદિ વખોનો, દાંતણ કરવાનો, આમળા આદિ ફળથી વાળ ધોવાનો, તેલ આહિની માલિશ કરવાનો, ઉબટન કરવાનો, સ્નાનની સંખ્યા, પાણીનું પરિમાણ કરવાનો, વખ્નનો, ચંદન આદિ લેપ કરવાનો, ફૂલ સૂંઘવાનો, આભૂષણ પહેરવાનો, ધૂપ કરવાનો, દૂધ વગેરે પીવાનો, વેવર આદિ પકવાનનો, ચોખા-ઘઉં વગેરેનો, મગ વગેરે દાળનો, ઘી, તેલ આહિનો, બથુઆ - તુવર વગેરે શાકનો, મધુર ફળોનો, જમવાના દ્રવ્યોનો, પીવાના પાણીનો, એલયી લવિંગ ઈંટ્યાદિ મુખને સુગંધિત કરવાવાળી વસ્તુઓનો, ઘોડા, હાથી, રથ આદિ સવારીનો, ચાપ્પલ પહેરવાનો, પલંગ આદિ પર સૂવાનો, સચેત વસ્તુનું સેવન કરવાનો તથા બીજા બચેલા બાકી પદાર્થોના પરિમાણ (મર્યાદા) કર્યા હોય તે સિવાય ઉપભોગ તથા પરિભોગમાં આવવાવાળી બધી વસ્તુઓનો ત્યાગ કરું છું. જીવન પર્યત તેનું મન-વચન-કાયાથી સેવન કરીશ નહિ, ઉપભોગ પરિભોગ બે પ્રકારના છે - ભોજન સંબંધી

\* સચિત ત્યાગી શ્રાવકને સચિત વસ્તુ જેમ કે મીઠું, પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિનો આહાર કરવા માટે ઉઘત થવું અથવા સચેત વસ્તુનું પરિમાણ કરવાવાળા શ્રાવકે પરિમાણ કરેલા પદાર્થો ઉપરાંત સચેતા વસ્તુને ખાવા માટે ઉઘત થવું સચિતાહાર અતિયાર છે.

અને કર્મ (ધંધા-વ્યાપાર) સંબંધી. ભોજન સંબંધી ઉપભોગ પરિભોગના પાંચ અને કર્મ સંબંધી ઉપભોગ - પરિભોગના પંદર આવી રીતે કુલ ૨૦ અતિયાર છે. તે નીચે પ્રકારે છે. તેની આલોચના કરું છું જો મેં (૧) મર્યાદાથી અધિક સચેત વસ્તુનો આહાર કર્યો હોય. (૨) સચેત વૃક્ષ આદિ સાથે લાગેલા ગુંદ, ફળ વગેરે પદાર્થોનો આહાર કર્યો હોય. (૩) અન્ન વિના પાકેલી વસ્તુનું ભોજન કર્યું હોય. (૪) અડવી પાકેલી વસ્તુનું ભોજન કર્યું હોય, (૫) તુચ્છ ઔષધિનું ભોજન કર્યું હોય તથા પંદર કર્માદાન, જેનું વાર્ષન પહેલા કરવામાં આવ્યું છે, તેનું અહીં સેવન કર્યું હોય, તો હું તેની આલોચના કરું છું અને ઈચ્છાનું છું કે મારા બધા પાપ નિષ્ફળ થાઓ.

**આઠમું આણટકાંડ વેરમણા ક્રત - ચાન્તિલુણે આણત્થા દ્વે પણગતે તંજદ્દા-અવજગાણાચરિએ પમાયાચરિએ હિંસપ્પયાણે પાવકમ્મોવઅસે એવા આઠમા આણટકાંડ સેવવાના પચ્ચયક્ખાણા (જેમાં આઈ આગાર-આએ વા, રાએ વા, નાએ વા, પરિવરિએ વા, દેવે વા, નાગે વા, જક્ખે વા, ભૂએ વા, ઐતિહાસિક આગરેહિં આણત્થથ) જાવજજીવાએ દુવિહં તિવિહંણાં ન કરેમિ ન કારવેમિ માણસા વયસા કાયસા એવા આઠમા અનર્થદંડ વરેમણાં વ્રતના પંચ અઈયારા જાણિયત્વા ન સમાપ્તિયત્વા તં જદ્દા તે આલોઉં-કંદપે, કોકુઈએ, • મોહરિએ, સંજુતાહિગરણે, ઉપભોગ-પરિભોગ અઈરિતે જો મે દેવસિઓ અઈયારો કાંઓ તસ્સ ભિચ્છામિ દુક્કડં.**

**આણત્થાદ્વે**

- પ્રયોજન વિના એવા કામ કરવા જેમાં જીવોની હિંસા થતી હોય અથવા જીવોને પીડા થતી હોય.

**અવજગાણાચરિએ**

- આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વશ થઈને ઈષ્ટ સંયોગ, અનિષ્ટ વિયોગની ચિંતા કરવી તથા કોઈપણ પ્રાણીને હાનિ પદોંચાડવાનો વિચાર કરવો.

**પમાયાચરિએ<sup>+</sup>**

- પ્રમાદપૂર્વક આચરણ કરવું અર્થાત્ મધ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથામાં રહેવું તથા પ્રમાદથી કામ કરવું, જેનાથી જીવોની હિંસા થાય છે-જેવી

● કુક્કાઈએના સ્થાન પર કોક્કાઈએ શુદ્ધ પાઠ છે-

+ મજજ વિસય કસાયા, નિદ્રા વિકથાય પંચમી ભણિયા।

એએ પંચ પમાયા, જીવા પાંદતિ સંસારે ||

**ભાવાર્થ- મધ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા-એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે.**

રીતે-જોયા વિના ચાલવું, ફરવું, વસ્તુ ઉપાડવી, રાખવી, પાડુટી, તેલ, ધી આદિના વાસણોને ખુલ્લા રાખવા.

**હિંસપ્રયાણો**

- (પ્રયોજન વિના) જેમાં જીવની ઘાત થાય છે-એવી તલવાર, બંદૂક જેવી વસ્તુઓ બીજાને આપવી.

**પાવકમ્મોવઅસો**

- (પ્રયોજન વિના) જે કામોમાં જીવની હિંસા થાય છે એવા મકાન બનાવવા, વૃક્ષ કાપવા આદિના ઉપદેશ આપવા.

**કંદપે**

- કામ-વિકાર ઉત્પત્ત કરવાવાળી કથાઓ કહેવી.

**કોક્કુદ્ધાંદો**

- બીજાને હસાવવા માટે ભાંડની જેમ હસવું-કોઈની નક્કલ કરવી.

**મોહરિઓ**

- જેમ-તેમ નિરર્થક બોલવું.

**સંજુતાહિગરણો**

- મૂસલ, શિલા, લોઢા, તલવાર વગેરે હિંસાકારી હુથિયાર અથવા શાખના પ્રયોજનથી વધારે સંગ્રહ કરવો.

**ઉપભોગ-પરિભોગ અઈરિટે** - ઉપભોગ અને પરિભોગમાં ખાવા-પીવા-પહેરવા આદિ વસ્તુઓમાં અતિ આસક્ત બનવું.

**ભાવાર્થ-** પ્રયોજન વિના દોષજનક કામ કરવાનું નામ અનર્થદંડ છે-અપદ્યાન, પ્રમાદચર્યા, હિંસાદાન અને પાપોપદેશ-દ્યાષ સંયોગો અને અનિષ્ટ વિયોગની ચિંતા કરવી તથા બીજાને હાનિ પહોંચાડવી વગેરે વિચાર કરવા અપદ્યાન છે-અસાવધાનીથી કામ કરવું, ધાર્મિક કાર્યોનો ત્યાગ કરી, બીજા પ્રમાદના કાર્યોમાં રહેવું તે પ્રમાદચર્યા છે. પ્રયોજન વિના બીજાને હળ, ઉખલ, મૂસલ, તલવાર, બંદૂક વગેરે હિંસાના ઉપકરણ આપવા હિંસાદાન છે. મકાન બનાવવા આદિ પાપકાર્યોના બીજાને ઉપદેશ આપવા પાપોપદેશ છે. હું આ ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરું છું. આત્મરક્ષા માટે, રાજાની આજ્ઞાથી, પરિવાર-કુટુંબ માટે તથા દેવ, નાગ, યક્ષ, ભૂત આદિને વશીભૂત થઈને અનર્થદંડનું સેવન કરવું પડે તો તેનો આગાર રાખું છું. (આ આગારો સિવાય) હું જન્મપર્યત અનર્થદંડનું મન, વચન, કાયાથી સ્વયં સેવન કરીશ નહીં અને કરાવીશ

નહીં. જો મેં કામ જાગૃત કરવાવાળી કથાઓ કરી હોય, ભાંડની જેમ બીજાને હસાવવા માટે હંસી-મજાક કરી હોય અથવા બીજાની નકલ કરી હોય, નિરર્થક બકવાસ કર્યો હોય, તલવાર, ઉખલ, મૂસલ વગેરે હિંસાકારી હુણ્યારોનો નિષ્પયોજન સંગ્રહ કર્યો હોય, પોતાના તથા કુટુંબીઓની આવશ્યકતાઓ સિવાય અને-વસ્ત્ર વગેરેનો સંગ્રહ કર્યો હોય તો, હું તેની આલોચના કરું છું અને હું ઈચ્છાં છું કે મારા તે બધા પાપ નિષ્કળ થાઓ.

**નવમું સામાયિક વ્રત -** સાવજજં જોગં પદ્યકખામિ જાવનિયમં પજજુવાસામિ દુવિહં તિવિહેણં ન કરેમિ ન કારવેમિ માણસા વયસા કાયસા<sup>o</sup> એવી મારી સદ્દહણા, પ્રરૂપણા ફરસના છે.\* એવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા જાળિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં-માણદુપ્પણિહણાણે વયદુપ્પણિહણાણે કાયદુપ્પણિહણાણે સામાઈયસસ સઈ અકરાણયા સામાઈયસસ આગવટિઠયસસ કરાણયા જો મે દેવસિઓ અઈયારો કાઓ તસ્સ મિચ્છામિ દુક્કડં.

સાવજજં	- પાપયુક્ત
જોગં	- મન-વચન-કાયાની પ્રવૃત્તિ
પદ્યકખામિ	- ત્યાગ કરું છું.
જાવ નિયમં	- નિયમ પર્યત
પજજુવાસામિ	- ઉપાસના કરું છું-સેવન કરું છું.
સદ્દહણા	- શ્રદ્ધા-રૂચિ
પ્રરૂપણા	- પ્રતિપાદન કરવું
ફરસના	- ફરસના (પાલન કરવું)
માણ દુપ્પણિહણાણે	- મનમાં ખરાબ વિચાર કરવા.
વય દુપ્પણિહણાણે	- કઠોર અથવા પાપજનક વચન બોલવા.
કાય દુપ્પણિહણાણે	- જોયા વિના પૃથ્વી પર બેસવું-ઊભું થવું વગેરે.

● પ્રતિકમાણ કરવાવાળા વધારે કરીને સામાયિક લીધેલા હોય છે, તેથી આવી લાઈન રાખી છે.

\* જ્યારે સામાયિક વ્રતમાં ન હોય-ત્યારે બોલવું મારી સદ્દહણા પ્રરૂપણા છે-હું સામાયિકનો અવસર આવે, સામાયિક કરું ત્યારે ફરસના કરીને શુદ્ધ થાઉં.

**સામાઈયસ્સ સઈ અકરણયા - સામાયિક કરવાનો સમય ભૂલી જવો.**  
**સામાઈયસ્સ આણવટ્ટિક્યસ્સ - સામાયિકનો સમય પૂર્ણ થાય પહેલા જ પારી લેવી કરણયા**

**અથવા અનવસ્થિત રૂપથી સામાયિક કરવી.**

**ભાવાર્થ -** હું મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. જેટલા સમયનો નિયમ કર્યો છે તે અનુસાર સામાયિક વ્રતનું પાલન કરીશ. મનમાં ખરાબ વિચાર ન કરવાથી, કઠોર યા પાપજનક વચન ન બોલવાથી, કાયાથી હુલન-ચલન આદિ કિયાઓને રોકવાથી, આત્મામાં જે શાંતિ ઉત્પન્ન થાય છે તેને સામાયિક કહે છે- માટે હું નિયમ પર્યત મન, વચન, કાયાથી પાપજનક કિયા કરીશ નહિ અને બીજા પાસે કરાવીશ નહિ-જો મેં સામાયિકના સમયમાં ખરાબ વિચાર કર્યા હોય, કઠોર અથવા પાપજનક વચન બોલ્યા હોય, અયતનાપૂર્વક શરીરથી હુલન-ચલન કર્યું હોય, હાથ-પગ ફેલાવવા અને સંકોચવા આદિ કિયા કરી હોય, સામાયિક કરવાનો સમય યાદ ન રાખ્યો હાય તથા અલ્પકાળ સુધી અથવા અનવસ્થિત રૂપથી જેમ-તેમ સામાયિક કરી હોય, તો હું તેની આલોચના કરું છું અને ઈરછું છું કે મારા સંપૂર્ણ પાપ નિષ્ફળ થાઓ.

**દશમું દેશાવકાશિક વ્રત -** દિન પ્રત્યે ગ્રાંભાત થકી ગ્રારંભીને પૂર્વાદિક છ દિશાઓ જેટલી ભૂમિકાની મર્યાદા રાખી છે, તે ઉપરાંત આગળ જવાના તથા બીજાને મોકલવાના પચ્ચયક્ખાણ જાવ અહોરતં દુવિહું તિવિહેણં ન કરેમિ ન કરવેમિ માણસા વયસા કાયસા જેટલી ભૂમિકાની મર્યાદા રાખી છે એમાં જે દ્વયાદિકની મર્યાદા કરી છે તે ઉપરાંત ઉવલોગ પરિભોગ નિમિત્તે ભોગવવાના પચ્ચયક્ખાણ જાવ અહોરતં એગાવિહું તિવિહેણં ન કરેમિ માણસા વયસા કાયસા એવા દશમા દેશાવકાશિક વ્રતના પંચ અઈયારા જાળિયત્વા ન સમાયરિયત્વા તં જહા તે આલોઉં - આણયાળાપુરોગે\* પેસવાળાપુરોગે સદ્ગાણવાએ રુવાળાવાએ બહિયા પુરુષાપક્ખભેવે જો મે દેવસિઓ- અઈયારો કાંચો તસ્સ મિચ્છામિ દુક્કડં.

**જાવ અહોરતં** - એક દિવસ - રાત પર્યત

**આણયાળાપુરોગે** - મર્યાદા કરેલા ક્ષેત્રથી આગળની વસ્તુ મંગાવવી.

\* આણયાળાપુરોગે પાઈ અશુદ્ધ હોવાથી આણયાળાપુરોગે પાઈ કર્યો છે.

- |                     |  |
|---------------------|--|
| પેસવણપાપઓ           | - પરિમાળ કરેલા ક્ષેત્ર આગળની વસ્તુ મંગાવવા માટે અથવા લેન-દેન-કરવા માટે નોકર આઈને મોકલવા. |
| સદાશુદ્ધાવાએ        | - સીમાની બહારના મનુષ્યને ખાંસી અથવા કોઈ શબ્દ દ્વારા વસ્તુ મંગાવવી કે મોકલી હોય.          |
| રુવાશુદ્ધાવાએ       | - સીમાની બહારના મનુષ્ય પોતાની પાસે બોલાવવા માટે પોતાનું અથવા પદાર્થનું રૂપ બતાવવું.      |
| બહિયા પુરુષપક્ષભેવે | - સીમા બહારના મનુષ્યને બોલાવવા માટે કંકરો આદ ફેંકવો.                                     |

**ભાવાર્થ :-** છુટ્ટા દિશાવકતમાં હંમેશાં માટે જે દિશાઓનું પરિમાળ કર્યું છે. દેશાવકાશિક ગ્રતમાં તેને અદ્ય કરવામાં આવે છે. મેં નક્કી કરેલા દિશાના પરિમાળથી બહારના ક્ષેત્રમાં જવાનો તથા બીજાને મોકલવાનો ત્યાગ કરું છું. એક દિવસ અને એક રાત સુધી પરિમાળ કરેલી દિશાઓથી આગળ મન-વચન-કાયાથી હું જઈશ નહિ અને બીજાને મોકલીશ નહિ. મર્યાદિત ક્ષેત્રમાં દ્રવ્યાદિનું જેટલું પરિમાળ કર્યું છે તે પરિમાળ સિવાય ઉપભોગ-પરિભોગ નિમિત્તે ભોગવવાનો ત્યાગ કરું છું. મન-વચન-કાયાથી મેં તેનું સેવન ન કરું હોય, જો મેં મર્યાદાથી બહારની વસ્તુ મંગાવી હોય, મર્યાદા બહારના ક્ષેત્રમાંથી કોઈ વસ્તુ મંગાવવા માટે અથવા લેન-દેન કરવા માટે કોઈને મોકલ્યો હોય, મર્યાદા બહારના મનુષ્યને બોલાવવા માટે પોતાનું અથવા પદાર્થનું રૂપ બતાડ્યું હોય અથવા કંકરો વરેરે ફેંકીને બોલાવ્યા હોય તો હું તેની આલોચના કરું છું અને ઈચ્છું છું કે મારા બધા પાપ નિષ્ફળ થાઓ.

**અગિયારમું પ્રતિપૂર્ણ પૌષ્ઠદ્વત -** અસાં પાણ ખાઈમં સાઈમના પર્ચ્યક્ખાળ અબંભસેવનના પર્ચ્યક્ખાળ મણિસોવત્તના પર્ચ્યક્ખાળ માલાવત્તગવિલેવણના પર્ચ્યક્ખાળ સત્થમુસલાદિક સાવજજ જોગ સેવવાના પર્ચ્યક્ખાળ જાવ અહોરતં પજુવાસામિ દુવિહં તિવિહેણં ન કરેમિ ન કારવેમિ માણસા વયસા કાયસા એવી મારી સદહણા પ્રરૂપણા કરી પૌષ્ઠદ્વનો અવસર આવે અને પૌષ્ઠ કરું ત્યારે ફરસનાએ કરી શુદ્ધ હોણો\*. એવા અગિયારમા પ્રતિપૂર્ણ પૌષ્ઠ ગ્રતના પંચ અઈયારા જાણિયત્વા ન સમાપ્તિયત્વા તંજ હા તે આલોઉં - અપડિલેહિય - દુપ્પડિલેહિય સેજજાસંથારએ

\* જ્યારે પૌષ્ઠ ગ્રતમાં હોઈએ ત્યારે એવી મારી સદહણા પ્રરૂપણા એવા અગિયારમા પ્રતિપૂર્ણ પૌષ્ઠ ગ્રતના - એમ બોલવું.

અપમજ્ઞય દુર્પમજ્ઞય સેજજા સંથારએ અપડિલેહિય દુર્પડિલેહિય ઉચ્ચાર પાસવાળા ભૂમી\* આપમજ્ઞય દુર્પમજ્ઞય ઉચ્ચાર પાસવાળા ભૂમી પોસહોવવાસસ્સ\* સમ્મં અણગણુપાલાણ્યા જો મે દેવસિઓ અઈયારો કંઓ તસ્સ મિશામિ દુક્કડ.

અસણાં	- દાળ, ભાત, રોટલી અને તથા દૂધ વગેરે વિગય.
પાણાં	- પાણી, ધોવાળા વગેરે પીવાની વસ્તુ.
ખાઈમં	- ફળ, મેવા, ઔષધિ વગેરે.
સાઈમં	- લવિંગ, સોપારી, એલચી, ચૂર્ણ આદિ ભોજન પછી ખાવાલાયક સ્વાદિષ્ટ પદાર્થ.
અબંભસેવન	- મૈથુન સેવન
મણિ સુવર્ણ	- મણિ, મોતી તથા સોના-ચાંદીના આભૂષણ વગેરે.
માલા	- ફૂલમાળા
વશગ	- સુગંધિત ચૂર્ણ આદિ.
વિલેવણ	- ચંદન આદિનો લેપ.
સત્થ	- તલવાર વગેરે શાખ.
મુસલાદિક	- મૂસલ વગેરે શાખ.
સાવજજ જોગ	- સાવદ્યયોગ (પાપસહિત વ્યાપાર)
અપડિલેહિય	- સૂવા માટે કુશ, કંબલ આદિનું જે
દુર્પડિલેહિય	- સંસ્તારક આસન છે, જોયું ન હોય
સેજજાસંથારએ	- અથવા સારી રીતે જોયું ન હોય.
અપમજ્ઞય	- સૂવા માટે કુશ, કંબલ આદિનું જે
દુર્પમજ્ઞય	- સંસ્તારક આસન છે, તેનું પ્રમાર્જન
સેજજાસંથારએ	- (પ્રતિલેખના) કર્યું ન હોય અથવા સારી રીતે કર્યું ન હોય.

\* મૂળ પાઠ અનુસાર ભૂમિના સ્થાને ભૂમી શુદ્ધ છે.

\* મૂળ પાઠ અનુસાર પોસહસ્સના સાથે પોસહોવવાસસ્સ શુદ્ધ છે.

આપહિલેહિય	- મળ-મૂત્ર ત્યાગ કરવાની ભૂમિને
કુષ્પહિલેહિય	- જોઈ ન હોય અથવા અસાવવધાનીથી
ઉચ્ચારપાસવણાભૂમી	- જોઈ હોય.
આપમજીજ્ય	- મળમૂત્ર ત્યાગ કરવાની ભૂમીનું પ્રમાર્જન
કુષ્પમજીજ્ય	- કર્યું ન હોય અથવા સારી રીતે ન કર્યું હોય.
ઉચ્ચારપાસવણા ભૂમી	-
પોસહુવવાસસ્સ સમ્મં	- ઉપવાસયુક્ત પૌષ્ઠ્રનું સમ્યક રીતે
આણાશુપાલણ્યા	- પાલન કર્યું ન હોય.

**ભાવાર્થ -** હું પ્રતિપૂર્ણ પૌષ્ઠ્ર વ્રતના વિષયમાં એક દિવસ-રાત માટે અશાન, પાન, ખાદ્ય (ખાદિમ) અને સ્વાદ્ય (સ્વાદિમ) આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરું છું. અબ્રહિમ્યર્થ સેવનનું, અમુક મણિં, સુવર્ણ વગેરેના આભૂષણ પહેરવાના, ફૂલમાળા પહેરવાની સુગંધિત ચૂર્ણ અને ચંદન વગેરે લેપ કરવાનો, તલવાર વગેરે શાખ અને હળ, મૂસલ વગેરે ઓજારથી થવાવાળા બધા સાવદ્ધ વ્યાપારનો ત્યાગ કરું છું યાવત્ એક દિવસ-રાત સુધી પૌષ્ઠ્રકરતનું પાલન કરતા હું ઉપરની પાપકિયાઓનું મન-વચન-કાયાથી સેવન કરીશ નહીં અને બીજા પાસે કરાવીશ નહીં, એવી મારી શ્રદ્ધા અને પ્રરૂપણા તો છે, પરંતુ પૌષ્ઠ્રનો સમય આવે ત્યારે તેનું પાલન કરું અને શુદ્ધ થાઉં. જો મેં પૌષ્ઠ્રમાં શચ્ચા માટે કુશ, કંબલ વગેરેના આસન છે તેનું પ્રતિલેખન અને પ્રમાર્જન ન કર્યું હોય અથવા સારી રીતે પ્રતિલેખન અથવા પ્રમાર્જન ન કર્યું હોય તેમ જ મળ-મૂત્ર ત્યાગ કરવાની ભૂમીનું પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યું હોય અથવા સારી રીતે ન કર્યું હોય તથા ઉપવાસયુક્ત પૌષ્ઠ્રનું સમ્યક પ્રકારે પાલન ન કર્યું હોય, તો હું તેની આલોચના કરું છું અને ઈર્છાં છું કે મારા બધા પાપ નિર્ઝળ થાઓ.

**બારમું અતિથિ સંવિભાગ વ્રત -** સમાણે નિર્ણાંથે ફાસુય એસણિજજેણાં અસાણ પાણ ખાઈમ સાઈમ વત્થ પડિળાહ કંબલ પાયપુંછણેણાં પાડિહારિય - પીઠ-ફલગ-સેજજાસંથારાઓણાં ઓસાણભેસજજેણાં પડિલાભેમાણે વિહરામિ એવી મારી સદ્ધાણા પ્રરૂપણાએ કરી સાધુ-સાધવીજીનો યોગ મળે તો નિર્દોષ દાન આપી શુદ્ધ થાઉં એવા બારમા અતિથિ સંવિભાગ વ્રતના પંચ અઈયારા જાણિયત્વા ન સમાયરિયત્વા તં જહા તે

આલોઉ - સચિતનિફખેવાળાય, સચિત પિહણાય કાલાઈક્કમે પરવવએસે \*મચ્છરિઆ જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચામિ દુક્કડં.

### અતિથિ સંવિભાગ

- જેના આવવાની તિથિ અથવા સમય નથી એવા અતિથિ સાધુને પોતા માટે તૈયાર કરેલા ભોજન આદિમાંથી આપવું.

સમાણે

- શ્રમણ - સાધુ

નિર્ણાંથે

- નિર્ગ્રથ-પંચ મહાક્રતધારી

ફાસુયએસાણિજજેણાં

- ગ્રાસુક (અચિત) એષણીય (ઉદ્ગમાદિ દોષ રહિત)

અસણા-પાણા-ખાઈમ

- અસ, પાન, ખાદ્ય

સાઈમ-વત્થપડિજ્જાણ

- સ્વાદ, વખ, પાત્રા

કંબલ-પાયપુરછણોળાં

- કંબલ - રજોહરણા, ગુચ્છા આદિ

પાડિદુરિય

- આપીને પાછી લેવાય એવી વસ્તુ.

પીઠ-ફલગ સેજજાસંથારાં

- સાધુ કેટલાક સમય સુધી રાખીને પાછા આપી શકે એવા પાટ, પાટલા, શાયા વગેરે માટે સંસ્તારક - તૃશું વગેરેનું આસન.

ઓસહદુલેસજજેણાં

- ઔષધ અને ભેસજ (કેટલીક ઔષધિના સંયોગથી બનેલી દવા)

વિહુરામિ

- રહું

સચિતનિફખેવાળાય

- સાધુને ન આપવાની બુદ્ધિથી અચેત વસ્તુને સચેત પાણી આદિ પર રાખવી.

સચિતપિહણાય

- સાધુને નહીં દેવાની બુદ્ધિથી અચેત વસ્તુને સચેત વસ્તુથી ઢાંકવી.

કાલાઈક્કમે

- સાધુને નહીં દેવાની બુદ્ધિથી ભોજન કાળનું ઉલ્લંઘન કરવું અર્થત્ ભોજનના સમય પહેલા અથવા પાછાની સાધુને ભોજન માટે પ્રાર્થના કરવી જેથી આ સમયે સાધુ ભોજન નહીં લે અને મારું દાન પણ ગ્રક્રટ થશે.

\* મૂળ પાઠ અનુસાર મચ્છરિયાએના સ્થાને મચ્છરિઆ શુદ્ધ છે.

- પરવવઅસે** - દાન નહીં દેવાની બુદ્ધિથી પોતાની વસ્તુ બીજાની કહેવી.
- મરણરિઆ** - અમુક પુરુષે દાન દીધું, શું હું તેનાથી કૃપાણ છું કે હીન? આ મ્રકારે કહીને દાન દેવું અથવા દાન દઈને પશ્ચાતાપ કરવો.

**ભાવાર્થ** - હું અતિથિ સંવિભાગ વ્રતનું પાલન કરવા માટે નિર્ગથ સાધુઓને અચેત, દોષરહિત પાટ-પાટલા, અત્ર, પાણી, ખાદ્ય, સ્વાદ્ય, આદ્ધાર, વસ્ત્ર, પાણી, કંબલ, પાદપોંછન, પાટ-પાટલા, સંસ્તારક ઔષધિ વગેરે યોગ મળવા પર દાન આપું ત્યારે શુદ્ધ થાઉં એવી મારી શક્તા પ્રરૂપના. જો મેં સાધુને દેવા યોગ્ય અચેત વસ્તુને સચેત વસ્તુ પર રાખી હોય, અચેત વસ્તુને સચેત વસ્તુથી ઢાંકી હોય, ભોજનના સમય પહેલા અથવા પછી લિક્ષા માટે પ્રાર્થના કરી હોય (અથવા ભોજન સમયે સાધુ-સાધ્વીને દાન દેવાની ભાવના ન હોય.), બીજાને દાન દેતા સમયે ઈર્ઝ્યા કરી હોય, મત્સરભાવથી દાન આપ્યું હોય તો હું તેની આલોચના કરું છું અને ઈર્ઝું છું કે મારા બધા પાપ નિર્ઝળ થાઓ.

**વિધિ** - પલાંઠી વાળીને મોટી સંલેખનાનો પાઠ બાલવો.

## ૧૪. મોટી સંલેખનાનો પાઠ

અહુ ભંતે! અપરિદ્ધમ, મારાણંતિય સંલેહણા જૂસણા આરાહણા, પૌષ્ટિકશાળા પૂંજને પૂંજને ઉચ્ચાર પાસવાણ ભૂમિકા પડિલેહે પડિલેહીને ગમણાગમાણે પડિક્કમે પડિક્કમીને દભાડિક સંથારો સંથરે, સંથારીને દભાડિક સંથારો દુરુદે દુરુદીને પૂર્વ તથા ઉત્તર દિશિ સમુખ પર્યકાદિક આસને બેસીને બેસીને કરયલસંપરિગ્ગાહિયં સિરસાવતં મત્થએ અંજલી કટૂ એવં વયાસી ‘નમોત્થુ ણાં અરિહુંતાણાં ભગવંતાણાં જાવ સંપત્તાણાં’ એમ અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને ‘નમોત્થુ ણાં અરિહુંતાણાં ભગવંતાણાં જાવ સંપાવિઉકામાણાં’ જથવંતા વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થકર ભગવંતોને નમસ્કાર કરીને ધર્માચાર્યજી મહારાજ (અહીં પોતાના ધર્માચાર્યજી મહારાજનું નામ લેવું) ને નમસ્કાર કરું છું. સાધુ પ્રમુખ ચાર તીર્થોને ખમાવીને, સર્વ જૈન સંસ્કાર પાદ્યક્રમ ભાગ-૪

જીવરાશિને ખમાવી પહેલા જે વ્રત આઈર્યા છે તેમાં જો અતિયાર\* દોષ લાગ્યો હોય તે સર્વેની આલોચના કરીને પડિક્કભિને નિંદીને નિઃશલ્ય થઈ સર્વ પાણાઈવાયં પરચક્કખામિ સર્વ મુસાવાયં પરચક્કખામિ સર્વ અદિશાદાણં પરચક્કખામિ સર્વ મેહુણં પરચક્કખામિ સર્વ પરિગ્ગાહું પરચક્કખામિ સર્વ કોહું માણં જાવ મિચાદસાગ સલં પરચક્કખામિ સર્વ અકરણિજજં જોગં પરચક્કખામિ જાવજજીવાએ તિવિહું તિવિહેણં ન કરેમિ ન કારવેમિ કરંતંપિ અત્રં ન સમજુજ્જાગામિ મણસા વયસા કાયસા એમ અઠારે પાપરથાનક પરચક્કખીને સર્વ અસાણં-પાણં-ખાઈમં સાઈમં ચઉંવિહું પિ આહારં પરચક્કખામિ જાવજજીવાએ એમ ચારે આહાર પરચક્કખીને જં પિ ય ઈમં શરીરે ઈટ્ટં કંત પિયં મજુણાણં મણામં વિજજં વિસાસિયં સંમયં આશુમયં બહુમયં ભંડ કરંડગ સમાણં+મા ણં સીયં મા ણં ઉજુહું મા ણં ખુદા મા ણં પિવાસા મા ણં બાલા મા ણં ચોરા મા ણં દંસા\* મા ણં મસગા મા ણં વાઈયં પિતિયં સંભિય\* સાણિશવાઈયં વિવિહા રોગાયંકા પરિસહેવસળા ■ કુસંતુ તિ કટ્ટુ એવં પિયાણં ચરમેહિં ઉસ્સાસ-ઝિસ્સાસેહિં વોસરામિ તિ કટ્ટુ આ પ્રકારે\* સંલેખાણા કરીને ભક્ત પાન પ્રત્યાખ્યાન કરીને કાળની આકંક્ષા ન કરતા હું વિચરણ કરું એવી મારી સદ્ગુહણા પ્રરૂપણા છે તો સંલેખનાનો અવસર આવે સંલેખના કરું ત્યારે સ્પર્શનાએ કરી શુદ્ધ થાઉં.▲

**અપચિષ્ઠમ મારણાંતિય** - બધા પછી મૃત્યુ નજીક આવવા પર લેવાની સંલેખાણા સંલેહણા અર્થાત् જેમાં શરીર-કખાય-મમત્વ વગેરેને કૃશ (કુર્બંગ) કરવામાં આવે છે એવું તપ વિશેષ.

\* બાર વ્રતોના ૬૦ અતિયારોનો વિશેષ ખુલાસો શ્રી જૈન સિદ્ધાંત બોલ સંગ્રહ પ્રથમ ભાગમાં બોલ નંબર ૩૦ થી ૩૮૨ સુધી છે.

- ટિપ્પણી - સંલેખના પ્રકરણમાં આગમ અનુસાર શુદ્ધ પાઠ આ પ્રકારે છે.
- + રથણુકરાણગભૂયં શબ્દ નથી તેથી તે શબ્દ નથી લીધો.
- માણં દંસમસગા શબ્દની બદલે માણં દંસા માણં મસગા પાઠ છે.
- \* કણ્પિયં શબ્દ સંલેખાણામાં નથી તેમ જ સંભિમં શબ્દ શુદ્ધ નથી. સંભિયં શબ્દ શુદ્ધ છે.
- સંલેખાણામાં ફાસા શબ્દ નથી.
- ❖ આ લાઈન આગમોમાં આવેલ સંલેખાણા સંબંધી વાર્ણનમાં શાખના ભાવો અનુસાર હિન્દી ભાષામાં જોડેલી છે.
- ▲ અહિં પાંચ અતિયારોને નિષ્પયોજન હોવાથી દૂર કર્યા છે.

જૂસણા	- સંલેખનાનું સેવન કરવું.
આરાણણા	- સંલેખનાનું અંતકાળ સુધી પાલન કરવું.
ઉર્યાર-પાસવાણ ભૂમિકા	- મળમૂત્ર ત્યાગવાની ભૂમિને
પડિલેહી ને	- પ્રતિલેખના કરીને, જોઈને.
ગમણાગમણો	- આવા-જવાની ક્રિયાનું
પડિક્કમીને	- પ્રતિકમણ કરીને.
દુરુદુંને	- સંથારા પર આરુદ થઈને.
કરયલ સંપરિઝાહિયં	- બંને હાથ જોડીને
સિરસાવતં	- મસ્તકથી આવર્તન કરીને.
મતથાએ અંજલિ કટ્ટુ	- મસ્તક પર હાથ જોડીને.
એવં વયાસી	- આ પ્રકારે બોલે.
નમોત્થુણં	- નમસ્કાર હો.
અરિહંતાણં ભગવંતાણં	- અરિહંત ભગવાનને
જાવ સંપત્તાણં	- યાવત્ત મોક્ષ પહુંચેલાઓને
નિઃશાલ્ય	- માયા, મિથ્યાદર્શન અને નિદાન (નિયાણા) આ ત્રણ શલ્યોથી રહિત.
મિચા દંસણ સહલં	- મિથ્યાદર્શન શાલ્ય (મિથ્યાદર્શન રૂપી કંટક)
અકરણિજજં	- નહીં કરવા યોગ્ય.
જ પિ ય	- જે પણ અને
ઈમં સરીરં	- આ શરીર
ઈટકં	- ઈષ
કંતં	- કમનીય (કાંત, સુંદર)
પિયં	- પ્રિય ઘારું
માણુષણં	- મનોક્ષ-મનોહર
મણપામં	- અત્યંત મનોહર
ધિજજં	- ધૈર્યપાત્ર
વિશાસિયં	- વિશ્વાસ કરવા યોગ્ય

\* આવર્તન - મસ્તક પર જોડેલા હાથોને ત્રણ વાર ગુરુજનોના જમાણોથી ડાબી તરફ ફેરવવું.

સમયં	- માનવા યોગ્ય.
આણુમયં	- વિશેષ સમ્માન કરવા યોગ્ય.
બહુમયં	- ઘણા વડે માનવા યોગ્ય.
ભંડકરંડગા સમાણં	- આભૂષણોના કરંડિયા સમાન.
મા છું સીયં	- શીત (ઠંડી) ન લાગે.
મા છું ઉષુણું	- ઉષુણતા (ગરમી) ન લાગે.
મા છું ખુદ્ધા	- ભૂખ ન લાગે.
મા છું પિવાસા	- તરસ ન લાગે.
મા છું બાલા	- સાપ ન કરે.
મા છું ચોરા	- ચોરોનો ભય ન હોય.
મા છું દંસા	- મરદ્ધર ન કરે.
મા છું વાઈયં	- વાયુ ન થાય.
પિત્તિયં	- પિત સંબંધી.
સંભિય	- સંલેખ સંબંધી.
સભિવાઈય	- સત્ત્રિપાતથી થવાવાળી.
વિવિદ્ધા	- અનેક પ્રકારે
રોગાયંકા	- રોગ સંબંધી પીડાઓ.
પરિસહા	- કૃધા આદિ પરિષહ (કર્મ ક્ષય કરવા માટે કૃધા આદિને શાંતિપૂર્વક સહન કરવા.)
ઉવસર્ગા	- ઉપર્સર્ગ (દેવ, મનુષ્ય, તિર્યચ વગેરે દ્વારા આપેલા કષ)
કુસંતુ	- સ્પર્શ કરે.
એવં પિ ય છું	- અને આ પ્રકારે.
ચરમેહિં	- અન્તમાં.
લિસારસણિસસાસેહિં	- ઉચ્છ્વાસ-નિશાસ (શાસોચ્છ્વાસ) સુધી
વોસિરામિ	- ત્યાગ કરું દું.
તિ કટ્ટુ	- એમ કરીને.

ભાવાર્થ - મૃત્યુનો સમય નજીક આવવા પર, સંલેખણા તપ કરવા માટે, પૌષ્ટિશાળાનું પ્રમાર્જન (શોધન) કરવું. મળ-મૂત્ર ત્યાગવાની ભૂમિનું પ્રતિલેખન કરવું. ચાલવા કરવાની કિયાનું પ્રતિકમણ કરી પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ

રાખીને પર્યંક (પલાંઠી) આદિ આસન બેસીને, દર્ભાઈના આસન પર બેસે અને હાથ જોડીને મસ્તકેથી આવર્તન કરતા, મસ્તક પર હાથ જોડીને ‘નમોત્યુણં અરિહંતાણં ભગવંતાણં જાવ સપંતાણં’ આ ગ્રાન્ટ બોલીને સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવા. ‘નમોત્યુણં અરિહંતાણં ભગવંતાણં જાવ સંપાવિઉકામાણં’ એવું બોલીને મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળમાં જે તીર્થકર વિચરે છે તેને નમસ્કાર કરવા, ત્યારપછી પોતાના ધર્મચાર્યજી મહારાજને નમસ્કાર કરવા. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ગ્રાન્ટ ચતુર્વિધ સંઘની ક્ષમા માંગીને, સમસ્ત જીવોની ક્ષમા માંગવી. પૂર્વ ધારણ કરેલા વ્રતોમાં જો અતિચાર લાગ્યા હોય, તેની આલોચના અને નિંદા કરીને. સર્વ હિંસા, જૂઠ, ચોરી, અબ્રસ્તયર્થ (મૈથુન) અને પરિગ્રહ તથા કોધ, માન, માયા, લોભ યાવત્તુ મિથ્યાદર્શન શાલ્યરૂપ અફાર પાપસ્થાનકોના તથા સંપૂર્ણ પાપજનક પ્રવૃત્તિના ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરે. જીવન પર્યત ચાર ગ્રાન્ટરના આહારનો ત્યાગ કરે. તેના પછી મનોજ જે પોતાનું શરીર છે તેના પરથી મમત્વ દૂર કરીને અને સંલેખાણાના અતિચારનું સેવન ન કરતા શુદ્ધ અનશન કરે. જ્યારે અંતિમ સમય આવે ત્યારે સ્પર્શના દ્વારા (સંલેખના તપણું પાલન કરે) શુદ્ધ થવું.

**વિધિ -** મોટી સંલેખનાનો પાઠ પૂર્ણ થઈ ગયા પછી<sup>\*</sup> ઊભા થઈને તસ્સ ધર્મસ્સનો પાઠ તથા બે વાર ઈચ્છામિ ખમાસમણોનો પાઠ વિધિ સહિત બોલવો.

## ૧૫. તસ્સ ધર્મસ્સનો પાઠ

તસ્સ ધર્મસ્સ કેવલિ પશ્તતસ્સ અભ્યુટ્રિદોમિ આરાહૃણાએ વિરઓમિ વિરાહૃણાએ તિવિહેણં પડિકુંતો વંદામિ જિણે ચઉલ્વીસં ।

તસ્સ	- તે
ધર્મસ્સ	- ધર્મની
કેવલિપશ્તતસ્સ	- કેવળી પ્રરૂપિત
અભ્યુટ્રિદોમિ	- ઉદ્યત થયો છું
આરાહૃણાએ	- આરાધના માટે
વિરઓમિ	- વિરત થયો છું

\* અહીંથી અફાર પાપસ્થાનકના પાઠ નથી રાખ્યા, પાના નં. ૧૨ પર ઉલ્લેખ કરેલો છે.

વિરાહણાએ	- વિરાધનાથી.
તિવિહેણાં	- મન, વચન, કાયા દ્વારા
પડિકુંતો	- નિવૃત્ત થયો છું.
વન્દામિ	- વંદના કરું છું.
જિણો ચર્તુવીસં	- ચોવીસ તીર્થકરોને

**ભાવાર્થ** - હું કેવલી પ્રરૂપિત શ્રાવકધર્મની આરાધના માટે ઉઘત થયો છું અને વિરાધનાથી વિરત થયો છું. શ્રાવકધર્મનું સમ્યક્ પ્રકારે પાલન ન કરવાથી મને જે દોષ લાગ્યા છે, તેનું હું મન, વચન, કાયા દ્વારા નિવૃત્ત થવા માટે ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરું છું.

**વિધિ** - ભાવ વંદનાની અનુષ્ઠાન લઈને વજાસને બેસીને બતે કોણીઓને ઘૂંઠણો પર ટેકવીને, હાથ જોડીને, મસ્તક પર લગાવીને ‘નવકાર મંત્ર’ કહીને પાંચ પદોને વંદના કરું છું.

## ૧૬. પાંચ પદોની ભાવ વંદનાના પાઠ

### પ્રથમ ભાવ વંદના

‘નમો અરિહંતાણં’ અર્થાત્ પહેલા પદમાં શ્રી અરિહંત ભગવાન જગન્ય ૨૦ તીર્થકરજી, +ઉત્કૃષ્ટ ૧૭૦ (એકસો સિંતેર) દેવાધિદેવજી, વર્તમાનકાળમાં ૨૦ વિહુરમાન તીર્થકરજી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે. એક હજાર આઠ લક્ષાણા ધારક, ૩૪ અતિશય, ૩૫ વાણીના ગુણોથી યુક્ત, ૬૪ ઈન્દ્રોના વંદનીય, પૂજનીય, અઢાર દોષ રહિત, બાર ગુણ સહિત+ ૧) આણાસવે ૨) અમમે ૩) અંકિચણ ૪) છિન્સોએ ૫) નિરુવલવે ૬) વવગય - પેમ-રાગ-દોસ-મોહ ૭) નિર્ણાંથસ્સ પાવયણાં દેસએ ૮) સત્યનાયે ૯) આણંતનાણી ૧૦) અનંતચરિતે ૧૧) અનંતવીરિયસંજુતે આઠ

- + જગન્યનું તાત્પર્ય સૌથી ઓછું તેમ જ ઉત્કૃષ્ટનું તાત્પર્ય સર્વાધિક હોય છે. એક સાથે તીર્થકર ભગવાન ઉત્કૃષ્ટ ૧૭૦ (બધા ક્ષેત્રોના મળીને) થાય છે, માટે ૧૬૦ની સંખ્યા ઉત્કૃષ્ટ ન હોવાથી ૧૬૦ની સંખ્યાને કાઢી નાખી છે.
- + દિવ્ય ધવનિ, ભામંડલ આદિ પ્રતિહાર્ય તીર્થકર દેવોનો ભાધ વૈભવ છે તેમ જ આ પ્રતિહાર્યોમાંથી અધિકાંશ દેવકૃત હોય છે. શ્રી ઔપપાતિક સૂત્ર આદિ ગ્રંથોમાં અન્ય પ્રકારે ઉપલબ્ધ ૧૨ ગુણ જે અરિહંતોના મૌલિક આધ્યાત્મિક ગુણ છે, તેને પ્રથમ ભાવવંદનામાં સ્થાન આપ્યું છે.

મહા પ્રતિહાર્યોથી યુક્ત અઠીદ્વિપ પંદર ક્ષેત્રમાં વિચરે• પૃથ્વીત્વ કરોડ કેવળી કેવળજ્ઞાન કેવળદર્શનના ધરાણાએસર, સર્વ દ્વિપ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના જાગુનાર છે.

આણસવે	- અનાસ્તવ (આસ્તવ રહિત)
અમભે	- અમભત્વ (મમત્વ રહિત)
અકિંચનો	- અકિંચન (પરિગ્રહ રહિત)
છિભસોઓ	- શોક રહિત
નિરુપલેવે	- નિરુપલેવ (આસક્તિ રહિત)
વવગય-પ્રેમ-રાગ-દોસ-મોહ	- પ્રેમ, રાગ, દ્રેષ, મોહથી રહિત
નિર્ગંધસ્સ પાવયાણ દેસએ	- નિર્ગંધ પ્રવચનના ઉપદેશક
સત્થનાયો	- સાર્થ (સમૂહ)ના નાયક
અનંતનાણી	- અનંતજ્ઞાની
અનંતદંસી	- અનંતદર્શની
અનંતચારિતે	- અનંતચારિત્રી
અનંતવીરિયસંજુતે	- અનંતવીર્યથી યુક્ત

સવૈયા - નમો શ્રી અરિહંત, કર્મોકા કિયા અન્ત,  
 હું આ સો કેવલવન્ત, કરુણા ભણતારી હૈ ।  
 અતિશાય ચૌતીસ ધાર, પૈંતીસ વાળો ઉચ્ચાર,  
 સમજાવે નર-નાર, પર-ઉપકારી હૈ ।  
 શરીર સુન્દરકાર, સૂરજ સો જલકાર,  
 ગુણ હૈ અનન્તસાર, દોષ પરિહારી હૈ ।  
 કહુત હૈ તિલોકરિખ, મન, વચન, કાયા કરી,  
 લુલિ - લુલિ વારમ્વાર, વન્દના હમારી હૈ ॥૧॥

એવા શ્રી અરિહંત ભગવાન દીનદ્યાલજી મહારાજ આપને દિવસ સંબંધી અવિનય, આશાતના કરી હોય તો, અરિહંત ભગવાન મારા અપરાધ વારમ્બાર ક્ષમા કરો. હૃથ જોડી, માન મોડી, મસ્તક નમાવી તિક્ખુતોના પાઠથી ૧૦૦૮ વાર વંદના નમસ્કાર કરું છું. (અહીં તિક્ખુતોનો પાઠ બોલવો) આપ માંગલિક છો, ઉત્તમ છો, તે સ્વામિન! તે નાથ! આ ભવ, પરભવ, ભવો-ભવ આપના શરણા હોશે.

- આગમ અનુસાર કેવળીઓની સંખ્યા પૃથકું કરોડ છે.

## દ્વિતીય (બીજ) ભાવ વંદના

‘નમો સિદ્ધાં’ અર્થात् બીજા પદમાં શ્રી સિદ્ધ ભગવાન આઠ કર્મોનો ક્ષય કરીને મોક્ષે પહોંચ્યા છે. તીર્થ સિદ્ધ<sup>+</sup>, અતીર્થ સિદ્ધ, તીર્થકર સિદ્ધ, અતીર્થકર સિદ્ધ, સ્વયંબુદ્ધ સિદ્ધ, પ્રત્યેકબુદ્ધ સિદ્ધ, બુદ્ધબોધિત સિદ્ધ, શ્વીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નંપુસકલિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ, ગૃહસ્થલિંગ સિદ્ધ, એક સિદ્ધ, અનેક સિદ્ધ, જ્યાં જન્મ નથી, જરા નથી, મરણ નથી, ભય નથી, રોગ નથી, શોક નથી, દુઃખ નથી, દારિદ્ર્ય નથી, કર્મ નથી, કાયા નથી, મોહ નથી, માયા નથી, ચાકર નથી, ઢાકર નથી, ભૂખ નથી, તૃપા નથી, જ્યોતમાં જ્યોત બિરાજમાન, સકળ કાર્ય સિદ્ધ કરીને, ૧૫ ભેદે અનન્ત સિદ્ધ ભગવાન થયા છે – અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અવ્યાબાધ સુખ, ક્ષાયિક ચારિત્ર\*, અક્ષય સ્થિતિ\*, અમૂર્તિ, અગુરુલધુ, અનન્તવીર્ય આ આઠ ગુણોથી યુક્ત છે.

**સવૈયા -**

સકલ કરમ ટાલ, વશ કર લિયો કાલ,  
મુગતિ મેં રહ્યા માલ, આત્મા કો તારી હૈ ।  
દેખત સકલ ભાવ, હુંઆ હૈ જગત રાવ,  
સદા હી ક્ષાયિક ભાવ, ભયે અવિકારી હૈ ।  
અચલ અટલ રૂપ, આવે નહીં ભવ કૂપ,  
અનૂપ સરુપ ઊપ, એને સિદ્ધ ધારી હૈ ।  
કહુત હૈ તિલોકરિખ, બતાઓ હે વાસ પ્રભુ,  
સદા હી ઉગંતે સૂર, વન્દના હમારી હૈ ॥

એવા શ્રી સિદ્ધ ભગવાન આપને દિવસ સંબંધી અવિનય, આશાતના કરી હોય, હે સિદ્ધ ભગવન્! મારા અપરાધ વારમ્વાર ક્ષમા કરો. હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી તિક્ખુતોના પાઠથી ૧૦૦૮ વાર વંદન નમસ્કાર કરું છું. (અહીં તિક્ખુતોનો

+ અહીં તીર્થ સિદ્ધા, અતીર્થ સિદ્ધા આદિમાં ‘સિદ્ધા’ શબ્દના સ્થાન પર ‘સિદ્ધ’ કહું છે. શ્રી નંદિસૂત્રમાં આવે તીર્થસિદ્ધા આદિ અર્થમાગધી ભાષાના શબ્દ હૈ. અહીં પાઠ ગુજરાતીમાં હોવાથી ‘સિદ્ધા’ શબ્દ ન રાખીને ‘સિદ્ધ’ શબ્દ રાખ્યો છે.

\* મોહનીય કર્મના બે ભેદ છે-દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. ક્ષાયિક સમ્યકૃત્વ કહેવાથી ફક્ત દર્શન મોહનીયના ક્ષયનો બોધ થાય છે, તેથી ક્ષાયિક ચારિત્ર કહું છે. જે દર્શન મોહનીય તેમ જ ચારિત્ર મોહનીય બંનેનો ક્ષય થવા પર જ થાય છે.

\* અટલ અવગાહનાની અપેક્ષા અક્ષય સ્થિતિ કહેવાથી આયુષ્ય કર્મના ક્ષયનો સમ્યક્ બોધ થાય છે.

પાઠ બોલવો.) આપ માંગલિક છો, ઉત્તમ છો, હે સ્વામિનુ! હે નાથ! આ ભવ, પર ભવ, ભવો-ભવ આપના શરાણા હોજો.

## તૃતીય (ત્રીજી) ભાવ વંદના

‘નમો આચારિયાણં’ – અર્થાત્ત્રીજી પદમાં શ્રી આચાર્યજી મહારાજ! જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ આચાર પાળે, પાંચ મહાક્રત પાળે, પાંચ ઈન્દ્રિયોને જીતે, ચાર કૃપાયને ટાળે, નવવાડ સહિત બ્રહ્મચર્ય પાળે. પાંચ સમિતિ ત્રણ ગુણ શુદ્ધ આરાધે આ ત્રદ ગુણ સહિત હોય. અનાચારના ત્યાણી અને આઠ સંપદા – (૧) આચાર સંપદા, (૨) શ્રુત સંપદા, (૩) શરીર સંપદા, (૪) વચ્ચન સંપદા, (૫) વાચના સંપદા, (૬) ભતિ સંપદા, (૭) પ્રયોગ ભતિ સંપદા, (૮) સંગ્રહ પરિજ્ઞા સંપદા સહિત છે.

**સવૈયા -** ગુણ છે છતીસ પૂર, ધરત ધરમ ઊર,  
 મારત કરમ કૂર, સુમતિ વિચારી હૈ ।  
 શુદ્ધ સો આચારવન્ત, સુન્દર હૈ રૂપ કંત,  
 ભાણ્યા હૈ સબ હી સિદ્ધાંત, વાચણી સુખ્યારી હૈ ।  
 અધિક મધુર વેણા, કોઈ નહીં લાવે કેણા,  
 સકલ જીવોં કા સેણ, કીરત અપારી હૈ ।  
 કદત હૈ તિલોકરિખ, હિતકારી દેત સીખ,  
 એસે આચારજી કો, વંદના હુમારી હૈ ॥

એવા શ્રી આચાર્ય મહારાજ ન્યાયપક્ષી, ભદ્રિક પરિણામી, પરમ પૂજ્ય કદ્વનીય, અચેત વસ્તુના ગ્રહણહાર, સચેતના ત્યાણી, વૈરાણી, મહાગુણી, ગુણોના અનુરાગી,

\* અહીં વર્તમાન આચાર્યશ્રીના નામના શ્લોક અથવા સવૈયા\* બોલવા.

**\* સવૈયા -** રામ ગુરુ ગુણવાન, જિનશાસન કી શાન ।  
 દેતે હૈ ધરમ દાન, બાલ બ્રહ્મચારી હૈ ॥  
 હુકમ ગરદ્ય સરતાજ, સિંહ સમ રહે ગાજ ।  
 સકલ સુધારે કાજ, મહા ઉપકારી હૈ ॥  
 શુતજ્ઞાન હૈ આપાર, મૌન તપ સે હૈ ખાર ।  
 સંયમ નિરતિચાર, સમ ભાવ ભારી હૈ ॥  
 ચમકે હૈ ભવ્ય ભાલ, ચલે હૈ આગમ ચાલ ।  
 ગવરા નેમિ કે લાલ, વંદના હુમારી હૈ ॥૩॥

નોટ : અહીંયા પોત-પોતાના આચાર્યના સવૈયા બોલી શકાય છે.

સૌભાગ્યશાળી, સરળ સ્વભાવી એવા મારા ધર્મગુરુ, ધર્મચાર્ય, આચાર્ય ભગવન્▲ આપશ્શીને દિવસ સંબંધી અવિનય આશાતના થઈ હોય તો આચાર્ય ભગવન્! મારા અપરાધ વારમ્બાર ક્ષમા કરો. હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી તિક્ખુતોના પાઠથી ૧૦૦૮ વાર વંદના નમસ્કાર કરું છું. (અહીં તિક્ખુતોનો પાઠ બોલવો) આપ માંગલિક છો, ઉત્તમ છો, હે સ્વામિન્ હે નાથ! આ ભવ, પર ભવ, ભવો-ભવ આપના શરણા હોજો.

## ચોથી ભાવ વંદના

નમો ઉવજ્જાયાણં અર્થાત્ ચોથા પદમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ ૧૨ અંગના જાણકાર, ચરણ સતરી, કરણ સતરી, તેમ જ આઠ પ્રકારની પ્રભાવનાથી સંપન્ન, ત્રણ યોગનો નિગ્રહ કરવાવાળા, આ પ્રકારે ૨૫ ગુણોથી યુક્ત છે. \*વર્તમાન કાળમાં ભરત ક્ષેત્રમાં નિર્મોક્ત તર સૂત્રોના જાણકાર છે.

**અગિયાર અંગઃ** આયારો, સૂયગડો, ઠાણં, સમવાઓ, વિવાહ પણણતી, શુયાધમ્મકહુાઓ, ઉવાસગદસાઓ, અંતગાહદસાઓ અણુતરોવવાઈદસાઓ, પણહુવગરણાઈ, વિવાગસૂયં।

**બાર ઉપાંગઃ** ઓવાઈં, રાયપસેણિંયં, જીવાળવાભિગમે, પણણવણા, જમ્બૂદીવપણણતી, ચન્દ પણણતી, સૂરપણણતી, નિરયાવલિયાઓ, કપ્પવર્ડિસિયાઓ, પુફિયાઓ, પુફક્યુલિયાઓ, વાળિહુદસાઓ.

▲ અહીં શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા પોતાના આચાર્ય ભગવન્નું નામ લઈ શકાય છે.

\* શ્રાવક અને સાધુ પ્રતિકમણમાં ચોથી ભાવ વંદનામાં ઉપાધ્યાયજીના ૨૫ ગુણ આ પ્રકારે છે - ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણ સતરી, કરણ સતરી. આ ૨૫ ગુણ મધ્યાનતાથી તથા જંબૂ દ્વીપના ભરતક્ષેત્રની અપેક્ષાએ છે તેમ જ અત્યંત અર્વાચીન છે. જ્યારે આવશ્કય નિર્યુક્તિ, વિશેષ આવશ્યક ભાષ્ય આદિ અનેક પ્રાચીન ગ્રંથોમાં ઉપાધ્યાયજીને દ્વાદશાંગીનું શાન બતાવ્યું છે. જે પ્રકારે અરિહંતના ૧૨ ગુણોમાં સર્વ અરિહંતોના, ૮ ગુણોમાં સર્વ સિધ્ઘોના, ૩૬ ગુણોમાં સર્વ આચાર્યના તેમ જ ૨૭ ગુણોમાં સર્વ સાધુજીનો સામવેશ થાય છે, તે પ્રકારે ઉપાધ્યાયના ૨૫ ગુણોમાં પણ સર્વ ઉપાધ્યાયનો સામવેશ થવો જોઈએ. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ કહેવાથી મહાવિદેહમાં રહેલા દ્વાદશાંગ સંપન્ન ઉપાધ્યાયોનો એમાં સમાવેશ ન થાય તેમ જ વર્તમાનમાં જે ૧૨ ઉપાંગને માનવાની આપાજી પરંપરા છે, ઈરવત આદિ ક્ષેત્રોમાં તે જ અને તેટલી સંખ્યામાં જ ઉપાંગ છે, એવું સંભવ ઓછું છે. એક પ્રાચીન ગ્રંથ શ્લોક અનુસાર આ ૨૫ ગુણ જાણવા જોઈએ. ૧૨ અંગના જાણકાર, ચરણ સતરી, કરણ સતરી, ૮ પ્રકારની પ્રભાવનાથી સંપન્ન, ૩ યોગોના નિગ્રહ કરવાવાળા-૧૨+૧+૧+૮+૩=૨૫

**શ્લોક - બાર સંગવિઉ બુધ્ધા, કરણચરણજીઓ પભાવણા, જોગનિગ્યાદો, ઉવજ્જાયગુણં વંદે ॥**

**ચાર મૂળ સૂત્ર- ઉત્તરજગ્યાણાઈ,** દસવૈકાલિયં, નંદી, આણુઓગદારાઈ.

**ચાર છેદ-** દસાસુયક્ખખંધો, વિહકપો, વવહારો, નિસીહું અને બત્તીસમું આવસ્સયં તથા અનેક ગ્રંથોના જાણકાર, સાત નય, નિશ્ચય વ્યવહાર, ચાર પ્રમાણ આદિ સ્વમત તથા અન્યમતના જાણકાર, મનુષ્ય અથવા દેવતા, કોઈપણ વિવાદ જેને છળવામાં સમર્થ નથી. જિન નહીં પણ જિન જેવા, કેવલી નહીં પણ કેવલી જેવા છે.

અથવા ૧૧ અંગથી.... કેવલી જેવા છે, આ રીતે પણ બોલી શકાય છે.

**અગિયાર અંગ-** આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ\*, શાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, અનુતરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર

**બાર ઉપાંગ-** ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાજીવાભિગમ, પ્રજ્ઞાપના, જમ્બૂડીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા, કલ્પાવંતસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા, વૃણિદશા

**ચાર મૂળ સૂત્ર- ઉત્તરાધ્યયન,** દશવૈકાલિક, નંદીસૂત્ર, અનુયોગદાર

**ચાર છેદ-** દશાશ્વતરસ્કન્ધ, ભૂહૃતકલ્પ, વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર અને બત્તીસમું આવશ્યક સૂત્ર તથા અનેક ગ્રંથોના જાણકાર સાત નય, નિશ્ચય વ્યવહાર, ચાર પ્રમાણ આદિ સ્વમત તથા અન્યમતના જાણકાર, મનુષ્ય અથવા દેવતા કોઈપણ વિવાદ તેને છળવામાં સમર્થ નથી. જિન નહીં પણ જિન સરીખા છે. કેવળી નહીં પણ કેવળી સરીખા છે.

**સૈવ્યા:** પઢત ઈજ્યારે અંગ, કરમો સું કરે જંગ,  
પાખંડી કો માનભંગ, કરણ હુશિયારી હૈ ।  
ચવદે પૂરબ ધાર, જાનત આગમ સાર,  
ભવિયન કે સુખકાર, ભ્રમતા નિવારે હૈ ।  
પઢાવે ભવિકમ, સ્થિર કર દેત મન,  
તપ કર તાવે તન, મભતા નિવારી હૈ ।  
કહત હૈ તિલોકરિખ, જ્ઞાન ભાનુ પર તિખ,  
એસે ઉપાધ્યાયજી કો, વંદના હમારી હૈ ।

\* વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિનું બીજું નામ ભગવતી સૂત્ર પણ છે

આવા શ્રી ઉપાધ્યાયજી મહારાજ મિથ્યાત્વરૂપ અંધકારને ભિટાવનાર, સમકિતરૂપ ઉદ્ઘોતના કરણાહાર, ધર્મથી ડગતા પ્રાણીને સ્થિર કરનાર, સારણા વારણા, ધારણા ઈત્યાદિ અનેક ગુણ સહિત છે. એવા શ્રી ઉપાધ્યાયજી મહારાજ! આપને, આજના દિવસ સંબંધી અવિનય, આશાતના કરી હોય તો હે ઉપાધ્યાયજી મહારાજ! મારા અપરાધને વારંવાર ક્ષમા કરો. હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી તિક્ખુતોના પાઠથી ૧૦૦૮ વંદના નમસ્કાર કરું છું. (અહીં તિક્ખુતોનો પાઠ બોલવો) આપ માંગલિક છો. ઉત્તમ છો. હે સ્વામિન! હે નાથ ! આ ભવ, પર ભવ, ભવો-ભવ આપના શરાણ હોજો.

## પાંચમી ભાવ વંદના

‘નમો લોએ સવ્વસાહૂણ’ અર્થાત् પાંચમાં પદમા\*\* પૃથ્ફૂત્વ હજાર કરોડ શ્રી સાધુજી મહારાજ અઢીદીપ, પંદર ક્ષેત્ર રૂપ લોકમાં વિચરે છે. પાંચ મહુાવત પાળવાવાળા, પાંચ ઈન્દ્રિયોને જીતવાવાળા, ચાર કષાયના ત્યાંગી, ભાવ સર્ચે, કરણ સર્ચે, જોગ સર્ચે, ક્ષમાવંત, વૈરાગ્યવંત, મનસમાધારણયા, વયસમાધારણયા, કાયસમાધારણયા, નાણ સંપણણયા, \*દંસણ સંપણણયા, ચારિત સંપણણયા, વયણ અહિયાસયણા\* મારણંતિય, અહિયાસયણા આ ૨૭ ગુણોથી યુક્ત, ૫ આચાર પાળવાવાળા, ૬ કાયની રક્ષા કરવાવાળા, ૭ કુલ્યસનના ત્યાંગી, ૮ મદના નાશક, નવવાડ સહિત બ્રહ્મયર્થનું પાલન કરવાવાળા, ૧૦ પ્રકારના યતિધર્મના ધારક, ૧૨ પ્રકારની તપસ્યા કરવાવાળા, ૧૭ પ્રકારના સંયમના પાલક, ૧૮ પાપના ત્યાંગી, ૨૨ પરિષહને જીતવાવાળા, ૪૨ દોષ રહિત આહાર, પાણી લેવાવાળા, ૫ માંડલાના દોષો ત્યાગવાવાળા, બાવન અનાયારના ત્યાંગી, તેદિયા આવે નહીં, નોતર્યા જમે નહીં, સચેતના ત્યાંગી, અચેતના ભોગી, લોચ કરે, ખુલ્લા પગે ચાલે ઈત્યાદિ કાય-કલેશ કરવાવાળા અને મોહ-મમતા રહિત છે.

\*\* પૂર્વે અહીં જધન્ય ૨ હજાર કોડ, ઉત્કૃષ્ટ ૮ હજાર કોડ કહેવાય છે, પરંતુ વિહરમાનના વર્જિનમાં જધન્ય ૨ હજાર કોડ સાધુ તેમ ૪ જધન્ય ૨ હજાર કોડ સાધ્વીઓ કહેવામાં આવી છે. આ કારણે પાંચમા પદની જધન્ય સંખ્યા ૪ હજાર કોડ થાય છે તેમ ૪ પૃથ્ફૂત્વનો જધન્ય ભાગ ર શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫ ઉદેશક ૬/૭માં પ્રતિસેવણા કુશીલના જધન્ય પરિમાણના યોગ કરીએ તો જધન્ય સંખ્યા ૨૬૦૦ કરોડ થાય છે. આથી શ્રી ભગવતી સૂત્ર ૨૫, ઉદેશક-૬,૭માં પૃથ્ફૂત્વ હજાર કરોડ સાધુઓનો ઉલ્લેખ છે. તદ્દનુસાર અહીં પાંચમા પદમાં પૃથ્ફૂત્વ હજાર કરોડનું કથન કરવું જોઈએ.

\* શ્રીમદ્ભૂસમવાયાંગ સૂત્રના ૨૭માં સમવાયમાં વેયણઅહિયાસયણા તેમ ૪ મારણંતિય અહિયાસયણા પાઠ છે. વેદનીય સમાઅહિયાસનીયા, મારણાંતિક સમાઅહિયાસનીય અશુદ્ધ છે.

ભાવ સર્વે	- ભાવથી સત્ય
કરણ સર્વે	- કિયાથી સત્ય
જોગ સર્વે	- મન, વચન ને કાયાના યોગથી સત્ય
મનસમાધારણયા	- મનની સમાધિ
વચસમાધારણયા	- વચનની સમાધિ
કાયસમાધારણયા	- કાયાની સમાધિ
નાણ સંપણણયા	- જ્ઞાન સંપન્નતા
દંસણ સંપણણયા	- દર્શન સંપન્નતા
ચારિત સંપણણયા	- ચારિત સંપન્નતા
વેચણ અહિયાતણયા	- વેદનાની સહનશીલતા
મારણંતિય અહિયાતણયા	- મરણના સયમે થવાવાળી વેદનાની સહનશીલતા
સહૈયા	આદરી સંયમ ભાર, કરણી કરે અપાર સમિતિ ગુપતિ ધાર, વિકથા નિવારી હૈ। જ્યાણ કરે છહ કાય, સાવધ ન બોલે વાય, બુઝાય કખાય લાય, કિરિયા ભંડારી હૈ। જ્ઞાન ભાડો આડોં યામ, લેવે ભગવન્ત નામ, ધરમ કો કરે કામ, મમતા કું મારી હૈ। કહતે હૈ તિલોકરિખ, કર્મો કા ટાલે વિખ, એસે મુનિરાજ તાકું, વન્દના હમારી હૈ।

એવા શ્રી મુનિરાજ મહારાજ આપને દિવસ સંબંધી અવિનય આશાતના કરી હોય તો હૈ મુનિરાજ ! મારા અપરાધને વારંવાર ક્ષમા કરો, હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, તિક્ખુતોના પાઠથી ૧૦૦૮ વાર વંદના નમસ્કાર કરું છું. (અહીં તિક્ખુતોનો પાઠ બોલવો) આપ માંગલિક છો, ઉત્તમ છો, હે સ્વામિન્! હે નાથ! આ ભવ, પર ભવ ભવોભવ આપના શરણા હોજો.

**વિધિ-** પલાઈના આસનમાં બેસીને અનંત ચૌવીસી વગેરે દોહા, આયરિય ઉવજ્જાયનો પાઠ, અઠીદ્વિપનો પાઠ, ચૌર્યાસી લાખ જીવાયોનિનો પાઠ, ખામેભિ સવે જીવાનો પાઠ, અઢાર પાપરથ્યાનકનો પાઠ બોલવો.

## દોહુ ।

અનાત્મ ચોવીસી જિન નમું, સિદ્ધ અનાત્મ કોડ ।  
કેવલજ્ઞાની ગાણધરા, વન્દું બે કર જોડ ॥ ૧ ॥

અરિદુન્ત સિદ્ધ સમરું સદા, આચારજ ઉપાધ્યાય ।  
સાધુ સકલ કે ચરણ કો, વન્દું શીશા નમાય ॥ ૨ ॥

ધન સાધુ, ધન સાધ્યી, ધન-ધન હૈ જિન ધર્મા  
યે સમસ્યાં પાતક ઝરે, ટૂટે આઈં કર્મ ॥ ૩ ॥

શાસનનાયક સુમરિયે, ભગવન્ત વીર જિણાંદ ।  
અલિય વિધન દૂરે હરે, આપે પરમાનંદ ॥ ૪ ॥

અંગૂહે અમૃત વસે, લબ્ધ તાણા ભંડાર ।  
શ્રી ગુરુ ગૌતમ સુમરિયે, વંછિત ફલ દાતાર ॥ ૫ ॥

લોભી ગુરુ તારે નહીં, તિરે સો તારણાહાર ।  
જો તું તિરિયો ચાહે તો, નિર્લોભી ગુરુ ધાર ॥ ૬ ॥

પર ઉપકારી સાધુજી, તારણ તરણ જહાજ ।  
કર જોડી હું નિત નમું, દાન મોટા મુનિરાજ ॥ ૭ ॥

સાધુ સતી ને સૂરમા, જ્ઞાની ને ગજદન્ત ।  
ઇતના પીછા ન હુટે, જો જુગ જાય અનાત્મ ॥ ૮ ॥

ગુરુ દિપક ગુરુ ચાંદાંદો, ગુરુ બિન ઘોર અંધાર ।  
પલક વિસરું તુમ ભાણી, ગુરુ મુજ પ્રાણ આધાર ॥ ૯ ॥

## ૧૭ આયરિય ઉવજજાએનો પાઠ

આયરિય-ઉવજજાએ, સીસે સાહુમાએ કુલગાણી ય ।  
જે મે કેઈ કસાયા, સવ્વે તિવિહેણ ખામેભિ ॥ ૧ ॥

સવ્વસ્સ સમાણસંઘર્સ, ભગવાઓ અંજલિ કરિઅ સીસે ।  
સવ્વ ખમાવઈતા, ખમામિ સવ્વસ્સ અહુયં પિ ॥ ૨ ॥

સત્ત્વસ્સ જીવરાસિરસ, ભાવઓ ધ્રમનિહિયનિયચિતો ।

સત્ત્વં ખમાવઈતા, ખમાભિ સત્ત્વસ્સ અહૃયં પિ ॥૩ ॥

(મરાણસમાધિ મકીર્જિક અને સંસ્તારક મકીર્જિક)

રાગોણ વ દોસેણ વ, અહવા અક્યાણાણુણા પડિનિવેસેણ ।

જ મે કિંચિ વિ ભણિઅં, તમહું તિવિહેણાં ખામેમિ ॥૪ ॥

આચારિય - આચાર્ય મહારાજ

ઉવજજાએ - ઉપાધ્યાય મહારાજ

સીસે - શિષ્યો

સાહુમિંમાએ - સાધર્મિકો

કુલ - કુલ-એક આચાર્યનો શિષ્ય સમુદ્દાય

ગાણો - ગાણા - સમૂહ પર

જે - જો

મે - મે

કેઈ - કોઈ

કસાચા - કોઘાટ કખાય (કર્યા હોય)

સત્ત્વે - સર્વ

તિવિહેણાં - ત્રાણ યોગથી (મન, વચન, કાયાથી)

ખામેમિ - ક્ષમા માંગું છું

સત્ત્વસ્સ - સર્વ

સમાણસંઘસ્સ - શ્રમાણ સંઘ - સાધુ સમુદ્દાય

ભગવાં - ભગવાનને

અંજલિં - બંને હુથ જોડીને

કરિઅ - કરીને

સીસે - સિર પર

સત્ત્વં - સર્વની

ખમાવઈતા - ક્ષમા માંગીને

ખમાભિ - ક્ષમા કરું છું

સત્ત્વસસ	- બધાને
અહુયં પિ	- હું પણ
સત્ત્વસસ	- સર્વ
જીવરાસિસસ	- જીવરાશિમાં
ભાવઓ	- ભાવથી
ધર્મનિહિયનિયચિતો	- ધર્મમાં ચિત્તને સ્થિર કરીને
સત્ત્વં	- સર્વની
ખમાવઈતા	- ક્ષમા માંગીને
ખમાભિ	- ક્ષમા કરું છું.
રાગોણા	- રાગથી
દોસોણા	- દ્રોષથી
અહુવા	- અથવા
અક્ષયણણુણા	- અકૃતશતાથી
પડિનિવેસણાં	- આગ્રહુવશ
જ્	- જો
મે	- મને
કિં ચિ વિ	- કાંઈપણા
ભણિએં	- કદ્યું હોય
તમહું	- તેના માટે હું
તિવિહેણાં	- મન, વચન, કાયાથી
ખામેભિ	- ક્ષમા માંગું છું.

**ભાવાર્થ** - આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને તેના પર મેં કોઈ કષાય કર્યો હોય, તે બધાની, હું મન, વચન, કાયાથી ક્ષમા માંગું છું ॥ ૧ ॥

હાથ જોડીને બધા પૂજ્ય મુનિગણો પાસે હું અપરાધની ક્ષમા માંગું છું અને હું પણ તેમને ક્ષમા કરું છું ॥૨॥

ધર્મમાં ચિત્તને સ્થિર કરીને, સંપૂર્ણ જીવો પાસે હું મારા પોતાના અપરાધની ક્ષમા માંગું છું અને હું સ્વયં પણ તેમના અપરાધને ક્ષમા કરું છું ॥૩॥

રાગ, દ્રેષ, અકૃતક્ષતા અથવા આગ્રહવશ મેં કાંઈ કર્યુ હોય, તેને માટે હું મન,  
વચન, કાયાથી બધાની ક્ષમા માંગું છું. ॥૪॥

## ૧૮. અઠીદ્વીપનો પાઠ

અઠીદ્વીપ, પંદર ક્ષેત્ર તથા અઠીદ્વીપની બહાર અસંખ્યાત દ્વીપ-સમુદ્રમાં\* શ્રાવક - શ્રાવિકાઓ દાન આપે, શીલ પાળે, તપસ્યા કરે, ગ્રાણ મનોરથ ચિંતવે, ચૌદ નિયમ પાળે, જીવાદિક નવ પદાર્થ જાણે, શ્રાવકના ૨૧ ગુણો યુક્ત, એક વ્રતધારી યાવત् ૧૨ વ્રતધારી, જે ભગવાનની આજ્ઞામાં વિચરે, એવા મોટા લોકોને હુથ જોડીને, પગ પકડીને ક્ષમા માંગું છું. આપ ક્ષમા કરો. આપ ક્ષમા કરવા યોગ્ય છો અને નાના લોકોને સમુચ્ચય ખમાવું છું.

## ૧૯. ચોરાશી લાખ જીવાયોનિનો પાઠ

સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપ્કાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્ડ્રિય, બે લાખ તેઈન્ડ્રિય, બે લાખ ચૌરેન્ડ્રિય, ચાર લાખ નારકી, ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પંચેન્ડ્રિય, ચૌદ લાખ મનુષ્ય (કુલ ૮૪ લાખ) એવા ચાર ગતિમાં આ ચોરાશી લાખ જીવાયોનિના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત જીવોને મારા જીવે, દ્રાવતા - ચાલતા, ઊઠતા - બેસતા, જાણતા - અજાણતા, દ્રાઘ્યા હોય, હોય, હણાવ્યા હોય, હણતાને અનુમોદન આપ્યું હોય, છેદા હોય, બેદા હોય, પરિતાપના-કિલામના ઉપજાવી હોય, તો મન-વચન-કાયાથી-દિવસ સંબંધી તસ્સ મિચામિ દુક્કડં.\*

\* તિર્યંચ પંચેન્ડ્રિય શ્રાવક અઠીદ્વીપની બહાર દ્વીપ-સમુદ્રમાં હોય છે, તેથી આ પાઠમાં એમને પણ શ્રાદ્ધ કર્યા છે.

\* જીવના ૫૬૩ બેદોને અભિહૃદ્યા, વત્તિયા આદિ ૧૦ સાથે ગુણાકાર કરવાથી ૫૬૩૦, ૫૭૩ી તેને રાગ-દ્રેષ સાથે ગુણાકાર કરવાથી ૧૧૨૬૦ બેદ બને છે. ઈત્યાદિ આગળની પ્રક્રિયા કરતા ૧૮, ૨૪, ૧૨૦ મ્રકરે આ પાઠમાં મિચામિ દુક્કડં આપવામાં આવ્યું છે. ૫૬૩ બેદોમાં સૂક્ષ્મનો પણ સમાવેશ થઈ જાય છે. તે જીવોને અભિહૃદ્યા, વત્તિયા આદિ પ્રકારોથી તેમ જ ત્રિમોગોમાં કાયાથી સાક્ષાત્ હિંસા સંભવ ન હોવાથી ૧૮, ૨૪, ૧૨૦ બેદ થતા નથી. આથી પૂર્ણ સંગતિ ન હોવાથી આ પાઠ કાઢી નાખવામાં આવ્યો છે.

## ૨૦. ખામેભિ સત્ત્વ જીવેનો પાઠ

ખામેભિ સત્ત્વજીવે\*, સત્ત્વે જીવા ખમંતુ મે ।

મિતી મે સત્ત્વભૂઅસુ, વેરં મજજં ન કેણાઈ ॥

એવમહં આલોઈય, નિંદિયગરહિયદુગુંછિઉ<sup>x</sup> સમ્મં ।

તિવિહેણ પડિક્કંતો, વંદામિ જિાગે ચઉવ્વીસં ॥

ખામેભિ	- ખમાવું છું,
સત્ત્વે	- સર્વ (બધાં)
જીવે	- જીવોને.
સત્ત્વે	- સર્વ
જીવા	- જીવો
ખમંતુ	- ક્ષમા કરે
મે	- મને.
મિતી	- મિત્રતા છે
મે	- મારી
સત્ત્વભૂઅસુ	- બધા જીવો સાથે.
વેરં	- વેરભાવ (શત્રુતા)
મજજં	- મારે
ન	- નથી
કેણાઈ	- કોઈની સાથે.
એવં	- આ રીતે
અહું	- હું
આલોઈય	- આલોચના કરીને
નિંદિય	- નિંદા કરીને
ગરહિય	- ગર્હા કરીને
દુગંછિઉ	- જુગુપ્સા (ગલાનિ - ઘૃણા) કરીને
સમ્મં	- સમ્યક્ ગ્રકારે
તિવિહેણ	- ત્રણો યોગોથી
પડિક્કંતો	- પાપકર્મોથી નિવૃત્ત થઈને

\* પહેલા અહીં ‘સત્ત્વે જીવા’ બોલાતું હતું, પરંતુ આવશ્યક ચૂંઝીં આંદ પ્રાચીન ગંથોમાં ‘સત્ત્વજીવે’ પાઠ ઉપલબ્ધ હોવાથી તદ્દનુસાર અહીં શુદ્ધ પાઠ રાખ્યો છે.

<sup>x</sup> ‘દુગંછિય’ ના સ્થાન પર આ શુદ્ધ પાઠ છે.

વંદામિ	- વંદન કરું છું.
જિણો	- અરિહંત ભગવાનોને
ચઉલ્વીસં	- ચોવીશો

**ભાવાર્થ** - મારાથી કોઈપણ જીવનો અપરાધ થયો હોય, તો હું તેની ક્ષમા માંગું છું. બધા પ્રાણી મને ક્ષમા કરે. સંસારના પ્રાણી માત્ર સાથે મારી મિત્રતા છે, મારું કોઈ સાથે વેર - વિરોધ નથી. હું મારા પાપોની નિંદા, આલોચના, ગર્હ અને જુગુપ્સા કરું છું તથા મન, વચન, કાયાથી તે પાપોથી નિવૃત્ત થાઉં છું. ચોવીસ તીર્થકરોને વંદના કરું છું.

અહીં ચોથો આવશ્યક પૂર્ણ થાય છે.

**વિધિ** - ત્રણવાર તિક્ખુતોના પાઠથી વંદના કરીને ‘પાંચમા કાયોત્સર્ગ આવશ્યકની આજ્ઞા છે.’ એવું કહીને ઉભા - ઉભા પ્રાયશ્ચિત્તનો પાઠ, ‘નવકાર મંત્ર’, ‘કરેમિ ભંતે’, ‘ઈચ્છામિ ઠાઈઉ’ અને તસ્સ ઉત્તરીનો પાઠ બોલીને કાયોત્સર્ગ કરવો. કાયોત્સર્ગમાં દેવસિક, રાત્રિક પ્રતિકમણુમાં ૪ લોગસ્સ, પાખી પ્રતિકમણુમાં ૮ લોગસ્સ, ચાતુર્માસિક પ્રતિકમણુમાં ૧૨ લોગસ્સ અને સાવંત્સરિક પ્રતિકમણુમાં ૨૦ લોગસ્સનો કાઉસ્સગ કરવો. ‘નમો અરિહંતાણ’ કહીને કાયોત્સર્ગ પાળવો, પછી ‘નવકાર મંત્ર’, ‘કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ’, અને લોગસ્સનો પાઠ બોલીને બે વાર ‘ઈચ્છામિ ખમાસમણુનો’ પાઠ ઉપર્યુક્ત વિધિસહિત બોલવો. ‘પાંચમો કાયોત્સર્ગ’ આવશ્યક સમાપ્ત થયો. ‘તિક્ખુતો’ ના પાઠથી ‘છટા આવશ્યકની આજ્ઞા’ લેવી.

## ૨૧. પ્રાયશ્ચિત્તનો પાઠ

ઈચ્છામિ ણાં ભંતે તુલભેહિ’ અભભાણણુણાએ સમાણો - દેવસિયં પાયશ્ચિત્ત વિસોહણાત્થં કરેમિ કાઉસ્સગાં.

ઈચ્છામિ	- હું ઈચ્છા કરું છું
ણાં	- આ અવ્યવ છે વક્ય અલંકારમાં વપરાય છે.
ભંતે	- હે પૂજ્ય ! હે ભગવાન !
તુલભેહિ	- આપની
અભભાણણુણાએ સમાણો	- આજ્ઞા મહ્યેથી
દેવસિયં	- દિવસ સંબંધી

- રાઈય પ્રતિકમણુમાં રાઈય, પાખી પ્રતિકમણુમાં પદ્ધિખ્ય, ચોમાસી પ્રતિકમણુમાં રાઈય ચાઉમમાસિય, સાંવંત્સરિક પ્રતિકમણુમાં ‘સંવચ્છરિય’ બોલવું.

પ્રાયશિક્તિ	- પ્રાયશિક્તિ
વિસોહણાત્મં	- વિશુદ્ધ કરવા માટે
કરેભિ	- કરું છું
કાઉસ્સર્ગં	- કાયોત્સર્ગ.

**ભાવાર્થ** - હે ભગવાન ! મને આપની આજ્ઞા મળવા પર દિવસ સંબંધી પ્રાયશિક્તિની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું છું.

**વિધિ** - છદ્રા પરચ્યક્ખાણ આવશ્યકમાં ઊભા થઈને, આસનથી નીચે ઉત્તરીને, સાધુ મહારાજ પાસે શક્તિ અનુસાર પરચ્યક્ખાણ કરવા. જો સાધુ મહારાજ ન હોય તો મોટા શ્રાવકજી પાસે પરચ્યક્ખાણ લેવા. જો તે પણ ન હોય તો પોતે ‘સમુચ્ચય પરચ્યક્ખાણ’ના પાઠથી પરચ્યક્ખાણ કરવા, પછી અંતિમ પાઠ બોલીને નીચે બેસવું અને ડાબો ઘૂંટણ ઊભો કરીને, ઉપર્યુક્ત વિધિથી બે વાર ‘નમોત્થુણં’ તેમ જ ધર્મગુરુ ધર્મચાર્યની સુતિ પાઠ બોલવો, પછી તિક્ખુતોના પાઠથી ગુરુ મહારાજને વંદના કરવી. જો તે ત્યાં ન બિરાજતા હોય તો પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ કરીને ધર્મચાર્યજીને વંદના કરવી અને ત્યારબાદ સ્વધર્મી ભાઈ-બહેનોને ખમાવવા પછી ચોવીસી, સ્તવન વગેરે બોલવા.

## ૨૨ સમુચ્ચય પરચ્યક્ખાણનો પાઠ

ગંડિસહિયં, મુટ્ટિકસહિયં, નમુક્કારસહિયં, પોરિસિયં, સાઇટ પોરિસિયં તિવિહંપિ ચાઉવિહંપિ આહારં, અસાણં, પાણં, ખાઈમં, સાઈમં (પોત-પોતાની ઈચ્છા અનુસાર) આગૃણાત્યાણાભોગેણં, સહસાગરેણં, મહુતરાગરેણં, સત્ત્વ સમાહિવત્તિયાગરેણં, વોસિરામિં”.

ગંડિસહિયં	- ગાંઠ સહિત એટલે જ્યાં સુધી ગાંઠ બાંધેલી રાખું ત્યાં સુધી.
મુટ્ટિકસહિયં	- મુટ્ટિક સહિત એટલે જ્યાં સુધી હું મુટ્ટી બંધ રાખું ત્યાં સુધી.
નમુક્કારસહિયં	- નમસ્કાર સહિત અર્થાત્ જ્યાં સુધી નવકારમંત્ર બોલું ત્યાં સુધી (એક મુદ્દૂર્ત)નો ત્યાગ.
પોરિસિયં	- એક ગ્રહરનો ત્યાગ.

- સ્વયં પરચ્યક્ખાણ કરવા હોય અથવા બીજાને કરાવવા હોય, બસે સ્થિતિમાં ‘વોસિરામિ’ જ બોલવું.

સાદ્ગ પોરિસિયં	- દોઢ પ્રહરનો ત્યાગ.
આણણત્થણપાભોગેણં	- ઉપયોગ વિના કોઈ વસ્તુનું સેવન કર્યું હોય.
સહસ્રારેણં	- અક્ષમાત્ જેવી રીતે પાણી વરસતું હોય અને મુખમાં છાંટા પડી જાય અથવા છાસ વલોવતા હોઈએ ને મુખમાં છાંટા પડી જાય તો તે આગાર છે.
મહત્તરાગારેણં	- તપની અપેક્ષા મહાન કાર્ય સેવા આદિ હોવા પર તપની વર્ચ્યે આહાર કરવો પડે તો તે આગાર છે.
સત્ત્વ સમાહિવત્તિયાગારેણં	- બધા પ્રકારની શારીરિક, માનસિક નિરોગતા રહે ત્યાં સુધી અર્થાત્ શરીરમાં ભયંકર રોગ થઈ જાય તો દવા આદિનો આગાર છે.
વોચિરામિ	- ત્યાગ કરું છું.

**ભાવાર્થ** - જ્યાં સુધી ગાંડ બાંધેલી રાખું, ત્યાં સુધી અથવા મુટ્ઠી બંધ રાખું ત્યાં સુધી અથવા અર્દ્ધરાત્રિથી સૂર્યોદય પછી ૪૮ મિનિટ સુધી અથવા એક પ્રહર સુધી અથવા દોઢ પ્રહર સુધી (આમાંથી જેને જે પ્રકારનો ત્યાગ કરવો હોય તેને તેનું જ આચરણ કરવું જોઈએ.) અશન, ખાદ્ય, સ્વાદ્ય આ ત્રાણે પ્રકારના આહારનો ત્યાગ પાણીનો આગાર રાખીને અથવા પાણી સહિત ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. આગાર આ પ્રમાણે છે - પ્રત્યાખ્યાનનો ઉપયોગ ન રહેવાથી અથવા અક્ષમાત્ કંઈ ખાવા-પીવામાં આવી જાય અથવા ગુરુજનોની આજાથી કંઈ ખાવું-પીવું પડે તો તે આગાર છે તથા સ્વસ્થ - અવસ્થામાં આ ત્યાગ છે. અસ્વસ્થ થવા પર આવશ્યક ઔષધિ પીવાનો મારો આગાર છે.

## 23. અનિતમ પાઠ

સામાચિક એક, ચંદ્રવીસત્થય બે, વંદના ગ્રાણ, પ્રતિકમણ ચાર, કાયોત્સર્ગ પાંચ, પચ્ચકખાળા છિ : આ છ આવશ્યક પૂર્ણ થયાં, છ આવશ્યકમાં જાળતા-અજાળતા

- અંતિમ પાઠનું ઉચ્ચારણ પ્રતિકમણની વિવિમાં થેથેલી ભૂલોની શુદ્ધિ માટે તેમ જ કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ કાયોત્સર્ગમાં આવેલા દોષો દૂર કરવા માટે છે. પ્રતિકમણના અન્ય પાછોથી સંપૂર્ણ દિવસ, રાત્રિના ક્રતોમાં લાગેલા દોષોની શુદ્હિ કરવામાં આવે છે, માટે અહીં યથાવસર દિવસ સંબંધી, રાત્રિ સંબંધી વગેરે બોલવું જોઈએ, પરંતુ આ પાઠોને દિવસ / રાત્રિ જેવા કોઈ સંબંધ ન હોવાથી આ પાઠોમાં દિવસ-રાત્રિ સંબંધી ન બોલવું. ફક્ત તસ્સ મિચામિ દુક્કડં બોલવું જોઈએ.

કોઈ અતિચાર દોષ લાગ્યો હોય, પ્રતિકમાણ અવિવિધી કર્યું હોય, સૂત્ર વિપરીત કર્યા હોય, પાઠ ઉચ્ચારણ કરતી વખતે કાનો, માત્રા, અનુસ્વાર, પદ, અક્ષર, ક્ષસ્વ, દીર્ઘ-ન્યૂનાધિક આધા-પાછા ભાગાયા હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.

મિથ્યાત્વનું પ્રતિકમાણ, અગ્રતનું પ્રતિકમાણ, પ્રમાદનું પ્રતિકમાણ, કખાયનું પ્રતિકમાણ, અશુભયોગનું પ્રતિકમાણ આ પાંચ પ્રતિકમાણોમાંથી કોઈ પ્રતિકમાણ કર્યું ન હોય હાલતા-ચાલતા, ઉઠતા-બેસતા, ભાણતા-ગાણતા, જાણતા-અજાણતા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.

ગયા કાળનું પ્રતિકમાણ, વર્તમાન કાળનો સંવર<sup>०</sup> ભવિષ્યકાળ (આગામી કાળ)ના પચ્ચાફ્ફાણ તેના વિષે જો કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.

સમ, સંવેગ, નિર્વેદ, અનુકૂળ, આસ્થા-એ વ્યવહાર સમકિતના પાંચ લક્ષણ છે, તેને હું ધારણ કરું છું. દેવ-અરિહંત, ગુરુ નિર્ગંધ (આચાર્ય પૂજન્ય શ્રી ૧૦૦૮ શ્રી રામલાલજી મહારાજ સાહેબ), કેવળી ભાષિત દ્યામય ધર્મ આ ત્રાણ તત્ત્વ સાર છે. સંસાર અસાર છે. ભગવન્ત મહારાજ આપનો માર્ગ સર્ચયં સર્ચયં છે થવ થૂઠ મંગાલં.

॥ પ્રતિકમાણ સૂત્ર સમાપ્ત ॥

- સામાયિક હોય, સંવર હોય કે પૌષ્ટધ હોય આ પાઠમાં વર્તમાનકાળનો સંવર જ બોલવું જોઈએ. સામાયિક અને પૌષ્ટધ પાણ એક પ્રકારનો સંવર જ છે. શ્રીમદ્ ભગવતી સૂત્રમાં અતીતં પદિ-કક્ષમઈ, પુરુણનં સંવરેઠ પાઠ છે. પુરુણનં સંવરેઠનું તાત્પર્ય વર્તમાનકાળનો સંવર છે, માટે આગમિક વર્ણને પ્રધાનતા આપતા, આ પાઠ રાખવામાં આવ્યો છે.

# ચૌબીસી

(તર્જ: સાતા કી જો જુ)

સબ મિલ બોલો જુ

ચૌબીસ જિણંદ જુ કી જ્ય - જ્ય બોલો જુ ॥ ટેર!!

સબ મિલ બોલો જુ ॥

ઝખભ અજિત સંભવ પ્રિયકારા, અભિનંદન ઉજિયારાજુ ।

સુમતિ પદ્મ સુપાર્વ જિનેશ્વર તારાગાહારા જુ ।

સબ મિલ બોલો જુ ॥

ચંદ્ર ચરણ સુવિધિ જિન શીતલ, શ્રેયાંસ શ્રેયકારી જુ ।

વાસુપૂર્જ્ય જિન વિમલ અનંત મોહનગારા જુ ।

સબ મિલ બોલો જુ ॥

ધર્મ શાંતિ શ્રી કુંથું જિનવર, અર મલિલ અવિકારી જુ ।

મુનિસુવત નમિ નેમ ભજે તસ, તેજ સિતારા જુ ।

સબ મિલ બોલો જુ ॥

પારસ રસ પા વીર જિનેશ્વર, શાસનપતિ રખવારા જુ ।

અનંત ચોવીસી નિત, ધ્યાઉં સદાબહાર જુ ।

સબ મિલ બોલો જુ ॥

ઝારહ ગાંધર શ્રુત ગંગા કો, મુનિજન ને સ્વીકારાજુ ।

રામ હિતકર ગુરુ ચરણન સે પાય કિનારાજુ ।

સબ મિલ બોલો જુ ॥

# પ્રતિકમણાની વિધિ

## ચારુવીસત્થય

- ૧) સ્થાનકમાં મહારાજસાહેબ બિરાજમાન હોય તો તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરવી. જો મહારાજસાહેબ બિરાજમાન ન હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને ત્રણવાર વંદના કરવી. આચાર્ય ભગવન્... (પોત-પોતાના ધર્માચાર્યજીનો નામ લેવું)ની આજ્ઞા લઈને ચારુવીસત્થય કરવો અથવા આચાર્ય પ્રવર પૂજ્ય ૧૦૦૮ શ્રી રામલાલજી મહારાજસાહેબની આજ્ઞાથી દેવસિય પ્રતિકમણ તેમ જ ચારુવીસત્થય કરું છું/કરીએ છીએ.
- ૨) ચારુવીસત્થયમાં નવકારમંત્ર, ઈચ્છાકારેણાં, તસ્સ ઉત્તરીનો પાઠ કહીને કાયોત્સર્ગ (આગળ બતાવેલ પ્રમાણે) કરવો.
- ૩) કાયોત્સર્ગમાં બે વાર લોગસ્સ મનમાં બોલવા તથા “નમો અરિહંતાણાં” કહીને કાયોત્સર્ગ પારવો.
- ૪) પછી નવકારમંત્ર અને કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો અને એક લોગસ્સ પ્રગટપણે બોલવો.
- ૫) આસન છોડીને ડાબો ધૂંટ્રણ ઊભો કરીને બે નમોત્થ્યાણાં (પૂર્વ વિધિ અનુસાર) બોલવા. બીજા નમોત્થ્યાણાં સંપત્તાણાંના સ્થાન પર “સંપાવિઉકામાણાં” બોલવું.
- ૬) બે નમોત્થ્યાણાં પછી “ધર્મગુરુ-ધર્માચાર્યનો સ્તુતિ પાઈ” કહેવો. નમોત્થ્યાણાં રામસ્સ ગાણિવરસ્સ મમ ધર્માયરિયસ્સ ધર્મોવાએસગસ્સ કહેવું.

## પ્રતિકમણ કરવાની આજ્ઞા

ઊભા થઈને ત્રણવાર તિક્ખુતોના પાઠથી વંદના કરી ઈચ્છાભિ ણાં ભંતેનો પાઠ બોલવો.

## પહેલો સામાચિક આવશ્યક

તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરીને ‘સામાચિક આવશ્યક’ ની આજ્ઞા લેવી.  
(ઊભા થઈને)

### (૧) નવકાર મંત્ર

\* અહીં પોતપોતાના ધર્મગુરુ-ધર્માચાર્યનું નામ લેવું.

- (૨) કરેમિ ભંતે
- (૩) દીચામિ દાઈઉ
- (૪) તસ્સ ઉત્તરીનો પાઠ બોલીને ૮૮ અતિચારનું ધ્યાન કરવું.
- (૫) કાયોત્સર્ગમાં ૮૮ અતિચાર (આગમે તિવિહેથી નાની સંલેખણા સુધી) અને ૧૮ પાપસ્થાનકનું ચિંતન કરવું તથા પાઠમાં જ્યાં-જ્યાં “તસ્સ મિચામિ દુક્કં” આવે ત્યાં-ત્યાં કાયોત્સર્ગમાં “તસ્સ આલોઉ” બોલવું. “નમો અરિહંતાણાં” કહીને કાયોત્સર્ગ પારવો પછી
- (૬) નવકાર મંત્ર
- (૭) કાયોત્સર્ગ શુદ્ધિ (ધ્યાન પારવા)નો પાઠ બોલવો.

### **બીજો ચાઉવીસત્થય આવશ્યક**

તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરી “ચાઉવીસત્થય આવશ્યક” ની આજ્ઞા લેવી. (ઊભા થઈને)

- ૧) લોગસ્સનો પાઠ બોલવો.

### **ત્રીજો વંદના આવશ્યક**

તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરી “વંદના આવશ્યક” ની આજ્ઞા લેવી પછી.

- ૧) બે વાર વિધિપૂર્વક દીચામિ ખમાસમાણોના પાઠ બોલવો.

### **ચોથા પ્રતિકમણ આવશ્યક.**

તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરીને “પ્રતિકમણ આવશ્યક” ની આજ્ઞા લેવી (ઊભા થઈને)

- ૧) કાયોત્સર્ગમાં કહેલા બધા પાઠ (૮૮ અતિચારના પાઠ, સમુચ્ચય પાઠ, ૧૮ પાપસ્થાનકના પાઠ) પ્રગટપણે બોલવા પછી,
- ૨) તસ્સ સવ્વસસનો પાઠ બોલવો.

તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરીને “શ્રાવકસૂત્ર” ની આજ્ઞા લઈ શ્રાવકસૂત્રમાં (જમણો ઘૂંટણા ઊંચો કરીને)

- ૩) નવકાર મંત્ર
- ૪) કરેમિ ભંતે

- ૫) ચતારિ મંગલનો પાઠ (ઉભા થઈને) પછી જમણો ઘૂંટાશ ઊંચો કરવો
- ૬) ઈચ્છામિ પદિક્કમિઉં
- ૭) ઈચ્છાકારોણં
- ૮) આગમે તિવિહે
- ૯) દંસાણ સમક્રિત
- ૧૦) બાર પ્રતોનો અતિચાર સહિત પાઠ બોલવો
- ૧૧) પછી પલાંઠી આસને બેસીને મોટી સંલેખના
- ૧૨) પછી ઉભા થઈને તસ્સ ધમ્મસ્સનો પાઠ
- ૧૩) બે વાર વિધિપૂર્વક “ઈચ્છામિ ખમાસમણો”નો પાઠ બોલવો.

તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરીને “પાંચ પદોની ભાવવંદના” કરવાની આજ્ઞા લેવી.

**ભાવવંદનની વિધિ :-** આસન વજસનમાં બેસીને બન્ને કોણીઓને ઘૂંટાશ પર ટેકવીને, હાથ જોઈ, મસ્તક પર અડાડિને, ભાવવંદનાનો પાઠ બોલવો જોઈએ.

- ૧૪) નવકાર મંત્ર
- ૧૫) પાંચ પદોની ભાવવંદના (વિધિપૂર્વક) બોલવી
- ૧૬) પછી પલાંઠી આસનમાં બેસી અનન્ત ચોવીસી વગેરે દોહા
- ૧૭) આયરિય ઉવજાયેના પાઠ
- ૧૮) અઢીદીપનો પાઠ
- ૧૯) ચોરારથી લાખ જીવાયોનિનો પાઠ
- ૨૦) ખામેમિ સત્વ જીવેનો પાઠ
- ૨૧) અઢાર પાપસ્થાનકનો પાઠ બોલવો.

### પાંચમો કાયોત્સર્જ આવશ્યક

તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરીને કાયોત્સર્જ આવશ્યકની આજ્ઞા લેવી.  
(ઉભા થઈને)

- ૧) પ્રાયશ્ચિત્તનો પાઠ
- ૨) નવકાર મંત્ર

- ૩) કરેમિ ભંતે
- ૪) ઈચ્છામિ ઠાઈઉં
- ૫) તસ્સ ઉત્તરીનો પાઠ બોલીને કાયોત્સર્ગ કરવો
- ૬) કાયોત્સર્ગમાં દેવસિય, રાઈય પ્રતિકમણમાં ૪ લોગસ્સ, પ્રકુખી પ્રતિકમણમાં ૮ લોગસ્સ, ચોમાસી પ્રતિકમણમાં ૧૨ લોગસ્સ અને સંવત્સરી પ્રતિકમણમાં ૨૦ લોગસ્સનું ધ્યાન કરવું. ‘નમો અરિહંતાણાં કહીને કાયોત્સર્ગ પાળવો, પછી
- ૭) નવકારમંત્ર
- ૮) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ
- ૯) એક લોગસ્સ પ્રગટપણે બોલવો
- ૧૦) બે વાર વિધિપૂર્વક ‘ઈચ્છામિ ખામાસમણો’નો પાઠ બોલવો.

### ઇછ્છો પરચ્યક્ખાણ આવશ્યક

તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરીને પરચ્યક્ખાણ આવશ્યકની આજ્ઞા લેવી (ઉભા થઈને)

- ૧) સાધુ મહારાજ પાસે શક્તિ અનુસાર પરચ્યક્ખાણ કરવા. જો સાધુ મહારાજ ન બિરાજતા હોય તો મોટા શ્રાવક પાસેથી પરચ્યક્ખાણ લેવા અને તે પણ ન હોય તો સ્વયં ‘સમુચ્ચય પરચ્યક્ખાણ’ના પાઠથી પરચ્યક્ખાણ કરવા.  
અંતિમ પાઠ બોલીને નીચે બેસી ડાબો ઘૂંટણા ઊભો કરીને ઉપર્યુક્ત વિવિધી....
- ૨) બે વાર નમોત્થુણાં તથા
- ૩) ધર્મગુરુ ધર્માચાર્યની સ્તુતિ પાઠ બોલવો-નમોત્થુણાં રામસ્સ ગાણિવરસ્સ મમ ધર્માયરિયસ્સ ધર્મોવાસગસ્સ.
- ૪) તિક્ખુતોના પાઠથી ત્રણવાર વંદના કરીને, સ્વધર્મી ભાઈઓને ખમાવવા. પછી ચોવીસી, સ્તવન વગેરે બોલવા.

# કાયોત્સર્ગ કરવાની વિધિ

## ઊભા-ઊભા ધ્યાન કરવાની વિધિ

- બે પગોને આગળના ભાગમાં ચાર આંગુલ તેમ જ પાછળના ભાગમાં તેનાથી કાંઈક ઓછું અંતર રાખતા ઘૂંટણે સીધા રાખીને ઊભા રહેવું.
- આંખો બંધ કરીને અથવો થોડી ખુલ્લી રાખીને નાસિકના અગ્ર ભાગ પર દિશિ સ્થિર રાખવી.
- મોઢું થોડું નીચે જૂકાવીને રાખવું.
- હૃથેળીઓને ખુલ્લી રાખીને હાથ નીચે રાખવા.
- ઉત્તરી કરણેણ સૂત્ર બોલતા ધ્યાનની મુક્રામાં ઊભા રહીને અપાણાં વોસિરામિ બોલતા પહેલા સ્થિર કરીને કાયોત્સર્ગ કરવો જોઈએ.\*
- જેનું ધ્યાન કરવાનું હોય (લોગસ્સ, ઈટ અતિચાર વગેરે) તેનું ધ્યાન કરે. ‘નમો અરિંદંતાણાં’ બોલીને ધ્યાન પાળો.

## બેઠા બેઠા ધ્યાન કરવાની વિધિ

સુખાસનમાં બેસીને, પીઠના હાડકાને સીધા રાખી, નાભિ પાસે ડાબા હાથ પર જમાણો હાથ રાખી (Right Palm on the Left Palm) કાયોત્સર્ગ કરવો જોઈએ.

## નમોત્થુણાં (શક્ષસ્તવ) કરવાની વિધિ

- આસનથી નીચે ઉત્તરી, ડાબો ઘૂંટણ ઊંચો કરી, બંને કોણીઓને પેટ પર રાખી, હાથ જોડી, મસ્તક જૂકાવી (નમાવી) મસ્તક પર બંને હાથ રાખવા.
- વિરામ સ્થાનનું ધ્યાન રાખતા, ભાવસહિત બે વાર નમોત્થુણાંનો પાઠ બોલવો બીજા નમોત્થુણાંમાં ‘ઠાણં સંપત્તાણાં’ના સ્થાન પર ‘ઠાણં સંપાવિંકમાણાં’ બોલવું.
- બે નમોત્થુણાં પછી પોતાના ધર્મગુરુ-ધર્મર્યાધની સ્તુતિનો પાઠ બોલવો.

**નોટ :** પુરુષોએ ઊભા થઈને જ ધ્યાન કરવું જોઈએ. જો શારીરિક અનુકૂળતા ન હોય એવા કારણોથી જો ઊભા-ઊભા ધ્યાન ન થઈ શકતું હોય તો, તે બેસીને પણ ધ્યાન કરી શકે છે. બહેનોએ બેસીને જ ધ્યાન કરવું જોઈએ.

\* પ્રતિકમાણ આદિમાં જ્યાં-જ્યાં કાયોત્સર્ગ કરાય ત્યાં-ત્યાં આ વિધિથી કાયોત્સર્ગ કરવો.

## ખમાસમણોની વિધિ :

ઉભા થઈને, આસનથી નીચે ઉત્તરીને, બંને હાથ જોડીને, ઈચ્છામિ ખમાસમણોનો પાઠ શરૂ કરવો.

‘આણજાણહુમાં મિઉગ્ગાહુ’ શબ્દ આવે ત્યારે થોડું નમીને, કાંઈક આગળ આવીને, શબ્દ બોલતાં ઉત્કૃટક આસને (બંને ઘૂંટણ ઉભા કરીને) બેસવું. પછી બંને કોણીઓને ઘૂંટણની વર્ણે રાખીને, બંને હાથ જોડી, મસ્તક નમાવી ‘અહો’, ‘કાયં’, ‘કાય’ આ અક્ષરોનો ઉચ્ચાર કરતી ત્રાણ આવર્તન કરવા. ચરણ સ્પર્શની ભાવનાથી દસે આંગળીઓ ભૂમિ પર મૂકી, મંદ સ્વરથી ‘અ’ અક્ષરનો ઉચ્ચારણ કરવો. પછી દસે આંગળીઓને મસ્તક પર લગાવતા ‘હો’ અક્ષર ઊંચા સ્વરથી કહેવો આ પહેલું આવર્તન થયું. આ વિધિથી ‘કા’ અને ‘યં’ બંને અક્ષરોના ઉચ્ચારણ કરવાથી બીજું આવર્તન થયું. પછી ‘કા’ અને ‘ય’ આ બંને અક્ષરોના ઉચ્ચાર કરવાથી ત્રીજું આવર્તન થાય, તેના પછી સંફાસં બોલતા બંને હાથ લાંબા કરી, દસે આંગળીઓથી ગુરુ મહારાજના ચરણ સ્પર્શ કરવા અથવા ચરણ સ્પર્શ કરવાની ભાવના મનમાં લાવવી. પછી ‘ખમણિજજો’થી લઈને ‘દિવસો વદ્ધકંતો’ સુધીના પાઠ બોલે. ત્યારપછી ‘જ તા ભે’ જ વ ણિ જ ‘જ ચ ભે’ અક્ષરોનું ઉચ્ચારણ કરતા ત્રાણ આવર્તન કરે. ચરણ સ્પર્શની ભાવનાથી દસે આંગળીઓ ભૂમિ પર મૂકી મંદ સ્વરથી ‘જ’નો ઉચ્ચારણ, હાથને મસ્તક તરફ લઈ જતા ‘તા’ને મધ્યમ સ્વરથી, દસે આંગળીઓ મસ્તક પર લગાવતા ઉચ્ચ સ્વરથી ‘ભે’ નો ઉચ્ચાર કરે. આ પ્રકારે અન્ય બે આવર્તન કરે. તેના પછી ‘ખામેમિ ખમાસમણો’ બોલતા, બંને હાથ લાંબા કરે. દસે આંગળીઓથી ગુરુ મહારાજના ચરણ સ્પર્શ કરે અથવા ચરણ સ્પર્શની ભાવના મનમાં લાવે. પછી બંને હાથોને જોડીને, મસ્તક પર લગાવી ‘દેવસિયં વદ્ધકંમ’ બોલે અને ‘આવસિસ્યાએ’ બોલતા ઉભા થવું અને બાકીનો પાઠ પૂરો કરવો. આ વિધિથી ઈચ્છામિ ખમાસમણાનો પાઠ બીજી વાર બોલે.

ઉપર કદ્યા પ્રમાણે જ છ આવર્તન કરવા પરંતુ, આ વખતે ‘આવસિસ્યાએ’ શબ્દ ન બોલવો તથા ‘આવસિસ્યાએ’ શબ્દ આવતા પર ઉભા ન થવું બેઠા-બેઠા જ ગુરુના અવગ્રહમાં પાઠ પૂરો કરવો.

# પ્રતિક્રમણ રમરણ-વિધિ સંકેત

ચઉદ્ધીસત્થયની આજ્ઞા-

નવકાર મંત્ર, ઈચ્છાકારેણ, તસ્સ ઉત્તરી, કાયોત્સર્ગ (બે લોગસ્સ), નવકાર મંત્ર, કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ, લોગસ્સ, બે વાર નમોત્થૃણ તેમ ધર્મગુરુ ધર્માચાર્ય સ્તુતિ પાઠ.

પ્રતિક્રમણની આજ્ઞા-ઈચ્છામણણાં ભંતે!

- ૧) પહેલા સામાચિક આવશ્યકની આજ્ઞા - નવકારમંત્ર, કરમિ ભંતે, ઈચ્છામિ ઠાઈઉ, તસ્સ ઉત્તરી, ૮૮ અતિચારોનું ધ્યાન, (આગમે તિવિહે, દર્શન સમ્યકૃત્વ, બાર પ્રતના અતિચાર, નાની સંલેખણા અને અઢાર પાપસ્થાનક), નવકારમંત્ર, કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ.
- ૨) બીજા ચઉદ્ધીસત્થય આવશ્યકની આજ્ઞા - લોગસ્સ.
- ૩) ત્રીજા વંદના આવશ્યકની આજ્ઞા - બે વાર ઈચ્છામિ ખમાસમણો.
- ૪) ચોથા પ્રતિક્રમણ આવશ્યકની આજ્ઞા - ૮૮ અતિચારનો પાઠ, સમુચ્ચયનો પાઠ તેમ જ ૧૮ પાપસ્થાનક પ્રગટ કહેવા. તસ્સ સવ્વસ્સ.

શ્રાવકસૂત્રની આજ્ઞા - નવકારમંત્ર, કરમિ ભંતે, ચત્તારિ મંગલં, ઈચ્છામિ પડિક્કમિઉં, ઈચ્છાકારેણ, આગમે તિવિહે, દંસણ સમકિત, ૧૨ પ્રતોના અતિચાર સહિત પાઠ, મોટી સંલેખના, તસ્સ ધર્મસ્સ, બે વાર ઈચ્છામિ ખમાસમણો.

ભાવ વંદનાની આજ્ઞા - નવકારમંત્ર, પાંચ પદોની વંદના, અનન્ત ચોવીસી, આયરિએ ઉવજજાએનો પાઠ, અફીદ્વીપનો પાઠ, ચોરાશી લાખ જીવાયોનિનો પાઠ, ખામેમિ સવ્વેજુવેનો પાઠ, અઢાર પાપસ્થાનકનો પાઠ.

- ૫) પાંચમા કાયોત્સર્ગ આવશ્યકની આજ્ઞા - પ્રાયશ્ચિત્તનો પાઠ, નવકારમંત્ર, કરમિ ભંતે, ઈચ્છામિ ઠાઈઉ, તસ્સ ઉત્તરી, કાયોત્સર્ગ (૪/૮/૧૨ અથવા ૨૦ લોગસ્સ), નવકારમંત્ર, કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ, લોગસ્સ, બે વાર ઈચ્છામિ ખમાસમણો.
- ૬) છણ્ણા પ્રત્યાખ્યાન આવશ્યકની આજ્ઞા - પ્રત્યાખ્યાન, અંતિમ પાઠ, બે વાર નમોત્થૃણ, ધર્મગુરુ-ધર્માચાર્યનો સ્તુતિ પાઠ, ગુરુવંદના.

## (૨) પ્રતિકમણ સંબંધી ધ્યાતવ્ય (નોંધ પાત્ર) બિંદુ (તથ્ય)

- ૧) નિરવધ સ્થાન પર જ્યાં સાધુ-સાધ્વીજી બિરાજતા હોય ત્યાં, તેમની આજ્ઞા લઈને પ્રતિકમણ કરવું, નહિતર જે દિશામાં પોતાના ધર્મગુરુ, ધર્મચાર્યજી બિરાજમાન હોય તે દિશામાં વંદન નમસ્કાર કરવા. તે દિશાનું જ્ઞાન ન હોય તો ઉત્તર અથવા પૂર્વ દિશામાં ગ્રાણવાર વિવિધુકત વંદન નમસ્કાર કરી, પ્રતિકમણ કરવાની આજ્ઞા અનુમતિ પ્રાપ્ત કરવી.
- ૨) વંદના, નમોત્થુણાં, ખમાસમણો, પદ્યકૂખાળાણની કિયા આસન છોડી કરવા જોઈએ.
- ૩) રાઈય પ્રતિકમણ સૂર્યોદયથી લગભગ એક મુહૂર્ત પહેલા પ્રારંભ કરી, સૂર્યોદય પહેલા પ્રત્યાખ્યાન થઈ જવા જોઈએ.
- ૪) દેવસિય પ્રતિકમણ લગભગ સૂર્યાસ્ત સાથે પ્રારંભ કરતા એક મુહૂર્તમાં પ્રત્યાખ્યાન થઈ જવા જોઈએ. (સામૂહિક પ્રતિકમણમાં વધારેમાં વધારે ૧ કલાક)
- ૫) સામાયિક વ્રત, મંગલ પાઠ તેમ જ પ્રત્યાખ્યાન સાધુ-સાધ્વીઓ પાસે ગ્રહણ કરવા જોઈએ, જો તેઓ બિરાજમાન ન હોય તો મોટા શ્રાવક-શ્રાવિકા પાસેથી લેવા. જો તે પણ ન હોય તો સ્વયં ગ્રહણ કરી શકે છે.
- ૬) સામાન્ય રીતે સામૂહિક પ્રતિકમણમાં ધ્યાનના સમયે ૮૮ અતિચાર તેમ જ લોગોસની પાટીઓનું ઉચ્ચારણ પ્રગટરૂપે કરાવવામાં આવે છે, તે યોગ્ય નથી. જે શ્રાવક-શ્રાવિકા વર્ગને પ્રતિકમણ કંઠસ્થ હોય તે કાયોત્સર્જમાં પાટીયાનું મનમાં ચિંતન કરે. જેને કંઠસ્થ ન હોય તે તેટલા સમય સુધી નવકાર મંત્રના સ્મરણમાં લીન થઈ જાય.
- ૭) કાયોત્સર્જ પૂર્વ તસ્સ ઉત્તરી પાઠનું ઉચ્ચારણ કરતા ‘અપાણાં વોસિરામિ’ શબ્દને મનમાં કહેતા કાયોત્સર્જમાં લીન થઈ જવું જોઈએ. બીજા પાઠોનું ચિંતન પણ મનમાં કરે. (હોંઠ, જીબ વર્ગેરેને હુલાવી ન શકાય)
- ૮) છઢા પ્રત્યાખ્યાન આવશ્યકમાં યથાશક્તિ નવકારશી, પારેસી, તિવિહાર, ચૌવિહાર અથવા ઘડી બે ઘડી આદિ કાંઈ ને કાંઈ પ્રત્યાખ્યાન અવશ્ય ગ્રહણ કરવા જોઈએ.

- ૯) શ્રાવક જીવનમાં લાગવાવાળા દોષો માટે સામાન્યરૂપે પાક્ષિક પ્રતિકમણ પછી પ સામાયિક ચાતુર્માસિક પ્રતિકમણ પછી પ્રતિપૂર્ણ પૌષ્ઠ અથવા તર સામાયિક તથા સાંવત્સરીક પ્રતિકમણ પછી ર પ્રતિપૂર્ણ પૌષ્ઠ અથવા દર સામાયિકનું પ્રાયશ્ચિત્ત સ્વીકારવું જોઈએ. વિશેષ કોઈ દોષ લાગેલો હોય તો ગુરુચરણોમાં આલોચના કરી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો જોઈએ.

### (૩) પ્રતિકમણ પશ્ચોત્તર

**પ્રશ્ન ૧ પ્રતિકમણ કોને કહેવાય છે ?**

**જવાબ:** કરેલા પાપોની આલોચના કરવી, નિંદા કરવી, પશ્ચાત્તાપ કરવો, પાપોથી અથવા ક્રત પ્રત્યાખ્યાનમાં લાગેલો દોષોથી નિવૃત થવું, તેને પ્રતિકમણ કહેવાય છે. વિભાવમાં ગયેલા આત્માને પાછા સ્વભાવમાં લાવવો પ્રતિકમણ છે. કરેલા પાપોની આલોચના-પ્રાયશ્ચિત્ત કરી, ફરી ન કરવાનો સંકલ્પ કરવો પ્રતિકમણ છે.

**પ્રશ્ન ૨ પ્રતિકમણ શું કામ કરાય છે ?**

**જવાબ:** ૧) તેનું શાસ્ત્રીય નામ આવશ્ક સૂત્ર છે. તે સાધક માટે પ્રતિદિન કમશા: દિવસ અને રાત્રિના અંતે અવશ્ય રૂપથી કરવા યોગ્ય સાધના છે.  
૨) તેનાથી સાધક પોતાની ભૂલોને યાદ કરી પાપને ધોઈ નાખે છે.  
૩) તેનાથી સાધક આત્મભાવોમાં તલ્લીન થઈને સમાધિમાં સ્થિત થાય છે, માટે પ્રતિકમણ કરાય છે.

**પ્રશ્ન ૩ પ્રતિકમણ શેનું કરવામાં આવે છે ? કયા પાઠથી ?**

**જવાબ:** (૧) ભિથ્યાત્વ, (૨) અવ્રત, (૩) ગ્રમાદ, (૪) કષાય તેમ જ અશુભયોગનું પ્રતિકમણ કરાય છે.

તે મુખ્ય રીતે નીચેના પાઠોથી કમશા: કરવામાં આવે છે.

- ૧) દર્શન સમ્યકૃત્વ અને ૧૮ પાપસ્થાન (ભિથ્યા દર્શન શાલ્ય) આદિથી
- ૨) ઈરછામિ ઠાઈઉ (પંચાહુમાળુવ્યાણાં) તેમજ ૧૨ ક્રતોના પાઠ આદિથી
- ૩) ઈરછાકારણું તેમ જ ઈરછામિ ઠાઈઉ આદિથી
- ૪) ઈરછામિ ઠાઈઉ (ચાઉણું કસાયાણાં) અને ૧૮ પાપસ્થાનક આદિથી
- ૫) ઈરછામિ ઠાઈઉ (કાઈઓ, વાઈઓ, માણસિઓ, દુજીજાઓ, દુલ્વિચિંતિઓ તેમ જ કાયોત્સર્જ શુદ્ધિનો પાઠ (મન, વચન, કાયાના યોગ ચલિત થયા હોય) આદિથી.

**પ્રશ્ન ૪ કાળની દાખિએ પ્રતિકમણના કેટલા બેદ છે ?**

**જવાબ:** ૧) દેવસિય-દિવસના અંતમાં કરવાવાળું, આખા દિવસમાં લાગેલા દોષોનું પ્રતિકમણ.

૨) રાઈય-રાત્રિના અંતિમ મુહૂર્તમાં કરવાવાળું, રાત્રિમાં લાગેલા દોષોનું પ્રતિકમણ.

૩) પાદ્ધિક-પાખીના દિવસે કરવાવાળું, પંદર દિવસમાં લાગેલા દોષોનું પ્રતિકમણ.

૪) ચાતુર્માસિક-કાર્તિકી પૂર્ણિમા, ફાળગુની પૂર્ણિમા, અખાડી પૂર્ણિમાના દિવસોમાં કરવાવાળું, ચાર મહિનામાં લાગેલા દોષોનું પ્રતિકમણ.

૫) સાવંત્સરિક-સંવત્સરીના દિવસે કરવાવાળું, વર્ષભરમાં લાગેલા દોષોનું પ્રતિકમણ.

(નોટ: પાદ્ધિક, ચાતુર્માસિક, તેમ જ સાવંત્સરિક પ્રતિકમણ કમશા: પદ્ધભી, ચાતુર્માસી પૂર્ણિમા અને સાંવત્સરિક સૂર્યાસ્ત પછી તરત જ કરવામાં આવે છે.)

**પ્રશ્ન ૫ પ્રતિકમણ કરવાથી શું લાભ થાય છે ?**

**જવાબ:** ૧) વ્રતમાં લાગેલા દોષોથી નિવૃત્ત થવાય છે.

૨) શાન-દર્શન-ચારિત્ર અને તપની આરાધના થાય છે

૩) ભાવપૂર્વક પ્રતિકમણ કરતા ઉત્કૃષ્ટ રસ ઉપજે તો જીવ તીર્થકર નામ ગોત્ર બાંધે છે.

**પ્રશ્ન ૬ પ્રતિકમણમાં કરવાવાળા વિભિન્ન આસન કોના-કોના પ્રતિક સ્વરૂપ છે ?**

જવાબ :	પ્રતિકમણના આસન	પ્રતિક	પાઠ
૧)	ડાબો ઘૂંટણ ઊંચો કરવો	વિનય	નમોત્થુણં
૨)	જમણો ઘૂંટણ ઊંચો કરવો	વીરતા	શ્રાવક સૂત્ર
૩)	બંને ઘૂંટણ ઊભા કરવા	કોમળતા	દીર્ઘામિ ખમાસમણો
૪)	ઊભા રહેવું (જિન મુદ્રા)	તત્પરતા, ઉઘમ	બાર વ્રતોના પાઠ
૫)	બંને ઘૂંટણને જમીન પર ટેકવવા	અર્પણાતા	પાંચ પદની વંદના
૬)	પદ્માસન (પર્યક્કાસન)	સ્થિરતા, સમાધિ	સંલેખના

## ૨. તત્ત્વ વિભાગ

### (૧) સમકિતના દુર્ભોગ

(સમ્યકૃત્વ સપ્તાતિ આદિ ગ્રંથોના આધારે)

પહેલે બોલે શ્રદ્ધાન ૪, બીજે બોલે લિંગ ૩, ત્રીજે બોલે વિનય-૧૦, ચોથે બોલે શુદ્ધિ ૩, પાંચમે બોલે દૂષણ ૫, છુટે બોલે પ્રભાવના ૮, સાતમે બોલે ભૂષણ ૫, આઠમે બોલે લક્ષણ ૫, નવમાં બોલે યતના ૬, દસમે બોલે આગાર ૬, અગ્રિયારમે બોલે ભાવના ૬, બારમે બોલે સ્થાન ૬, આ બધા મળીને દુર્ભોગ બોલ થાય છે.

### પહેલે બોલે-શ્રદ્ધાન ચાર

શ્રદ્ધાન વ્યક્તિની બાધ્યપ્રવૃત્તિઓને જોઈને સામાન્ય રીતે શ્રદ્ધા અર્થાત્ વિશ્વાસ કરી શકાય કે આ વ્યક્તિમાં સમ્યકૃત્વ છે. તેને શ્રદ્ધાન કહેવાય.

- (૧) પરમાર્થ સંથવો : પરમાર્થનો પરિચય કરવો. સર્વજ્ઞ કથિત તત્ત્વોના ભાવો જાણુવા.
- (૨) સદિક્ષ પરમત્થ સેવણા : પરમાર્થના જાણવાવાળાની ઉપાસના કરવી.
- (૩) વા વિ વા વન : સમકિતથી ભ્રષ્ટ થયેલા સ્વપાસંહીઓના સંગ ન કરે.
- (૪) કુંદસણ વજજણા : પરતીર્થિઓનો અધિક પરિચય ન કરે. સંગતથી દૂર રહે.

### બીજે બોલે-લિંગ ત્રણ

લિંગ-વ્યક્તિના ગુણો જોઈને તેમાં સમ્યકૃત્વ છે, એવું જાણી શકાય, તેને લિંગ કહેવાય છે. લિંગ અંદર હોય છે. તે સમ્યકૃત્વનો બોધ કરાવવાવાળું ચિન્હ છે. શ્રદ્ધાનની અપેક્ષા લિંગ દ્વારા સમ્યકૃત્વને સ્પષ્ટ જાણી શકાય છે.

- (૧) સુશ્રૂષા : જેમ યુવાન સુખી, પ્રજ્ઞાવાન સંગીતશાસ્ત્રના જ્ઞાતા વ્યક્તિ ગ્રાણ પ્રિય જીવી સાથે રહેતા, દેવ, ગંધર્વ વગેરે જેવા ગાયન સાંભળવાની ઈચ્છા રાખે છે, તેમ ભવ્યાત્મા, સમકિતી જીવ જૈન આગમશાસ્ત્ર સાંભળવામાં અનુરૂપ રાખે.
- (૨) ધર્મરાગ : જેમ ઘોર જંગલને પાર કરતો કુધાવાન પુરુષ ખીરખાંડનું ભોજન કરવામાં રૂચિ રાખે, તેમ સમકિતી જીવ વિતરણની વાણી આદર સાથે સાંભળે અને જૈનધર્મ આદરવામાં રૂચિ રાખે.

(३) वैयावृत्य : समकिती ज्ञव सुदेव, सुगुरुनी हर्षित थઈ सेवा-भक्ति करी आलोक-परलोक बंनमां सुधी थाय.

## ત्रीજ બોલે-વિનય દસ

વિનય-ભક્તિ, સેવા, બહુમાન કરવું વિનય કહેવાય છે.

- (૧) અરિહંતનો વિનય કરે.
- (૨) અરિહંત પ્રરૂપિત ધર્મનો વિનય કરે.
- (૩) આચાર્યનો વિનય કરે.
- (૪) ઉપાધ્યાયનો વિનય કરે.
- (૫) સ્થવિરનો વિનય કરે.
- (૬) કુળનો (સાધુ સમુદાય) વિનય કરે.
- (૭) ગણનો વિનય કરે. (તે ઘણા આચાર્યોના શિષ્ય સમૂહ.)
- (૮) ચતુર્વિધ સંઘ (સાધુ-સાધી શ્રાવક અને શ્રાવિકા)નો વિનય કરે.
- (૯) સ્વર્ધમાનો વિનય કરે.
- (૧૦) કિયાવાન અર્થાત् સમ્યક્તવોનો વિનય કરે.

## ચોથા બોલે-શુદ્ધિ ત્રણ

શુદ્ધિ -મન, વચન, કાયાની જે કિયાથી સમ્યક્તવ વિશેષ નિર્મળ બને તેને શુદ્ધ કહે છે અથવા શુદ્ધ સમ્યક્તવના પ્રભાવથી મન, વચન, કાયાની જે પ્રવૃત્તિ થાય છે, તેને શુદ્ધ કહેવાય છે.

- (૧) મન શુદ્ધતા : મનથી સુદેવ, સુગુરુ તથા નિર્ગથ ધર્મ સિવાય અન્ય તીર્થોના દેવ, ગુરુ, ધર્મને અસાર સમજે.
- (૨) વચન શુદ્ધતા : વચનથી અરિહંત દેવ, ધર્મગુરુ અને કેવળી પ્રરૂપિત ધર્મના સિવાય અન્ય તીર્થો દેવ, ગુરુ કે ધર્મને અસાર સમજે.
- (૩) કાય શુદ્ધતા : કાયથી અરહિત દેવ, ધર્મગુરુ કે જૈનધર્મને જ નમસ્કાર કરે, પરંતુ ગમે તેવી સંકક આવવા છતાં બીજા સરાંખી દેવ, ગુરુ કે ધર્મને વંદન નમસ્કાર ન કરે.

## પાંચમે બોલે-દૂષણ પાંચ

દૂષણ-જેના કારણે સમ્યકૃત્વમાં મળિનતા આવે છે, તેને દૂષણ કહેવાય છે.

- (૧) શંકા : સુદેવ, સુગુરુ, સુધર્મની સત્યતાના વિષયમાં શંકા કરે.
- (૨) કંખા : અન્ય મતોના આંદુર દેખી તેની ઈચ્છા કરે.
- (૩) વિચિકિત્સા : ધર્મકરાણીના ફળમાં સંદેહ રાખે કે ધર્મનું ફળ હશે કે નહિ? વર્તમાને તો કાંઈ ફળ દેખાતું નથી.
- (૪) પરપાસંડ પસંસાઃ અન્યમતવાળાના જ્ઞાનાદિ ગુણના વખાણ કરે.
- (૫) પરપાસંડ સંથવોઃ ઉદ્દર પાખંડી મતનો પરિચય કરે અને તેનો સંગ કરે.

## ઇછે બોલે-પ્રભાવના આઠ

પ્રભાવક - ધારા બધા આત્માઓમાં શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પ્રતિ આસ્થા ઉત્પન્ન કરવી તેમ જ તેમને મજબૂત કરવા પ્રભાવના છે. પ્રભાવના કરવાવાળા પ્રભાવક કહેવાય છે.

- (૧) ગ્રાવચની : જે કાળમાં જેટલા આગમ સૂત્ર આદિ હોય, તેને ગુરુગમથી જાણી, લોકોને પ્રતિબોધિત કરી, જિનશાસનની પ્રભાવના કરે.
- (૨) ધર્મકથી : ધર્મકથા કહેવામાં કુશળ થઈ, ભવ્ય જીવોને પ્રતિબોધિત કરી, પ્રભાવના કરે.
- (૩) નિરાપવાદ (વાદી) : તર્ક, વિતર્ક, હેતુ, વાદ, યુક્તિ, ન્યાય તથા વિદ્યાદિ બળથી વાદીઓનો શાખાર્થથી પરાજય કરી શાસન પ્રભાવના કરે.
- (૪) ત્રિકાળ : જિનશાસનની ઉન્નતિ માટે શ્રુતજ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળને જાણીને શાસનની પ્રભાવના કરે.
- (૫) તપ : મહાન, વિકટ તપશ્ચર્યા કરીને પ્રભાવના કરે.
- (૬) વિદ્યા : પુરુષાર્થવાળો પુરુષ અનેક વિદ્યા જાણે અને દિક્ષા લઈ શાસન પ્રભાવના કરે.
- (૭) વ્રત (સિદ્ધ) : પ્રસિદ્ધ વ્રત જેવા કે બ્રહ્મચર્ય, રાત્રિભોજન ત્યાગ, લીલોતરી ત્યાગ અને સંપેત પાણી ત્યાગ આ ચાર સંકંધ (નિયમ) અંગિકાર કરી, પ્રભાવના કરે, જિનશાસનની ઉન્નતિ માટે અનેક સિદ્ધિઓના જાણકાર હોય.
- (૮) કવિ : શાખાનુસાર કવિતા કરી પ્રભાવના કરે.

## સાતમે બોલે-ભૂષણ પાંચ

ભૂષણ : જે કાર્યોથી જિનશાસનની શોભા વિશેષ રૂપ્યથી વધે, તેને ભૂષણ કહેવાય છે.

- (૧) કુશળતા - જૈનશાસનના કામ કરવામાં હોથિયાર, કુશળ, નિપુણ હોય,
- (૨) પ્રભાવક - જિનશાસનની પ્રભાવના કરે અને જિનશાસનની ઘ્યાતિ વધારે.
- (૩) તીર્થસેવા - ઉત્તમ ગુણોથી યુક્ત સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ તીર્થની સેવા અર્થાત્ સંસર્ગ કરે.
- (૪) સ્થિરતા - પોતે સમ્યકૃત્વમાં દઢ રહીને, બીજાને પણ સ્થિર કરે.
- (૫) ભક્તિ - સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારોનો યથોચિત આદર સત્કાર તેમ જ ભક્તિ કરે.

## આઠમે બોલે-લક્ષણ પાંચ

લક્ષણ - સમ્યકૃત્વીમાં જે ગુણ અવશ્ય જોવા મળે છે, તેને લક્ષણ કહે છે.

- (૧) સમ : અનંતાનુભંધી કોઇ, માન, માયા અને લોભનો ઉદ્ય થવા ન હે.
- (૨) સંવેગ : વૈરાય્ય ભાવ રાખવો. જેમ કે આ સંસાર અસાર છે. મોક્ષસુખની અભિલાષા રાખવી. ધર્મ આરાધવો.
- (૩) નિર્વેદ : મોહુમય જગતથી અલગ થઈ, વૈરાય્ય ભાવથી દીક્ષા લઈ, કર્મ શત્રુઓને જીતી, સિદ્ધ પદ પ્રાપ્ત કરવાની અભિલાષા કરવી.
- (૪) અનુંધા : દુઃખી જીવોને જોઈ દયા, કરૂણા લાવે. દુઃખી જીવોને સુખી કરવા પ્રયત્ન કરવો.
- (૫) આસ્થા : જિનવાણી, આગમ, શાસ્ત્રો પર દઢ શ્રદ્ધા રાખે.

## નવમે બોલે-યતના છ

યતના-સમ્યકૃત્વની સુરક્ષા માટે જે-જે વાતોની સાવધાની રાખવામાં આવે છે, તેને યતના કહે છે.

- (૧) વંદના : મિથ્યાત્વીને હાથ જોડીને, મસ્તક નમાવી વગેરે રૂપે વંદના કરવી નહિ.
- (૨) નમસ્કાર : મિથ્યાત્વીને જોઈને મનમાં પ્રસત્ર થવું તથા વચનથી ગુણ સ્તુતિરૂપ નમસ્કાર કરવા નહિ.
- (૩) આલાપ : બોલાવ્યા વિના સનોહપૂર્વક વાર્તારૂપ આલાપ કરવો નહિ.
- (૪) સંલાપ : સુખ-દુઃખ તેમ જ ગુણ-દોષની પૂછવારૂપ સંલાપ કરવો નહિ.

- (૫) દાન-મિથ્યાત્વીનું સન્માન થશે, એવું વિચારીને તેને ઈષ સ્થાન વગેરે આપવું નહિએ.

(૬) અનુગ્રદાન-ઉપર્યુક્ત પ્રકારના દાન વારંવાર દેવા નહીંઓ.

## દસમે બોલે-આગાર છ

**આગાર :** પ્રતિજ્ઞામાં રાખેલી છૂટ. સમ્યકૃતવની જતનાઓની પ્રતિજ્ઞા કરતી વખતે જે છૂટ રાખવામાં આવે છે, તેને અહીં આગાર કહ્યો છે.

- (૧) રાજ્યાભિયોગ : રાજાના દબાણથી, દેશનિકાલના ભયથી અન્ય મતના દેવ, ગુરુ કે ધર્મ સાથે વંદન આદિ વ્યવહાર કરવો પડે.
  - (૨) કુટુંબ ગણાભિયોગ : નાત, શાતિજનો, પંચ પ્રમુખોના ઉપકાર આદિને કારણે.
  - (૩) બળાભિયોગ : શક્તિ કે સત્તાથી બળવંતના ભયથી.
  - (૪) દેવાભિયોગ : દેવતાના ઉપસર્ગ, ભય આદિથી.
  - (૫) ગુરુનિગ્રહ : માતાપિતા, વિદ્યા ગુરુ કે શિલ્પાચાર્ય આ ઉપકારીજનોના કહેવાથી.
  - (૬) વૃત્તિકાન્તાર : આજીવિકાને માટે અન્યમતિના ધર્મસ્થાનમાં નોકરી આદિ કરવો પડે કે તેના વ્યવહાર કરવો પડે.

ઉપરના કારણે અન્યતીર્થોને વંદના આદિ કરવી પડે તો સમ્યકૃત્વમાં દોષ લાગતો નથી.

## અગિયારમે બોલે-ભાવના ૪

**ભાવના** - જેના ભાવવાથી સમકિત પ્રત્યે અનુરૂપ વધે છે.

- (૧) મૂળ : ચારિત્ર : ધર્મરૂપી વૃક્ષ માટે સમકિતરૂપી મૂળ.

(૨) દ્વાર : ચારિત્ર : ધર્મરૂપી નગર માટે સમકિતરૂપી દરવાજો.

(૩) પાયો (પીઠિકા) : ચારિત્ર ધર્મરૂપી મહેલ માટે સમકિતરૂપી પાયો.

(૪) આધાર - ભૂમિ : ધર્મરૂપી પ્રાણીઓ માટે સમકિત રૂપી ભોજન (થાળ).

(૫) ભોજન : ધર્મરૂપી મનોક્ષ રસ માટે સમકિતરૂપી થાળ.

(૬) નિધાન : ચારિત્ર : ધર્મરૂપી આભૂષણ માટે સમકિતરૂપી નિધાન (પેટી).

## બારમે બોલે-ભાવના છ

સ્થાન : જે મૌલિક સિદ્ધાંતો પર આસ્થા કરવાથી સમ્યકૃત્વ સ્થિર રહે છે, તેને સ્થાન કહેવાય છે.

- (૧) જીવ છે : જીવ ચૈતન્ય લક્ષણયુક્ત, અસંખ્યાત પ્રદેશ, અમૂર્ત છે.
- (૨) જીવ નિત્ય છે : જીવ દ્વય અનાદિ અનંત છે. શરીરની ઉત્પત્તિથી જીવની ઉત્પત્તિ નથી અને તેના વિનાશો જીવનો નાશ પણ નથી.
- (૩) જીવ કર્તા છે : જીવ આઈ કર્મનો કર્તા (કરવાવાળો) છે, ઈશ્વર જીવને કર્મ કરાવે છે અને જીવ કર્મ કરવા છતાં કર્મથી નિર્લેપ છે તે અસત્ય માન્યતા અન્યદર્શનીની છે.
- (૪) જીવ વિનાશક : જીવ આઈ કર્મનો વિનાશક છે. જીવ સુખ-દુःખનો કર્તા અને ભોક્તા છે.
- (૫) જીવનો મોક્ષ છે : ભવ્ય જીવ આઈ કર્મ ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
- (૬) મોક્ષનો ઉપાય પણ છે : ભવ્ય જીવ સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યક્ ચારિત્ર અને સમ્યગ્ તપની આરાધના કરે એ મોક્ષનો ઉપાય છે. અજ્ઞાન, મિથ્યાત્વ, અવત કે બાલતપ એ મોક્ષના ઉપાય નથી.

## (૨) તીર્થકર પદ પ્રાપ્તિના ૨૦ બોલ

(જ્ઞાતાધર્મકથા સૂત્રના ૮મા અધ્યયનના આધારે)

- (૧) શ્રી અરિહંત ભગવાનના ગુણકીર્તન કરવાથી ઉત્કૃષ્ટ રસ આવે તો તીર્થકર નામ કર્મ બાંધે.
- (૨) શ્રી સિદ્ધ ભગવાનના ગુણકીર્તન કરવાથી.
- (૩) નિર્ગ્રથ પ્રવચન રૂપ દ્વાદશાંગીના ગુણકીર્તન કરવાથી.
- (૪) ગુણવંત ગુરુના ગુણકીર્તન કરવાથી,
- (૫) સ્થવિર (વય - ૬૦ વર્ષની વયવાળા, શ્રુત ઠાણાંગ, સમવાયાંગના ધારક, પર્યાય-૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા) વડીલ મુનિના ગુણકીર્તન કરવાથી.
- (૬) બહુશ્રુત (વિશિષ્ટ જ્ઞાની)ના ગુણકીર્તન કરવાથી.
- (૭) તપસ્વીના ગુણકીર્તન કરવાથી.
- (૮) ભણેલા જ્ઞાનમાં ઉપયોગ મૂકવાથી.
- (૯) સમકિત નિર્મળ પાળવાથી.
- (૧૦) રત્નાધિકોનો વિનય કરવાથી, (૭-૧૦-૧૩૪ પ્રકારનો).
- (૧૧) ભાવપૂર્વક ઉભયકાળ આવશ્યક - પ્રતિકમાણ કરવાથી.
- (૧૨) લીધેલ પ્રત-પચ્ચયક્ખાણ (મૂળગુણ, ઉત્તરગુણ) નિરતિયાર પાળવાથી.
- (૧૩) એક ક્ષાળ કે લવ પ્રમાણ કાળમાં પાણ સંવેગભાવ અને શુભ ધ્યાન (ધર્મ અને શુકલ) ધ્યાવવાથી.
- (૧૪) બાર પ્રકારના તપથી નિર્જરા કરવાથી.
- (૧૫) ત્યાગવૃત્તિ રાખવાથી.
- (૧૬) આચાર્યાદિની ૧૦ પ્રકારે વૈયાવચ્ચ\* કરવાથી.
- (૧૭) ગુરુ આદિને સમાધિ (સેવા, શોભા) દેવાથી અથવા પોતે સમાધિમાં રહેવાથી.
- (૧૮) નવું નવું અપૂર્વ તત્ત્વજ્ઞાન ભાગવાથી.
- (૧૯) સૂત્ર સિદ્ધાંતની ભક્તિ (સેવા) કરવાથી.

\* નોટ : આચાર્યાદિ ૧૦ની વૈયાવચ્ચ નીચે પ્રકારે કરાય છે. (૧) ભક્ત, (૨) પાન, (૩) આસનદાન, (૪) ઉપકરણ સંપાદન, (૫) પાદ પ્રમાર્જન, (૬) વણ, (૭) ભેષજ, (૮) માર્ગમાં મદદ કરવી, (૯) દુષ્ટ ચોર આદિથી રક્ષા કરવી, (૧૦) ગામાદિમાં પ્રવેશ કરતી વખતે પાત્ર (૧૧) આદિ ગ્રહણ કરવા. ૧૧-૧૨-૧૩ ઉચ્ચાર, પાસવણ, શ્લેષ્મ માત્ર, સમર્પણ કરવું વગેરે.

(२०) प्रवचननी प्रभावना करवाथी (धर्मनो प्रचार करवाथी).

ઉપર્યુક્ત વીસ બોલોની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી તીર્થકર નામ કર્મનો બંધ થાય છે. આ બંધના ઉદ્યવાળા મહાપુરુષ તીર્થકર બની, મોક્ષમાર્ગની પ્રદૂપણ કરે છે અને ભવ્ય જીવોનું કલ્યાણ કરે છે.

### (3) પુણ્યવાનને પ્રાપ્ત ઉત્તમ સામગ્રી

ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્યયન-૩, ૧૭, ૧૮)માં પુણ્યવાન જીવોને પ્રાપ્ત થવાવાળી દસ પ્રકારની ઉત્તમ સામગ્રી વર્ણન કર્યું છે. જે જીવ ધર્મસાધના કરીને દેવલોકમાં જાય છે, તે દેવલોકના સુખ તો ભોગવે જ છે, પરંતુ ત્યાંનું આયુ પૂર્ણ કરીને મનુષ્યભવમાં આવે છે, તેને પુણ્યના ફળસ્વરૂપ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થાય છે, તે આ પ્રકારે છે -

- (૧) ક્ષેત્ર - ગ્રામ, જમીન વગેરે ઉત્તમ સ્થાન, (૨) વાસ્તુ - રહેવાનું ભવન, (૩) ચાંદી - સોના વગેરે ઉત્તમ ધાતુઓ, (૪) પશુ - ગાય, બેસ, ઘોડા વગેરે અને નોકર - ચાકર. આ ચાર સ્કન્ધો (સમૂહો)થી ભરપૂર કુળમાં ઉત્પન્ન થવાનો યોગ મળે છે.

(૨) સારા મિત્રોનો યોગ મળે.

(૩) સારા સગાં - સંબંધીઓનો યોગ મળે.

(૪) ઉચ્ચયોગોત્ત્ર - આદરણીય તેમ જ સર્વાં ખાનદાન મળે.

(૫) કાન્તિવાન શરીર મળે.

(૬) આરોગ્ય સાર્વ મળે.

(૭) તીવ્ર તેમ જ વિમલ બુદ્ધિ મળે.

(૮) વિનયવાન - વિનીત બધાને પ્રિય લાગે.

(૯) યશસ્વી - (જેની પ્રશંસા) થાય.

(૧૦) બળવાન - (શક્તિશાળી) થાય.

### ૩. કથા વિભાગ

#### (૧) ભગવાન ઋષભદેવ

કાળ સ્વરૂપ - વર્તમાન અવસર્પિણી કાળનો ત્રીજો આરો સુખમ-દુઃખમના ત્રણ ભાગમાંથી બે ભાગ વીતી જવા પર વાર્ષા, ગંધ, રસ, સ્પર્શના બધા પુદ્ગલોની ઉત્તમતામાં ન્યૂનતા આવી જાય છે. આ ઉત્તરતા આરામાં મનુષ્યનું દેહમાન ૫૦૦ ધનુષ તથા એક કોડ પૂર્વનું આયુષ્ય હોય છે. શરીરમાં દ૪ના સ્થાન પર તર પાંસળીઓ હોય છે. કાળ સ્વભાવથી કલ્પવૃક્ષ દ્વારા આવશ્યકતાની પૂર્તિ પૂરી થતી નથી એટલે યુગલિકોમાં પરસ્પર ઝડપા થવા લાગે છે. આથી વ્યવસ્થા બનાવી રાખવા માટે ૧૫ કુલકરોની ઉત્પત્તિ થાય છે. પહેલાથી ત્રીજા આરાની ભૂમિ અકર્મભૂમિ કહેવાય છે, ત્યારે મનુષ્યોની ઉત્પત્તિ જોડકાથી થાય છે તથા જોડકાથી જ રહે છે, આથી યુગલિક કહેવાય છે.

ઋષભદેવનો જન્મ તેમ જ બાલ્યકાળ - ત્રીજા આરાના અંતિમ ભાગમાં અંતિમ કુલકર શ્રી નાભિરાજા હતા. તેમની પત્નીનું નામ મરુદેવી હતું. રાણી મરુદેવીએ ત્રીજા આરાના ૮૪ લાખ પૂર્વથી કંઈક અધિક સમય બાકી રહ્યા, ત્યારે ૧૪ મહાસ્વપ્ન જોયા. ઈન્દ્રએ આવીને સ્વપ્નનો અર્થ કહ્યો કે આ બાળક ચૌદ રાજલોકનો સ્વામી થશે. ચૈત્ર વદ અષ્ટમીના માતા મરુદેવીએ એક યુગલને જન્મ આપ્યો. ઈન્દ્ર, દેવતાઓ દ્વારા જન્મ-ઉત્સવ મનાવવામાં આવ્યો. બાળકની છાતી પર વૃષભનું ચિન્હ હતું તથા માતાએ ચૌદ મહાસ્વપ્નોમાં સર્વપ્રથમ સ્વપ્ન વૃષભ જોયું, માટે માતા - પિતાએ પુત્રનું નામ ઋષભ તથા સાથે જન્મેલી કન્યાનું નામ સુમંગલા રાખ્યું. પાંચ ધાત્રી અપ્સરાઓની સેવામાં બાળક ઋષભ આનંદપૂર્વક વધવા લાગ્યા.

ઋષભદેવનું શરીર જન્મથી જ (૧) સ્વેદ (પસીનો) મલ રોગથી રહિત સુંદરાકાર સુવાર્ષ કમળ સમાન સુશોભિત, (૨) રક્ત અને માંસ ગાયના દૂધથી પણ ઉજ્જવળ તેમ જ સુગંધયુક્ત (૩) આઢાર - નિષાર ચર્મચક્ષુથી અગોચર (૪) શ્વાસોચ્છ્વાસ પદ્મ કમળથી વધારે સુગંધિત - આ ચાર અતિશયોથી યુક્ત હતું.

વિવાહ - તે સમયે વિવાહ પદ્ધતિ નહોતી. સૌધમન્દ્રએ ભગવાનને વિવાહ યોગ્ય જાણીને, વિવાહ સંબંધી નીતિ પ્રચલિત કરવાનું નિવેદન કર્યું. શ્રી નાભિરાજા તેમ

જ દેવરાજ ઈન્ડ્રના કહેવાથી ઋષભદેવના વિવાહ સુમંગલા તેમ જ સુનંદા નામની કન્યાઓ સાથે થયો, તે આ યુગના પ્રથમ વિવાહ હતા, ત્યારથી ભરતક્ષેત્રમાં વિવાહ વિધિ પ્રારંભ થઈ.

ભરત, બાહુબલી તથા બ્રાહ્મી, સુંદરીનો જન્મ - સુમંગલાથી પરમ પ્રતાપી પુત્ર ભરત તથા પુત્રી બ્રાહ્મી થઈ. ભરત આ વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી થયા. બીજી પત્ની - સુનંદાથી મહાન શૂરવીર બાહુબલી તેમ જ પુત્રી સુંદરી થઈ. તે પછી સુમંગલાએ અનુકૂમે ૪૮ યુગલો પુત્રો (૮૮ પુત્રો)ને જન્મ આપ્યો. આ પ્રકારે ભગવાન ઋષભદેવના ભરત-બાહુબલી સહિત ૧૦૦ પુત્ર તથા બ્રાહ્મી-સુંદરી ૨ પુત્રીઓ હતી. જે પ્રકારે અનેક શાખાઓથી વૃક્ષ સુશોભિત થાય છે, તેવી રીતે પુત્ર - પુત્રીથી ઋષભદેવ સુશોભિત હતા.

કર્મભૂમિનો પ્રારંભ તેમ જ રાજ્ય સ્થાપના - જેવી રીતે પ્રાતઃકાળ દીપકનો પ્રકાશ ઓછો થઈ જાય છે, તેવી રીતે અકર્મભૂમિ વીતી જવા પર અને કર્મભૂમિના ઉદ્ઘથી કદ્વયુક્ષોનો પ્રભાવ ક્ષીણ થવા લાગ્યો. પ્રકૃતિનો વૈભવ ઓછો થવા લાગ્યો. કદ્વયુક્ષોના ઉપયોગ કરવાવાળી જનસંખ્યાની વૃદ્ધિ થઈ રહી હતી તથા વૃક્ષ, ફળ ઓછા થતા હતા. શીત પ્રકૃતિવાળા યુગલિકોમાં કષાય ભાવના તેમ જ સંગ્રહ પ્રવૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ હતી. હવે સુવ્યવસ્થા તેમ જ શાંતિ માટે સત્તાધારી શાસકની આવશ્યકતા હતી. આ પરિસ્થિતિમાં નાભિરાજાએ લોક નેતૃત્વનો ભાર ઋષભદેવને સૌંઘ્યો. સ્વર્ગાધિપતિ શકેન્દ્રએ ઋષભદેવનો રાજ્યાભિષેક કર્યો; ઋષભદેવ જનતાનું નેતૃત્વ ખૂબ કુશળતાથી કર્યું. માનવજીતિ પ્રત્યે તેમના મનમાં ખૂબ કર્ણા હતી.

આપણા જીવન ઉપયોગી સાધનોનો તેમ જ સંરક્ષણનો કિયાત્મક ઉપદેશ આપ્યો. વૃક્ષ સીંચવા તથા નવા વૃક્ષ લગાવવાની વિધિ, અન્ન ઉત્પાદનની, અન્ન પકાવવાની, ઉપભોગની, વ્યાપારની, વાસણ બનાવવાની, વસ્ત્ર બનાવવાની, રોગ ચિકિત્સા તથા સંતાન પાલણ પોષણ વગેરેની બધી પદ્ધતિઓ બતાડી. ગામ કેવી રીતે વસાવવું? નગરેનું નિર્માણ કેવી રીતે કરવું? મકાન કેવી રીતે બનાવવા? એ બધી વાતો જનતાને શીખવાડી. રાજી ઋષભદેવના નેતૃત્વમાં પહેલી નગરી વિનીતા બનાવવામાં આવી જે આગામ અયોધ્યાના નામથી પ્રસિદ્ધ થઈ. ઋષભદેવ આ યુગના પ્રથમ શિક્ષા શાસ્ત્રી તેમ જ આદિ પુરુષ હતા, આથી તેઓ આદિદેવ, આદિનાથ, આદેશ્વર વગેરે નામથી પ્રસિદ્ધ હતા.

આપે સામ, દામ, દંડ, ભેદ એવા ચાર ઉપાયથી રાષ્ટ્રીય વ્યવસ્થા કાયમ કરી. ઋખભદેવે મનુષ્યોને અસહાય તેમ જ પ્રકૃતિ પર નિર્ભર રહેવાને બદલે પુરુષાર્થનો પાઠ ભાગુાવ્યો. આપે શ્રીઓને દ૪ તેમ જ પુરુષોને જર કળાઓ બિન્ન-બિન્ન રૂપમાં શીખવાડી, પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરત તેમ જ બાહુબલીને જર કળાઓનો બોધ આપ્યો. પ્રાણીને ૧૮ પ્રકારની લિપિ અને સુંદરીને ગળિાત, તોલ, અક્ષર જ્ઞાન, વ્યાકરણ, છંદ, કાવ્ય આદિનું જ્ઞાન આપ્યું.

ઋખભદેવે કર્મના આધાર પર વાર્ણોની વ્યવસ્થા કરી - (૧) ક્ષત્રિય, (૨) વૈશ્ય, (૩) શુક્ર. જે લોકો શૂરવીર હતા, શાંત્રો ચલાવવામાં પારંગત હતા, સંકટકાળમાં પ્રજાની રક્ષા કરી શકે તેમ હતા, તેને ક્ષત્રિય પદ આપ્યું. જે વ્યાપાર, વ્યવસાય અને કૃષિ, પશુપાલનમાં નિપુણ હતા, તેને વૈશ્ય પદ આપ્યું. જેને સેવાના કર્યો સોંપ્યા શૂદ્ર કહેવાયા. ચોથા પ્રાણિશા વર્ગની સ્થાપના ભરત ચક્કવર્તીએ કરી. જે લોકો પ્રજાને શિક્ષા આપતા, સમય - સમય પર સન્માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપતા તે પ્રાણિશા કહેવાયા.

જો કે ઉપરોક્ત બધા કાર્ય સાવધ હતા પરંતુ, શ્રી ઋખભે કર્મોના ઉદ્ય પ્રમાણે પોતાના ઉત્તરદાયિત્વ પૂરું. જનકલ્યાણની ભાવનાથી કર્યું.

**વૈરાગ્ય તેમ જ વર્ણાદાન** - ઋખભદેવનું હદ્ય શરૂઆતથી જ વૈરાગ્યથી પરિપૂર્ણ હતું, પરંતુ તેઓ જન-કલ્યાણની ભાવનાથી સંસારમાં રથ્યા હતા. પ્રભુના વૈરાગ્ય ભાવને જ્ઞાણીને નવ લોકાન્તિક દેવ પ્રભુની પાસે ઉપસ્થિત થયા અને જીતાચારનું પાલન કરતા નિવેદન કર્યું - “હે પ્રભુ ! ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ રૂપી ધર્મતીર્થનું પ્રવર્તન કરો. ભવ્ય જીવો પર ઉપકાર કરો. આપે લોક વ્યવસ્થા કરી, જનતાનો ઐહિક ઉપકાર કર્યો અને નીતિ પ્રચલિત કરી. હવે તીર્થ ચલાવીને પરમ સુખનો માર્ગ ખોલો.”

સંસારથી વિરક્ત બની ઋખભદેવે પોતાના સામનો, ભરત આદિ પુત્રોને બોલાવી ત્યાગની ભાવના વ્યક્ત કરી. હવે હું રાજ્ય અને પરિવારનો ત્યાગ કરી, નિર્ગ્રથ બનવા ઈચ્છણું છું. જેમાં જન-મરણનું અનાદિકાળનું દૂર કરીને દુઃખ શાશ્વત અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત થશે. માનવજાતિને વ્યવસ્થિત કરી. વ્યવસ્થાને સુચારુ રૂપથી ચલાવવા માટે ઋખભદેવજીએ ભરતને રાજ્યનો ભાર સોંપીને, તેનો રાજ્યાભિષેક કરાવ્યો. બાહુબલી આદિ ૮૮ પુત્રોની યોગ્યતાનુસાર પૃથ્વી-પૃથ્વી દેશોના રાજ્ય આપ્યા. તેના

પછી સાંવત્ಸરિક (વાર્ષિક) દાન દેવાનું પ્રારંભ કર્યું. વર્ષદાનમાં ઘોષણા કરી કે જેને જે વસ્તુ જોઈએ તેને તે દાનમાં આપવામાં આવશે. ઈન્દ્રના આદેશથી મૃંભક દેવોએ દ્વય જમા કર્યું. રોજ સવારથી ભોજન સમય સુધી શ્રી ઋખભદેવ એક કરોડ આઠ લાખ સૌનેયાના દાન કરવા લાગ્યા. પ્રભુએ એક વર્ષમાં કુલ ત્રણ અરબ અક્યાસી કરોડ અને ઓંશી (૮૦) લાખ સુવર્ણમુદ્રાઓનું દાન આપ્યું.

**દીક્ષા** - ચૈત્ર વદ આઠમનો દિવસ હતો. વર્ષદાનને એક વર્ષ પૂર્ણ થઈ ગયું હતું. શકેન્દ્ર દ્વારા પ્રભુનો દીક્ષાભિષેક કરવામાં આવ્યો. સુદર્શના શિબિકા પર પ્રભુ આરુંથ થયા. દેવતાઓ અને મનુષ્યોએ શિબિકા ઉપાડી, જ્ય - જ્યકાર અને મંગલ ગીતના ઉદ્ઘોષ થવા લાગ્યા. ભગવાન, સિદ્ધાર્થ નામના ઉઘાનમાં અશોકવૃક્ષની નીચે શિબિકાથી ઉત્તર્યા. ભગવાને પોતાના વચ્ચે અને આભૂષણ ઉત્તર્યા. દેવતાઓ અને મનુષ્યોના મોટા સમુદ્દર વચ્ચે પ્રભુએ પંચમુણ્ઠ લોચ કર્યો. પ્રભુના ડેશોને શકેન્દ્રએ પોતાના વચ્ચેમાં ગ્રહણ કર્યા. ઈન્દ્રએ પ્રભુના ખાને દેવદૂષ્ય રાખ્યું.

ઇહુના તપ સાથે શ્રી નાભિનંદને સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, સર્વ પાપના ત્યાગ રૂપ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરતા જ નૈરપિક જીવોને ક્ષાળભર માટે શાંતિનો અનુભવ થયો તથા પ્રભુ આદિનાથને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુ સાથે ચાર દશાર રાજાએ પણ દીક્ષા લીધી. ભરત - બાહુબલી સહિત સમસ્ત પરિવાર તેમ જ નગરજને પ્રભુને નમસ્કાર કરીને, શોક સંતાપ કરતા, ખૂબ મુશ્કેલીથી પાછા ફર્યા. ઈન્દ્ર અને અન્ય દેવી-દેવતા પણ પોત-પોતાના સ્થાન પર ચાહ્યા ગયા.

**સાધુઓનું પતન અને તાપસ પરંપરા** - ઋખભદેવ આ અવસર્પિણી કાળના પ્રથમ મહામુનિ હતા. તેમણે દીક્ષા લેતા જ મૌનવ્રત ધારણ કરી, કચ્છ, મહાકચ્છ મુનિઓની સાથે વિહાર કર્યો. તે સમયે લોડો ભિક્ષાદાન તેમ જ ભિક્ષાવૃત્તિના જાણકાર ન હતા. આથી આહાર મળતો નહોતો અને કેટલાક દિવસો વીતી ગયા. ક્ષુધા આદિ પરિષહોથી દુઃખી થઈ અને તત્વજ્ઞાનથી અનભિજ્ઞ સાધુ એક સાથે વિચાર કરવા લાગ્યા-આપણાથી આ દુઃખ સહન થતું નથી, ભગવાન બોલતા નથી. આપણે શું કરીએ? કેવી રીતે સાધુ ધર્મનું પાલન કરીએ? છેવટે ભૂખ, તરસ, ગરમી, સર્દીથી ગભરાઈને જંગલમાં ઝૂપડી બનાવીને રહેવા લાગ્યા. કંદમૂળ, વનફળ ખાઈને ગુજરાન કરવા લાગ્યા. વલ્કલથી શરીરને ઢાંકવા લાગ્યા. ભારતવર્ષમાં વિભિન્ન ધર્મોનો ઈતિહાસ અહીંથી પ્રારંભ થયો જૈન સંસ્કાર પાદ્યક્રમ ભાગ-૪ ..... 93

અને કંદમૂળ આદિનો આહાર કરવાવાળા તાપસોની પરંપરા ચાલી. ૩૬૩ મત શરૂ થયા.

**ભગવાનના પારણા** - દાનાન્તરાય કર્મના ઉદ્યથી તેમ જ ગૃહસ્થોને આહાર વહેરાવવાની વિધિનું જ્ઞાન ન હોવાને કારણે ભગવાન ઋખભદેવે બાર મહિના સુધી નિરંતર નિરાહાર તેમ જ મૌન રહીને સંયમ-સાધના કરી. ભયંકરમાં ભયંકર કષ્ટને પ્રસન્નચિત્તથી સમભાવપૂર્વક સહન કર્યા. વિચરતા - વિચરતા પ્રભુ હુસ્તિનાપુર પદ્ધાર્ય. ત્યાં બાહુબલીના પૌત્ર તથા સોમપ્રભ રાજના પુત્ર શ્રેયાંસ નામક રાજકુમાર હતા. પ્રભુના આગમનના સમાચાર જાણી તે પ્રભુ સન્મુખ હર્ષોલ્લાસ સાથે ઉપસ્થિત થયા તથા વંદન-નમસ્કાર કરી અપલક દિશિથી પ્રભુના શ્રીમુખને નિહાળવા લાગ્યા. તે સમયે પ્રભુ શ્રેયાંસકુમારના આંગણામાં પદ્ધારી ચૂક્યા હતા. તેમને વિચાર આવ્યો કે આવા મહાપુરુષને મેં પહેલાં કયાંક જોયા છે. આ પ્રકારે વિચાર કરતા - કરતા તેમને જ્ઞાતિસમરાણ જ્ઞાન થયું. જ્ઞાતિસમરાણ જ્ઞાન દ્વારા નિર્દોષ ભિક્ષા વિધિને જાણી, ત્યારે કોઈએ આવીને ઈક્ષુરસના ઘડા ભેંટ આપ્યા. શ્રેયાંસકુમારે કદ્યનીય રસ ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. પ્રભુએ બંને હાથને પાત્ર બનાવી આગળ કર્યા. આ કાળના આદિ શ્રમણ શ્રી ઋખભદેવે છઠ્ઠના તપ સાથે ચૈત્ર વદ આઠમના દીક્ષા લીધી હતી, તેનું પારણું એક વર્ષ પછી વૈશાખ સુદ ત્રીજના શ્રેયાંસકુમારના હાથથી થયું, જેને અક્ષય તૃતીયાના રૂપમાં ત્યાગ તપના રૂપમાં આજે પણ મનાવવાના આવે છે. ભગવાનના પારણાથી દેવો તેમ જ દાનવોમાં પ્રસન્નતા છવાઈ ગઈ. આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી. દેવગણ ‘અહોદાનમ् અહોદાનમ्’નો ઉચ્ચાર કરવા લાગ્યા. રત્નોની વૃષ્ટિ, પાંચ વર્ષાના ઉત્તમ પુષ્પોની વૃષ્ટિ, ગન્ધોદકની વૃષ્ટિ અને વલ્લોની વૃષ્ટિ થઈ. આ પ્રકારે પાંચ દિવ્ય પ્રકટ થયા, ત્યારપછી શ્રેયાંસકુમારે બધા રાજા, નગરવાસી, કર્ણ, મહાકચ્છ આદિ બધા તાપસોને ભિક્ષાવિધિનું જ્ઞાન આપ્યું.

**ભગવાનને કેવળજ્ઞાન તથા તીર્થનું પ્રવર્તન** - ભગવાન ઋખભદેવે હુઝાર વર્ષ સુધી મૌનપૂર્વક વિવિધ પ્રકારના તપ કરતા વિચરતા હતા. પ્રભુ વિચરણ કરતા, વિનીતા નગરીના, પુરિમતાલ નામના ઉપનગરના, શંકટમુખ ઉદ્ઘાનમાં, વટવૃક્ષની નીચે ધ્યાનસ્થ થયા. ધ્યાનની ધારા વધતી ગઈ. ધર્મધ્યાનથી શુકલધ્યાન તરફ વધતા વધતા ચાર ઘનધાતી કર્માનો ક્ષય કરી, કેવળજ્ઞાન-કેવળદર્શનને પ્રાપ્ત કર્યું. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થતા જ દેવ-ઈન્દ્રાદિ કેવળજ્ઞાન મહોત્સવ મનાવવા ઉપસ્થિત થયા

અને સમવસરાણની રચના કરી. ભરતેશરને પ્રભુના કેવળજ્ઞાન - કેવળદર્શનના શુભ સમાચાર મજયા સાથે આયુધશાળામાં સુદર્શન ચક ઉત્પન્ન થવાનો સંદેશ મજયો. તેમણે લૌકિક, ભૌતિકતાને મહત્વ ન હેતા, અલૌકિક આધ્યાત્મિક ઋષિને મહત્વ આપ્યું તથા દાઈ મરુદેવી પાસે પહોંચ્યા. પ્રભુદર્શનની તૈયારી થવા લાગી. માતા મરુદેવી હાથી પર સવાર થયા. માતા સમવસરાણની રચના જોઈ મંત્રમુખ થઈ ગયા. પ્રભુના પરમ શાંત શ્રીમુખ પર તેમની દાઢિ સ્થિર થઈ ગઈ. માતાની વિચારધારા વેગવતી બની ગઈ. ઋષભ તો વીતરાગ થઈ ગયા અને વીતરાગતા પરમ સુખ દેવાવાળી છે. બીજા પર મોહિત થવું દુઃખદાયક છે. આ પ્રકારના વિચારોથી કર્મ ખપવા લાગ્યા. તે સમયે તેઓ હાથી પર આરૂઢ માતા - ક્ષપક શ્રેણી પર આરૂઢ થતા, કેવળજ્ઞાન - કેવળદર્શને પ્રાપ્ત કરી, મોક્ષ પદ્ધાર્યા. ભરત મહારાજને દાઈના વિયોગનો શોક થયો. તે તત્કાળ હાથી પરથી ઉત્તર્યા, રાજચિન્હનો ત્યાગ કરી, સમવસરાણમાં ગયા, ત્યાં પ્રભુએ ધર્મોપદેશ આપ્યો. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. પ્રથમ ગણધર, ચક્કવર્તી ભરતના પુત્ર ઋષભસેન થયા. બધામાં પ્રમુખ આર્થિકો (સાધ્વી) પ્રાણી - સુંદરી થઈ.

ભગવાન ઋષભદેવના ૮૪ ગાણધર, ૮૪૦૦૦ સાધુ, બ્રાહ્મી - સુંદરી વગેરે ૩,૦૦,૦૦૦ સાધ્વીઓ, શ્રેયાંસ વગેરે ૩,૦૫,૦૦૦ શ્રાવક, સુભડ્રા વગેરે ૫,૫૪,૦૦૦ શ્રાવિકાઓ થઈ.

**મોક્ષ** - પ્રભુએ ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો. મોક્ષાભિલાષી અનેક મનુષ્યોએ દિક્ષા ગ્રહણ કરી તથા અનેક શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. ભગવાન વિચરણ કરતા અષ્ટાપદ પર્વત પદ્ધાર્યા. પદ્મમાસનમાં ચૌદ ભત (અર્થાત् દ દિવસના ઉપવાસ)ની તપસ્યા સાથે, દસ હજાર સાધુઓ સાથે પોષ વદ તેરસના મોક્ષ પદ્ધાર્યા.

પ્રભુ ૨૦ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા. ૬૩ લાખ પૂર્વ રાજ્ય સંભાળ્યું. આ પ્રકારે ૮૩ લાખ પૂર્વ સુધી ગૃહુસ્થ અવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ સુધી છદ્માવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ ઓછા એક લાખ પૂર્વ સુધી કેવળજ્ઞાની તીર્થકર રહ્યા. કુલ સંયમી જીવન એક લાખ પૂર્વનું હતું. કુલ આયુષ્ય ૮૪ લાખ પૂર્વ હતું. જ્યારે ત્રીજા આરાના ૩ વર્ષ અને ૮ મહિના અને ૧૫ દિવસ બાકી હતા ત્યારે મોક્ષ પદ્ધાર્યા.

ભગવાન ઋષભદેવ જૈનધર્મના જ નહીં, વિશ્વના વિભૂતિ હતા. વૈદિક ધર્મમાં પણ ઋષભદેવનો અવતાર માનવામાં આવ્યો છે. ભગવાન ઋષભદેવને શ્રીમદ્ ભાગવત જૈન સંસ્કાર પાદ્યક્રમ ભાગ-૪

ગીતા (૫/૪/૧૪)માં સાક્ષાત્ ઈશ્વર કહ્યા છે. ઋગ્વેદ, વિષ્ણુ પુરાણ, અજિ પુરાણ, ભાગવત આદિ વૈદિક સાહિત્યમાં પણ તેમના ગુજારી-કીર્તન, આદર સાથે કરવામાં આવે છે.

## (૨) અર્જુનમાળી - કૂરતાનો દૈત્ય કુલુણાનો દેવતા

રાજગૃહી નગરીમાં અર્જુન નામનો માળી રહેતો હતો. રાજગૃહી નગરીની બહાર અર્જુનમાળીનો એક વિશાળ બગીચો હતો. તે બગીચામાં અનેક પ્રકારના વૃક્ષો, વેલાઓ અને ફૂલોના છોડ વાવેલા હતા.

તે બગીચામાં તેના કુળદેવતા મુદ્ગરપાણી નામના યક્ષનું એક યક્ષાયતન (મંદિર) હતું, જે અર્જુનમાળીની પેઢીઓ અને કુળ સાથે સંકળાયેલું હતું. તે યક્ષાયતન ઘણું જ જૂનું, દિવ્ય અને શોભનીય હતું. તેમાં મુદ્ગરપાણી યક્ષની એક મૂર્તિ હતી. તે પ્રતિમાના હાથમાં એક હજાર પળ પરિમાણ ભારવાળું એક લોખંડનું મુદ્ગર હતું.

તે અર્જુનમાળી બચપણથી જ મુદ્ગરપાણી યક્ષનો ભક્ત હતો. તે દરરોજ સવારે વહેલો ઉઠીને પત્ની બંધુમતી સાથે ફૂલની ટોપલી લઈને, રાજગૃહી નગરની બહાર થઈને, પોતાના બગીચામાં જતો અને સારા સારા જુદા જુદા રંગના અને અનેક જાતિઓના સારા ફૂલો ભેગા કરતો હતો. તે ફૂલોમાંથી શ્રેષ્ઠ ફૂલો તે મુદ્ગરપાણી યક્ષની પ્રતિમાને ચદ્વાવતો હતો. આ પ્રકારે તે યક્ષની પૂજા કરતો અને જમીન પર બંને પગના ઘૂંટાણ ટેકવીને તેને પ્રાણામ, નમસ્કાર કરતો હતો, ત્યારબાદ વધારાના ફૂલોના ગુલાદસ્તા, ગજરા, હાર, માળાઓ બનાવીને રાજમાર્ગ પર બેસીને તે વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આમ, તેના દિવસો સુખપૂર્વક વ્યતીત થઈ રહ્યા હતા.

એકવાર રાજગૃહના કેટલાક યુવકોની એક ટોળી જેમાં છ યુવક હતા, જે લલિત ટોળીના છ સભ્યો મુદ્ગરપાણીના યક્ષાયતનમાં પોતાની મનમાની ટીખળ કરી રહ્યા હતા. અર્જુનમાળી પોતાના નિત્યકમ પ્રમાણે અમુક સારા સારા ફૂલો લઈને પોતાની પત્ની સાથે યક્ષાયતન તરફ જઈ રહ્યો હતો. બંધુમતીનું રૂપ જોઈને લલિત ટોળીના સભ્યોએ વિચાર્યું કે ‘અર્જુનમાળી અહીં આવે કે તરત તેને દોરીથી મુશ્કેટાટ બાંધી દઈશું

અને બંધુમતી સાથે આપણી મનમાની કરીશું.' આવો ખરાબ વિચાર કરીને, તે ટોળીના બધા સત્યો યક્ષાયતનના દરવાજા પાછળ છુપાઈ ગયા.

અર્જુનમાળી પોતાની પત્ની સાથે ત્યાં આવ્યો અતે યક્ષને પ્રાણામ કરીને તેને વંદન કરવા લાગ્યો. તે સમયે દરવાજા પાછળથી લલિત ટોળીના સત્યોએ આવીને તેને પકડી લીધો અને તેને દોરડાથી બાંધીને ત્યાં જમીન પર સુવાડી દીધો અને તેની નજરની સામે જ તેની પત્ની બંધુમતી સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યા. આવું દશ્ય જોઈને અર્જુનમાળીને ગુસ્સો આવ્યો, પરંતુ તે રસ્સીઓથી બંધાયેલો હતો. કાંઈ કરી શકે એમ નહોતો. કોધમાં મનમાં વિચાર કરવા લાગ્યો કે, 'હું નાનપાણથી જ આ મુદ્ગરપાણી યક્ષની સેવા - પૂજા કરું છું અને પછી જ ફૂલ વેચીને મારો જીવનનિર્વહિ કરું છું. જો મુદ્ગરપાણી યક્ષ હોત તો, ખરેખર આવી તકલીફના સમયે મને જરૂરથી મદદ કરત માટે, નક્કી અહીં કોઈ યક્ષ નથી પાણ, આ તો માત્ર પ્રતિમા છે.'

મુદ્ગરપાણી યક્ષે અર્જુનમાળીનો વિચાર જાણીને અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ કર્યો. તે યક્ષે તેના બધા બંધનો તોડી નાખ્યા. યક્ષ અંગપ્રવિષ થયેલ તે અર્જુનમાળીએ એક હજાર પળ ભારવાળું મુદ્ગર ઉપાડી, પોતાની પત્ની બંધુમતી અને દ પુરુષોને મારી નાખ્યા.

આ પ્રકારે સાત જીવની દિંસા કર્યા પછી અર્જુનમાળીનો કોધ શાંત ન થયો. તેના મનમાં મનુષ્ય જાતિ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ. તે દરરોજ છ પુરુષ અને એક શ્વીની હત્યા કરવા લાગ્યો. રાજગૃહી નગરીના રાજા શ્રેષ્ઠિક પાસે લોકોની ફરિયાદો પહુંચાયાથી તેમણે નગરીમાં ઘોષણા કરાવી દીધી કે, "જે દિશામાં અર્જુનમાળીનો બળીયો છે તે દિશામાંથી કોઈએ નગરીની બહાર નીકળવું નહિ." આમ, હવે લોકોની રાજગૃહીની બહાર જવાની અવરજનર ઓછી થઈ ગઈ.

આ પ્રકારે પ મહિના ૧૩ દિવસ વીતી ગયા. એકવાર ગ્રામાનુગ્રામ વિચરણ કરતા કરતા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીની બહાર પદ્ધાર્યા. અર્જુનના આતંકથી હજારો શ્રદ્ધાળું દરશને કરવા ન ગયા. તે રાજગૃહી નગરીમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તેઓ ખૂબ જ ઋદ્ધવાન અને જીવ અજીવનું જ્ઞાન ધરાવનાર દૃઢધર્મ શ્રાવક હતા. ભગવાન મહાવીર પદ્ધારવાના સમાચાર સુદર્શન શેઠને પાણ મળ્યા. તેમણે મનમાં વિચાર કર્યો કે, 'શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીની બહાર ગુણશીલક ઉદ્ઘાનમાં પદ્ધાર્યા છે તો હું તેમના દર્શન કરવા જાઉં.''

સુદર્શન શ્રાવકની દૃઢતા જોઈને માતા-પિતાએ અનિયષ્ટાએ તેમને આજ્ઞા આપી. સુદર્શન શ્રાવક તૈયાર થઈને રાજગૃહી નગરીમાં થઈને બહાર નીકળ્યા. સુદર્શનને જોતા જૈન સંસ્કાર પાદ્યક્રમ ભાગ-૪ ..... 97

જ કોપાયમાન થયલો અર્જુનમાળી મુદ્ગર હવામાં વીંઝતો, પોતાના શિકારને જોઈને ચિચિયારી પાડતો, તે દિશામાં જવા લાય્યો. તેને પોતાની પાસે આવતો જોઈને સુદર્શન શેઠ જરાપણ ઉર્ધ્વ નહિ, વિચલિત થયા નહિ અને નિર્ભય રહ્યા. તેમણે પોતાના વખ્થી જમીનનું પ્રતિલખન કરીને, પોંજી, બેસી ગયા. ભગવાનને વંદના-નમસ્કાર કરી, પ્રતોની આલોચના કરી, સાગારી સંથારો કર્યો. સુદર્શનની સૌભ્યતા સામે અર્જુનની છૂરતા જતી રહ્યી, તે સ્તબ્ધ થઈ ગયો, પછી જમીન પર પડી ગયો, ઉપસર્ગ પૂરો થવા પર સુદર્શન પોતાના વ્રત-પ્રતિજ્ઞાથી નિવૃત્ત થયો. અર્જુનને ઉઠાડ્યો. મુખ પર તેની છૂરતા અને દાનવતાને કરુણા અને સ્નેહની દિવ્યતાથી સાંત્વના આપી. અર્જુન સુદર્શનના ચરણોમાં પડી ગયો અને પોતાના કૂર કર્મો પર પશ્ચાતાપ કરવા લાય્યો.

સુદર્શને કહ્યું. ‘અર્જુન ! ગભરા નહીં ! તું પણ મનુષ્ય છે. તારા લોહીમાં દાનવતાના સંસ્કાર ધૂસી ગયા હતા, માટે તે સેંકડો નિરપરાધ પ્રાણિઓની હત્યા કરી, હવે તું પ્રબુધ્ય થયો છે. તારા દાનવીય સંસ્કારોમાં પરિવર્તન આવ્યું છે. ચાલ ! હું તને દેવાધિદેવ પાસે લઈ જાઉ.’

સુદર્શન શ્રાવક તેને પોતાની સાથે લઈ અને ભગવાનના દર્શને ગયા. ગુણશીલક ઉદ્ઘાનમાં પહોંચીને તેણે ભગવાનને વંદન-નમસ્કાર કર્યા. ભગવાને બંનેને ઉપદેશ આપ્યો. જેના કારણે રક્તની દાનવીય ઉખા શાંત થઈ, કરુણાની રસધારા શરૂ થઈ. પશ્ચાતાપના આંસુ સાથે ભગવાન પાસે ગ્રાયશ્વિત કર્યું અને દિક્ષા લેવાનો વિચાર કર્યો.

દિક્ષાના દિવસે જ તેમણે ભગવાનને વંદન-નમસ્કાર કરીને નિવેદન કર્યું કે, “હું જીવજળવ સુધી છદ્ધના પારણે છદ્ધ કરીશ અને તપસ્યામાં આત્માને જોડીને વિચરીશ.” આવો અભિગ્રહ ધારીને તે અર્જુન આશગાર વિચરવા લાય્યા.

પારણાના દિવસે તેઓ રાજગૃહી નગરીના ઘરોમાં ગોચરી લેવા ગયા. તે અર્જુન આશગારને જોઈને લોકો આ પ્રકારે બોલવા લાય્યા કે, “એઝે મારી માતાને મારી નાખી છે, એઝે મારા પિતાને માર્યા છે, મારા ભાઈને, બહેનને, પુત્રને, પુત્રીને માર્યા છે.” આવું કહી કડવાં વચનો સંભળાવતા. કોઈ નિંદા કરતા, કોઈ ખીજવવા લાય્યા, કોઈ તેમના દોષો પ્રગટ કરવા લાય્યા, કોઈએ થાપડ મારી, કોઈએ લાકડી મારી, કોઈએ ઈંટથી તેમને માર્યા.

ભગવાન મહાવીરે અર્જુનને શિક્ષામંત્ર આપ્યો હતો - તિતિક્ખં પરમ નચ્ચા તિતિક્ષા પરમ ધર્મ છે. અર્જુને આ મંત્રને સાકાર બનાવ્યો.

આ રીતે તેમણે છ મહિના સુધી અખંડ પોતાનું તપ ચાલુ રાખ્યું. તેમનું શરીર ફૂશ થઈ ગયું અને શરીરની શક્તિઓ રસ્કસ હીન થવા પર ક્ષીણ થઈ ગઈ. શરીરને શક્તિરહિત જાણીને તેમણે સંથારો ધારણ કર્યો. જે ૧૫ દિવસ સુધી ચાલ્યો. અંતમાં સર્વ ઘાતી અને અઘાતી કર્મોને ખપાવી, તેઓ કેવળજ્ઞાન, કેવળદર્શન પામીને, મોક્ષ પદ્ધાર્યા.

અર્જુન જન્મથી આર્થ હતા, પરંતુ તેમાં અનાર્થતાના ફૂર સંસ્કાર ધૂસી ગયા હતા. ભગવાન મહાવીરે સંસ્કારશુદ્ધિની પ્રક્રિયા દ્વારા ફૂરતાના તે દૈત્યને સમતાના દેવતા બનાવ્યા.

### 3. ઢંઢણ મુનિવર સંસ્કારશુદ્ધિ

શ્રી કૃષ્ણના એક પુત્રનું નામ ઢંઢણ હતું. તે પોતાની રાણીઓ સાથે ભોગો ભોગવતા હતા, પરંતુ ભગવાન નેમિનાથના ઉપદેશો તેમની ધર્મચેતના જાગૃત કરી. તેઓ દિક્ષીત થઈ ગયા અને વિધિપૂર્વક સંયમ-તપનું પાલન કરવા લાગ્યા. તે બધા સંતોને અનુકૂળ રહેતા અને યથાયોગ્ય સેવા કરતા. તેના અંતરાય કર્મનો ઉદ્ય વિશેષ હતો. કોઈને કોઈ બાધા આવતી અને તેમણે ખાલી પાછું ફરવું પડતું અને એવા યોગ બનતા કે અન્ય જે સાધુ તેની સાથે જતા તે પણ ખાલી હાથે પાછા ફરતા. તેની આવી સ્થિતિ જોઈને કેટલાક મુનિઓને ભગવાનને પૂછ્યું -

‘ગ્રભુ ! ઢંઢણમુનિજી શ્રીકૃષ્ણના પુત્ર છે. નિર્ઝથધર્મનું પાલન કરે છે. દ્વારિકાવાસીઓમાં ધર્મપ્રેમની કમી નથી. ઔદ્યાર્ય ગુણની ન્યૂનતા પાણ નથી અને દુષ્કાળ પાણ નથી, પછી આ ઢંઢણ મુનિને આદારાદિ કેમ મળતા નથી અને તેની સાથે જવાવાળા સાધુઓએ પણ ખાલી હાથે પાછું આવવું પડે છે? જ્યારે બીજા બધા મુનિઓને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે.’

ભગવાને કહ્યું, - ‘ઢંઢણ મુનિના અંતરાય કર્મનો વિશેષ ઉદ્ય છે. તે પૂર્વભવમાં ભગવદેશના ધાર્યાપૂરક નગરના રાજ્યના સેવક હતા. તેમનું ‘પારાસર’ નામ હતું. તે ગ્રામ્યજનો પાસેથી રાજ્યના ખેતર ખેડાવતા હતા અને પરિશ્રમ કરાવતા, પરંતુ ભોજનનો સમય થવા છતાં અને ભોજન આવે તો પણ તે શ્રમિકોને છોડતા નહિ અને તેને કહેતા, તમે હળથી ખેતરમાં એક - એક ચક્કર હજી લગાવો, પછી છુટ્ટી મળશો. ભોજન કર્યાં ભાગી જાય છે?’

ભૂમ્યા - તરસ્યા શ્રમિક અને બળદ, મન મારીને પાછા કામે લાગતા. આ પ્રકારે તે ભોજનમાં બાધક બન્યા અને અંતરાય કર્મનો બંધ કર્યો. તેના ઉદ્યથી ભિક્ષા નથી મળતી. ભગવાનનો નિર્ણય સાંભળી હંઠણ મુનિજી, પોતાના કર્મને નાટ કરવામાં વિશેષ તત્પર થઈ ગયા. તેમણે ભગવાનની પાસે અભિગ્રહ લીધો કે આજથી હું મારી લઘિણો આહાર મળે, તો જ લઈશ બીજાની લઘિણો આહાર નહીં લઉં.

આ પ્રકારે પોતાના અભિગ્રહનું પાલન કરતા અને અલાભ-પરિખછુને જીતતા હંઠણ મુનિરાજ શાંતિપૂર્વક વિચરવા લાગ્યા. એકવાર શ્રીકૃષ્ણે ભગવાનને પૂછ્યું -

“ભગવાન! આ બધા મુનિઓનાં કઠોર તેમ જ ફુઝકર સાધના કરવાવાળા સંત કોણ છે?”

ભગવાને કહ્યું, - ‘આમ તો સંયમની કઠોર સાધના સંતો કરે છે, પણ હંઠણ મુનિ બધામાં વિશેષ છે. તે અલાભ - પરિખછુને શૂરવીરતા સાથે, શાંતિપૂર્વક સહન કરી રહ્યા છે.’

શ્રીકૃષ્ણ, ભગવાનને વંદન કરી પાછા ફરી રહ્યા હતા. માર્ગમાં તેમણે ભિક્ષાર્થે ફરતા હંઠણમુનિને જોયા. તે તત્કાળ હાથી પરથી નીચે ઉત્તર્યા અને હંઠણમુનિને ભક્તિપૂર્વક વંદના કરી, ત્યારે એક શ્રેષ્ઠી જોઈ રહ્યા હતા. તેણે વિચાર કર્યો કે આ મહાત્મા ઉત્તમ કોટિના છે, માટે મહારાજાધિરાજ હાથી પરથી નીચે ઉત્તરી, વંદના કરી રહ્યા છે. મુનિ ભિક્ષાર્થે ફરતા - ફરતા તેમના ઘરે પહોંચ્યા, તો તેમણે આદરપૂર્વક મોદક વહોરાવ્યો. મુનિ ભિક્ષા લઈને ભગવાન પાસે આવ્યા અને વંદના કરી બોલ્યા, “ભગવાન! આજે મને ભિક્ષા મળી ગઈ, તો શું મારા અંતરાયકર્મ નાટ થઈ ગયા?” ભગવાને કહ્યું - “તમારા અંતરાય કર્મ હજુ પણ ઉદ્યગત છે. તમને આ ભિક્ષા કૃષણના પ્રભાવથી મળી છે. તમને વંદના કરતા જોઈને શ્રેષ્ઠી પ્રભાવિત થયા અને તમને મોદક વહોરાવ્યો.” ભગવાનનો નિર્ણય સાંભળી હંઠણ મુનિએ શાંતિપૂર્વક વિચાર્યું - “આ આહાર મારી લઘિણો નથી, મારી આ પરઠી દેવો જોઈએ.” તે શુદ્ધ સ્થંડિલ-ભૂમિમાં ગયા અને મોદકને પરઠવા લાગ્યા. ભાવનાનો વેગ વધ્યો. પાપના કટુ પરિણામનો વિચાર કરતા શુકલધ્યાનમાં પ્રવેશ કર્યો. ધ્યાનાગ્નિની તીવ્રતામાં તેમના ધાતીકર્મ નાટ થઈ ગયા. તેમણે કેવળજ્ઞાન-કેવળદર્શન થયું અને ભગવાનને વંદના કરી કેવળીઓની પરિષદમાં બેસ્તી ગયા.

-----

## (१) श्री भक्तामर स्तोत्र

(राग : वसंततिलका वृतम्)

भक्तामर-प्राणत-मौलि - मणि - प्रभाणा -  
मुघोतकं दलित पाप-तमो-वितानम् ।  
सम्यक् प्राणमय जिन - पाठ - युगं युगादा -  
वालम्बनं भव - जले - पततां जनानाम् ॥१॥

यः संस्तुतः सकल वांगमय तत्त्वबोधा -  
दुष्कूल बुद्धि - पटुभिः सुरलोक - नाथैः ।  
स्तोत्रैः - जगत् - त्रितय चित छैरुदारैः  
स्तोषे डिलाहमपितं प्रथमं जिनेन्द्रम् ॥२॥

बुद्धया विनापि विषुधा - र्थित - पाठपीठ ।  
स्तोतुं समुद्धत - भतिर्विगत - त्रपोहम् ।  
आलविहाय जल संस्थित भिन्दु - बिभ -  
मन्यः क ईर्च्छति जनः सहसा ग्रहीतुम् ॥३॥

वक्तुं गुशान् गुण समुद्र! शशांक - कान्तान्  
कस्ते क्षमः सुरगुरु - प्रतिभोपि बुद्धया ।  
कल्पान्त - काल - पवनोद्धत - नक - चक्र  
को वा तरीतुमलभम्भुनिधिं भुजाभ्याम् ॥४॥

सोहुं तथापि तव भक्ति - वशान्मुनीश !  
कर्तुं स्तवं विगत - शक्ति - रपि प्रवृत्तः ।  
प्रीत्यात्म - वीर्य - भविचार्य मृगो मृगेन्द्रं  
नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ॥५॥

अल्प - श्रुतं श्रुतवतां पहिस धाम  
 त्वद् - भक्तिरेव मुखरी कुरुते बलान्माम् ।  
 यत्कोऽक्लः किल भद्रौ भधुरं विरौति  
 तच्यारुयाप्र - कलिका - निकरैक - हेतुः ॥६॥

त्वत् - संस्तवेन भव - संतति - सन्तिबद्धं  
 पापं क्षाणपात् - क्षयमुपैति शरीरभाजम् ।  
 आकान्तलोक - भलि - नीलम - शेषमाशु  
 सूर्याशु - भिन्नमिव शार्वर - मन्धकारम् ॥७॥

मत्वेति नाथ ! तव संस्तवनं भयेद -  
 मारब्ध्यते तनु - धियापि तव प्रभावात् ।  
 चेतो हरिष्यति सतां नलिनी - दलेषु  
 मुक्ता - फल - द्युति मुपैति ननूद - बिन्दुः ॥८॥

आस्तां तव स्तवनमस्त - समस्त - दोषं  
 त्वत् - संकथापि जगतां दुरितानि हुंति ।  
 दूरेः सहखडिराणः कुरुते प्रभैव  
 पश्चाकरेषु जलजानि विकाश - भांजि ॥९॥

नात्यद्भुतं भुवनभूषण भूतनाथ !  
 भूतैर्गुणैर्भूवि भवन्त - मभिषुवन्तः ।  
 तुल्या भवन्ति भवतो ननु तेन किं वा ?  
 भूत्याश्रितं य ईह नात्मसमं करोति ॥१०॥

दृष्ट्वा भवन्त - मनिभेष - विलोकनीयं  
 नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः ।  
 पीत्वा पयः शशिकर - द्युति - दुःध - सिन्धोः  
 क्षत्रं जलं जल - निधेर - शितुं क ईर्च्छेत् ॥११॥

यैः शान्त - राग - रुचिभिः परमाणुभिस्त्वं  
निर्मापित्विभुवनैक - ललाम - भूत ॥  
तावन्त एव खलु ते घाणवः पृथिव्यां  
यते समानमपरं न हि रूपमस्ति ॥१२॥

वक्त्रं इव ते सुर - नरो - रग - नेत्रहारि  
निःशेष - निर्जित जगत्प्रितयोपमानम्? ।  
बिभं कलंक - मलिनं इव निशाकरस्य?  
यद्वासरे भवति पांडु - पलाश - कद्यम् ॥१३॥

सम्पूर्ण मंडल - शशांक - कला - कलाप  
शुभ्रा गुणाञ्चिभुवनं तव लंघयन्ति ।  
ये संश्रिता स्त्री - जगदीश्वर नाथमें  
कस्तान् - निवारयति संयरतो यथेष्टम् ॥१४॥

यित्रं किमत्र यदि ते त्रिदशांगनाभिर्  
नीर्तं मनागपि मनो न विकार - भार्गम् ।  
कद्यपान्त - काल - भरुता चलिता - चलेन,  
कि मंदराद्रि - शिखरं चलितं कदाचित् ॥१५॥

निर्धूम - वर्तिरपवर्जित - तैल - पूरः  
कृत्स्नं जगत् - त्रयमिदं प्रकटी-करोषि ।  
गम्यो न शतु भरुतां चलिता - चलानां  
दीपोपरस्त्वमसि नाथ! जगत् - प्रकाशः ॥१६॥

नास्तं कदा चिदुपयासि न राहुगम्यः  
स्पष्टीकरोषि सहसा युग वज्रजगन्ति ।  
नाभोधरो - दर - निरुद - भरु - प्रभावः  
सूर्यातिशायि भहिमा सि मुनीन्द्र ! लोके ॥१७॥

नित्योदयं दलित मोहु - महान्धकारं  
 गम्यं न राहु - वहनस्य न वारिदानाम्।  
 विभाजते तव मुखाष्ज मनस्य - कान्ति  
 विद्योतयज्ज - जगदपूर्व शशांक बिम्बम् ॥१८॥

कि शर्वरीषु शशिनाऽक्षि विवस्वता वा  
 पुम्नमुभेन्दु - दलितेषु तमस्सु नाथ! ।  
 निष्पत्र - शालि - वन - शालिनि छवलोके  
 कार्य कियज्ज - जलधरैर्जल - भार - नम्रैः ॥१९॥

शानं यथा त्वयि विभाति इतावकाशं  
 नैवं तथा हरि - हरादिषु नायकेषु ।  
 तेजः स्फुरन्मणिषु याति यथा महत्वं  
 नैवं तु काच - शकले किरणा - कुलेषि ॥२०॥

मन्ये वरं हरि - हरादय एव दृष्टा -  
 दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति।  
 कि वीक्षितेन भवता भुवि येन नान्यः  
 कश्चिन्मनो - हरति नाथ ! भवान्तरेषि ॥२१॥

स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्  
 नान्या - सुतं त्वदुपमं जननी प्रसूता।  
 सर्वा दिशो धधति भानि सहस्र - रश्मि  
 प्रायेव दिग् - जनयति स्फुरदंशु - जालम् ॥२२॥

त्वामामनन्ति मुनयः परमं पुमांस-  
 मादित्य - वार्ण - ममतं तमसः पुरस्तात्।  
 त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युं  
 नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥२३॥

त्वामाव्ययं विभु-मर्यित्य-मसंप्रयमाद्यं  
 ब्रह्माणभीश्वर मनन्त मनंग - केतुभ् ॥  
 योगीश्वरं विद्धित - योग मनेक मेहं  
 शान - स्वदृप - ममलं प्रवदन्ति सन्तः ॥२४॥

बुद्ध स्त्वमेव विभुधार्थित - बुद्धि - बोधात्  
 त्वं शंकरोसि भुवन - त्रय - शंकरत्वात् ।  
 धातासि - धीर ! शिवमार्ग - विद्यर्विधानात्  
 व्यक्तं त्वमेव भगवन्! पुरुषोत्तमोसि ॥२५॥

तुम्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ !  
 तुम्यं नमः क्षितितलामल - भूषणाय ।  
 तुम्यं नमस्त्रिजगतः परमेश्वराय  
 तुम्यं नमो जिन ! भवोदधि - शोषणाय ॥२६॥

को विस्मयोत्र यदि नाम गुणैरशैषे-  
 स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! ।  
 दोषैरुपात - विविधाश्रय जात गर्वः  
 स्वप्नान्तरेऽपि न कठाचिद - पीक्षितोसि ॥२७॥

उच्चैरशोक - तरु - संश्रित मुन्मयूभ-  
 माभाति रूपममलं भवतो नितान्तभ् ।  
 स्पष्टौल्लस्त्-किरण-भस्त-तमो-वितानं  
 बिम्बं रवेरिव पयोधर पार्श्ववर्ति ॥२८॥

सिंहासने भणि - मयूभ - शिखा - विचित्रे  
 विभ्राजते तव वपुः कनकावदातभ् ।  
 बिम्बं वियद्विलस दंशु लता - वितानं  
 तुंगोदयाद्रि - शिरसीव सहञ्चरश्मेः ॥२९॥

કુંદાવદાત - ચલ - ચામર - ચારુ - શોભં  
વિભાજતે તવવપુઃ કલધૌત - કાન્તમ्।  
ઉઘદ્ય શાંક - શુચિ - નિર્જર - વારિધાર -  
મુચ્યૈસ્તટં સુરગિરેરિવ શાત - કૌમ્ભમ् ॥૩૦॥

ઇત્ર - ત્રયં તવ વિભાતિ શશાંક - કાન્ત -  
મુચ્યૈ: સ્થિતં સ્થગિત - ભાનુકર - પ્રતાપમ्।  
મુક્તા - ફલ - પ્રકર - જાલ - વિવૃદ્ધ - શોભં -  
પ્રભ્યાપયત્ર - નિજગતઃ પરમેશરત્વમ् ॥૩૧॥

ગંભીર - તાર - રવ પૂરિત - દિગ् - વિભાગ -  
સ્વૈલોક્ય લોક - શુભ - સંગમ - ભૂતિ દક્ષઃ ।  
સદ્ગર્મ - રાજ - જય - ઘોષણ - ઘોષક: સન्  
ખે હુન્દુભિદર્વનતિ તે યશસ: પ્રવાદી ॥૩૨॥

-----

## (૨) રત્નાકર પરચીસી

શુભ કેળિ કે આનંદ હો, ધન કે મનોહર ધામ હો,  
નરનાથ સે સુરનાથ સે, પૂજિત ચરણ ગત કામ હો।  
સર્વજ્ઞ હો સર્વોચ્ચ હો, સબસે સદા સંસાર મેં,  
પ્રજ્ઞા કલા કે સિન્હદુ હો, આદર્શ હો આચાર મેં ॥૧॥

સંસાર - દુઃખ કે વૈદ હો, તૈલોક્ય કે આધાર હો,  
જ્ય શ્રીશ રત્નાકર પ્રભો! અનુપમ દૃપા - અવતાર હો।  
વીતરાગ! હે વિજાપુર મેરી, મુખ કો સુન લીજુએ,  
તુમ વિજા હો ક્યોંકિ પ્રભો! મુજકો અભય વર દીજિએ ॥૨॥

માતા-પિતા કે સામને, બોલી સુનાકર તોતલી,  
કરતા નહીં કયા અજ્ઞ બાલક, બાટ્ય - વશ લીલાવલી?  
અપને હંદ્ય કે હાલ કો, વૈસે યથોચિત રીતિ સે,  
મૈં કહ રહા હું આપકે આગે, વિનય ઔર ગ્રીતિ સે ॥૩॥

મૈને નહીં જગ મેં કબી, કુછ દાન દીનોં કો દિયા,  
મૈં સચ્ચારિત ભી હું નહીં, મૈને નહીં તપ ભી કિયા।  
શુભ ભાવના મેરી હુઈ, અબ તક ન ઈસ સંસાર મેં,  
મૈં ઘૂમતા હું વ્યર્થ હી, બ્રમ સે ભવોદધિ ધાર મેં ॥૪॥

કોધાંગિ સે મૈં રાત-દિન હા ! જલ રહા હું હે પ્રભો !  
મૈં લોભ નામક સ્તુપ સે, કાટા ગયા હું હે પ્રભો !  
અભિમાન કે ખલ ગ્રાહ સે, અજ્ઞાનવશ મેં ગ્રસ્ત હું  
કિસ ભાંતિ હો, સ્મૃત આપ, માયા-જાલ સે મૈં વ્યસ્ત હું ॥૫॥

લોકેશ! પર-હિત ભી કિયા, મૈને ન દોનોં લોક મેં,  
ચુખ-લેશ ભી ફીર ભી કયોં મુજે હો, ખીંગતા હું શોક મેં।  
જગ મેં હમારે સે નરોં કા, જન્મ હી બસ વ્યર્થ હૈ,  
માનો જિનેશ્વર! યહ જગત કી પૂર્ણતા કે અર્થ હૈ ॥૬॥

પ્રભુ! આપને નિજ મુખ સુધાકા, દાન યધપિ દે દિયા,  
યહ ઠીક હૈ પર ચિત્તને, ઉસકા ન કુછ ભી ફલ લિયા।  
આનંદ રસ મેં ઝૂબકર, સહેવત વહુ હોતા નહીં,  
હે વજ સા મેરા હથ્ય, કારાણ પડા બસ હૈ યહી ॥૭॥

રત્નત્રયી દુષ્પાખ્ય હૈ, પ્રભુ સે ઉસે મૈને લિયા,  
બહુકાલ તક બહુ બાર જબ, જગ કા ભ્રમણ મૈને કિયા।  
હા! ખો ગયા વહુ ભી વિવશ મેં નીંદ આલસ મેં રહા,  
અબ બોલિએ ઉસકે લિએ, રોઉં પ્રભો! કિસકે યહી ॥૮॥

સંસાર/ઠગને કે લિએ, વૈરાગ્ય કો ધારણ કિયા,  
જગ કો હુંસાને કે લિએ, ઉપદેશ ધર્મો કા દિયા।  
જગડા મચાને કે લિએ, મમ જીબ પર વિદ્યા બસી,  
નિર્લજ્જજ, હો કિતની ઉડાઉ, હે પ્રભો! અપની હંસી ॥૯॥

પર દોષ કો કહુકર સદા, મેરા બદન દૂષિત હુઅા,  
લખ કર પરાઈ નારિયોં કો, હા! નયન દૂષિત હુઅા।  
મન ભી મહિન હૈ સોચકર, પર'કી બુરાઈ હૈ પ્રભો!  
કિસ ભાંતિ હોળી લોક મેં, મેરી ભલાઈ હૈ પ્રભો! ॥૧૦॥

મૈને બઢાઈ નિજ વિવશતા, હો અવસ્તા કે વશી,  
ભક્ષક રતીશ્વર સે હુઈ, ઉત્પત્ત જો દુઃખ રાક્ષસી।  
હા! આપકે સન્મુખ ઉસે, અતિ લાજસે પ્રકટિત કિયા,  
સર્વજ્ઞ હો સબ જાનતો, સ્વયમેવ સંસ્તુતિ કી કિયા ॥૧૧॥

અન્ય મંત્રો સે પરમ, પરમેષ્ઠી મંત્ર હુટા દિયા,  
સત્યાખ્ય વાક્યોં કો, કુશાખ્યોં સે દબા મૈને દિયા,  
દુઃસંગ સે દુષ્કર્મ કર્તા, જાન લેના તૂ મુઝે,  
લોકેશ! ઈસ કારાણ મતિ ભ્રમ, માન લેના તૂ મુઝે ॥૧૨॥

હા! તજ દિયા મૈને પ્રભો! પ્રત્યક્ષ પાકર આપ કો,  
અજ્ઞાન-વશ મૈને કિયા ફિર, દેખિએ કિસ પાપ કો।  
વામાક્ષિયોં કે કુચ કટાક્ષોં પર સદા મરતા રહા,  
ઉન કે વિલાસોં કા હથ્યમેં, ધ્યાન ભી કરતા રહા ॥૧૩॥

## (૩) અરિહન્ત જ્ય જ્ય સિદ્ધ પ્રભુ જ્ય જ્ય

અરિહન્ત જ્ય જ્ય, સિદ્ધ પ્રભુ જ્ય જ્ય।  
સાધુ જીવન જ્ય જ્ય, જિનધર્મ જ્ય જ્ય ॥૧॥

અરિહન્ત મંગલં, સિદ્ધ પ્રભુ મંગલં।  
સાધુ જીવન મંગલં, જિનધર્મ મંગલં ॥૨॥

અરિહન્ત ઉત્તમં, સિદ્ધપ્રભુ ઉત્તમં।  
સાધુ જીવન ઉત્તમં, જિનધર્મ ઉત્તમં ॥૩॥

અરિહન્ત શરણં, સિદ્ધ પ્રભુ શરણં।  
સાધુ જીવન શરણં, જિનધર્મ શરણં ॥૪॥

ચાર શરણ કુઃખ હુરણ જગત મેં, ઔર ન શરણ કોઈ હોણા।  
જો ભવ્ય પ્રાણી કરે આરાધન, ઉસકા અજર અમર પદ હોણા ॥૫॥

## (૪) કર્મો કા ખેલ

(તર્જ :- જરા સામને તો આવો છલિયે)

જરા કર્મ તો દેખકર કરિએ, ઈન કર્મોં કી બહુત બુરી માર હૈ।  
નહીં બચા સકેગા પરમાત્મા, ફિર ઔરોં કા કયા એતબાર હૈ ॥

બારહ ઘડી તક બૈલો કો બાંધા, છિંકા લગા દિયા ખાને કા,  
બારહ માસ તક ઋષભ પ્રભુ કો, આહાર મિલા નહીં દાને કા,  
ઈસ યુગ કે પ્રથમ અવતાર હૈ, બિન ભોગ્યા ન છૂટી લાર હૈ ।

નહીં બચા...

ત્રિપૃષ્ઠ વાસુદેવ કે ભવ મેં, દાસ કે કાનો મેં શીશા ડાલા,  
કર્મ નિકાચિત બાંધા વીર ને, તીર્થકર થે પર ના ટલા,  
ખે ધ્યાન મેં વન કે મંજાર હૈ, દિએ કાનો મેં ખીલે ડાર હૈ।

નહીં બચા...

सौतेली भाँ बन सौत के सुत सिर, बाटिया चढ़ा के प्राण हरा,  
 निशांशु लाख भवो के बाद में, गजसुकुमार बन कर्ज भरा,  
 चढ़ा सोभिल को कोध अपार है, डाले सिर पर धधकते अंगार है।  
 नहीं बचा...

किसी को मारे किसी को लूटे, काम करे अन्यायी का,  
 जैसा करेगा वैसा भरेगा, लेखा है राई-राईका,  
 नहीं छोटे - बड़ों की दरकार है, चाहे कर ले तू जतन दजार है।  
 नहीं बचा...

पग - पग में संयम रथ तू वयन पे, बोले तो बोल भलाई का,  
 धर्म से प्रीत कर कर्मों को ज्ञातकर, बन जा पथिक शिव राही का,  
 यह दुःख सुख भरा संसार है, यहां कर्मों का हो व्यापार है।  
 नहीं बचा...

## ५. वीर वन्दना

महावीर भगवान तुम को लाखों प्राणाम।  
 तीस वर्ष में दीक्षा लेकर,  
 बड़ी - बड़ी बाधाए सहुकर,  
 दिगे नहीं भगवान! तुम को लाखों प्राणाम।

ब्रह्मज्ञान फ़िर सहज सुनाया,  
 ज्ञावों को उपदेश सुनाया,  
 ऐसे त्रिशला नन्दन! तुम को लाखों प्राणाम।

हम सब बालक शराण तुम्हारी,  
 तरो मधु यह विनय हमारी,  
 घारे धर्म दुलारे! तुम को लाखों प्राणाम।

दीन दुःखी के सदा सहारे,  
 महावीर है देव हमारे,  
 करते सविनय वन्दन! तुम को लाखों प्राणाम।

## (૧) લેશ્યાનું સ્વરૂપ

**લેશ્યા** - આત્માના શુભાશુભ પરિણામોને 'લેશ્યા' કહે છે. જેના દ્વારા આત્મા કર્મોથી લેપાઈ છે, જે યોગોની પ્રવૃત્તિથી ઉત્પત્ત થાય છે, તેને લેશ્યા કહે છે. લેશ્યા છ છે - (૧) કૃષણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપોત લેશ્યા, (૪) તેજો લેશ્યા, (૫) પદ્મ લેશ્યા, (૬) શુક્લ લેશ્યા.

- ૧) કૃષણ લેશ્યાના લક્ષણ - પાંચ આશ્રવોમાં પ્રવૃત્તિ કરવાવાળા, ત્રણ ગુમિઓથી અગુમ, છ કાયની વિરાધના કરવાવાળા, તીવ્ર ભાવોથી આરંભાદિ કરવાવાળા, નિર્દ્યતાના પરિણામવાળા, નૃશંસ, કૂર, ઈન્દ્રિયોને વશમાં નહીં રાખવાવાળા, દુષ્ટ ભાવોથી યુક્ત જીવ કૃષણ લેશ્યામાં પરિણાત થાય છે.
- ૨) નીલ લેશ્યાના લક્ષણ - ઈર્ઝાળુ, કદાગણી, તપસ્યા નહીં કરવાવાળા, અવિદ્યાવાળા, માયાવી, નિર્લજ્જ, વિષયોમાં ગૃદ્ધ, દ્વેષી, મૂર્ખ, પ્રમાદી, રસલોલુપ, વિષયોની પ્રાસિ માટે પ્રયત્નશીલ, આરંભથી નિવૃત્ત નહીં થવાવાળા અને ક્ષુદ્ર, તુચ્છ તથા દુઃસાહસિક-વિચાર્ય વિના કામ કરવાવાળા આ પ્રકારના ભાવોથી યુક્ત જીવ નીલ લેશ્યામાં પરિણાત થાય છે.
- ૩) કાપોત લેશ્યાના લક્ષણ - વક વચન બોલવાવાળા, વક આચરણ કરવાવાળા, માયાવી, મનની અપેક્ષા વક, સરળતાથી રહિત, પોતાના દોષોને છુપાવવાળા, છળપૂર્વક વર્તન કરવાવાળા, મિથ્યાદિ, અનાર્ય, મર્મ-ભેદી વચન બોલવાવાળા, ચોર, મત્સરી, બીજાની ઉત્ત્રતિને સહન નહીં કરવાવાળા ઈત્યાદિ ભાવોથી યુક્ત જીવ કાપોત લેશ્યામાં પરિણાત થાય છે.
- ૪) તેજો લેશ્યાના લક્ષણ - નમ્ર વૃત્તિવાળા, અહંકાર રહિત, ચયપળતા રહિત, માયા રહિત, કુતૂહલ આદિ નહીં કરવાવાળા, પરમ વિનય ભક્તિ કરવાવાળા, ઈન્દ્રિયનું દમન કરવાવાળા, સ્વાધ્યાયાદિમાં રત રહેવાવાળા, વિશિષ્ટ તપ કરવાવાળા, ધર્મમાં દઠ રહેવાવાળા, પાપથી ઉરવાવાળા, બધા પ્રાણીઓનું હિત ચાહવાવાળા ઈત્યાદિ શુભ ભાવોથી યુક્ત જીવ તેજો લેશ્યામાં પરિણાત થાય છે.

- ૫) પદ્મ લેશ્યાના લક્ષ્ણ - અદ્ય કોધવાળા, અદ્ય માનવાળા, અદ્ય માયાવાળા અને અદ્ય લોભવાળા, શાંત ચિત્તવાળા, પોતાના આત્માનું દમન કરવાવાળા, સ્વાધ્યાયાદિ કરવાવાળા, તપ કરવાવાળા, પરિમિત બોલવાવાળા, ઉપશાંત અને જિતેન્દ્રિય ગુણોથી યુક્ત જીવ પદ્મ લેશ્યામાં પરિણત થાય છે.
- ૬) શુક્લ-લેશ્યાના લક્ષ્ણ - જે પુરુષ આર્તિધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને ધર્મધ્યાન, શુક્લધ્યાનના ધ્યાતા છે. શાંત ચિત્તવાળા, પોતાના આત્માનું દમન કરવાવાળા, પાંચ સમિતિઓથી યુક્ત, ત્રાણ ગુપ્તિઓથી ગુમ, અદ્યપરાગી અથવા વીતરાગી, ઉપશાંત અને જિતેન્દ્રિય ઉત્તમ ભાવોથી યુક્ત જીવ વિશિષ્ટ શુક્લ લેશ્યામાં પરિણત થાય છે અર્થાત् આ બધા લક્ષ્ણ વિશિષ્ટ શુક્લ લેશ્યાવાળા પુરુષમાં જોવા મળે છે.

આત્માના જે પરિણામ છે, તેને ભાવ લેશ્યા કહે છે અને જે પરિણામોથી આકર્ષિત થઈને લેશ્યાના પુદ્ગાલ આત્માને લાગે છે તે પુદ્ગાલોને દ્રવ્ય લેશ્યા કહે છે. લેશ્યાઓના નામ દ્રવ્ય લેશ્યાઓના આધારે છે.

ઇ લેશ્યાઓનું સ્વરૂપ સમજાવવા માટે બે વિષાંત આપવામાં આવ્યા છે-

**પહેલું વિષાંત** - ઇ પુરુષોએ એક જાંબુનું ઝડ જોયું. વૃક્ષ પાકેલા ફળોથી લાદેલું હતો. શાખાઓ નીચેની તરફ જુકેલી હતી. તેને જોઈને તેના ફળ ખાવાની ઈચ્છા થઈ. તેઓ વિચારવા લાગ્યા કે કેવી રીતે તેના ફળ ખાવા? એકે કદ્યું - વૃક્ષ પર ચડવાથી પડવાનો ઝર છે, એટલા માટે તેને ઝડ કાપી નાખવું જોઈએ. આ સાંભળીને બીજાએ કદ્યું - વૃક્ષને જડથી કાપવામાં શું લાભ? ફક્ત મોટી-મોટી ડાળીઓ જ કાપીએ ? આ સાંભળીને ત્રીજાએ કદ્યું- મોટી ડાળીઓ નહિ નાની નાની ડાળીઓ જ કાપીએ કારણ કે ફળ તો નાની નાની ડાળીઓમાં (શાખા) છે. આ સાંભળીને ચોથાએ કદ્યું, - ફક્ત ફળોના ગુચ્છાને જ તોડીએ. આપણે તો ફળનું જ કામ છે. આ સાંભળીને પાંચમાએ કદ્યું ગુચ્છાને પણ તોડવાની શું જરૂર છે? ફક્ત પાકેલા ફળને જ તોડીએ. આપણે તો પાકેલા ફળ જ ખાવા છે. આ સાંભળીને છટ્ઠાએ કદ્યું - જમીન પર ઘણાં બધાં ફળ પડેલા છે, તેને જ ખાઈએ. આપણે તો ખાવા જ છો.

**બીજું દ્વારાંત -** ઇ કૂરકર્મ ડાકુ કોઈ ગામ લૂંગવા માટે ગયા. તેઓ રસ્તામાં વિચાર કરવા લાગ્યા. એકે કહ્યું, ‘જે મનુષ્ય અને પશુ દેખાય તે બધાને મારી નાખવા જોઈએ.’ આ સાંભળીને બીજાએ કહ્યું, – ‘પશુઓએ આપણું શું બગાડચું છે? આપણે તો મનુષ્યોની સાથે જ વિરોધ છે, માટે મનુષ્યોને જ મારવા જોઈએ.’ ગ્રીજાએ કહ્યું, – ‘શ્રી હત્યા મહાપાપ છે, માટે શ્રીઓને મારવી યોગ્ય નથી.’ આ સાંભળીને ચોથાએ કહ્યું, – ‘શસ્ત્ર રહિત મનુષ્યને મારવા એ યોગ્ય નથી, માટે જે પુરુષોના હાથમાં શસ્ત્ર હોય, તેને જ મારવા જોઈએ. આ સાંભળીને પાંચમા ડાકુએ કહ્યું, – ‘જેની પાસે શાંક્ર હોય, પણ તે તરીને ભાગી જાય તો તેને મારવા ન જોઈએ. જે શાંક્ર લઈને લડવા આવે તેને જ મારવા જોઈએ. અંતમાં ઇટા ડાકુએ કહ્યું, – ‘આપણે તો ચોર છીએ. આપણાને તો ધનની જ જરૂર છે, માટે ધન કંઈ રીતે મળે, તે ઉપાય કરવા જોઈએ. એક તો આપણે બીજા લોકોનું ધન ચોરીએ છીએ અને ઉપરથી તેને મારી નાખીએ એ યોગ્ય નથી, ચોરી કરવી એ પણ પાપ જ છે, પછી હત્યાનું મહાપાપ શા માટે કરવું જોઈએ?

બંને દ્વારાંતોના પુરુષોમાં પહેલાથી બીજા, બીજાથી ગ્રીજા આ રીતે આગળ ને આગળ પુરુષોના પરિણામ કમશા: અધિકાધિક શુભ છે. આ ભાવોમાં ઉત્તરોત્તર સંકલેશ ઓછો થતો જાય છે અને વિશુદ્ધ વધતી જાય છે. ઇથે પુરુષોમાં પહેલા પુરુષના પરિણામ કૃષણ લેશ્યા યાવત્ત છઠાના પરિણામ શુકલ લેશ્યા સમજવા જોઈએ.

ઇથે લેશ્યામાં કૃષણ, નીલ અને કાપોત લેશ્યા પાપના કારણ હોવાથી અધર્મ લેશ્યાઓ છે, તેનાથી જીવ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા આ ત્રણે ધર્મ લેશ્યાઓ છે, તેનાથી જીવ સુગતિમાં ઉત્પન્ન થાય છે.

જે લેશ્યામાં જીવ મરે છે અર્થાત્ મરતા સમયે જે લેશ્યા હોય છે તે, લેશ્યાને લઈને જીવ પરભવમાં ઉત્પન્ન થાય છે. લેશ્યાના મર્યાદા અને ચરમ સમયમાં જીવ પરભવમાં નથી જતો, પરંતુ અંતમુહૂર્ત વીતવા પર અને અંતમુહૂર્ત શેષ રહેવા પર જીવ પરભવમાં જાય છે, માટે પરભવમાં પણ જીવ તે લેશ્યાથી ઉત્પન્ન થાય છે.

પૃથ્વીકાય, અપ્સ્કાય, વનસ્પતિકાય, ભવનપતિ અને વાગ્યંતરમાં પહેલી ચાર તથા તેઉકાય અને વાયુકાય, ત્રણ વિકલેન્દ્રિય અને નારકીમાં પ્રથમ ત્રણ લેશ્યાઓ જૈન સંસ્કાર પાદ્યક્રમ ભાગ-૪

હોય છે. જ્યોતિષીમાં તેજોલેશ્યા હોય છે. વૈમાનિકમાં અંતિમ ત્રણ લેશ્યાઓ હોય છે. તિર્યંગ પચેન્દ્રિય અને મનુષ્યમાં છ લેશ્યાઓ હોય છે. ૧૪મા ગુણસ્થાનવાળા મનુષ્ય તથા સિદ્ધ ભગવાન અલેશી હોય છે.

-----

## (૨) સંથારો સમાધિમરણ

(મહાત્વ, પચ્યક્ફખાળા, વિધિ)

મૃત્યુ સમગ્ર જીવનનો નિયોડ છે. સાધકના જીવનભરની સાધનાની પરીક્ષા મૃત્યુના સમયે થાય છે. જીવનની અંતિમ વેળામાં આત્મશુદ્ધિપૂર્વક તેમ જ સમતાભાવયુક્ત સાધક સમાધિ મરણને પ્રાપ્ત કરે, તો તે સાધક જીવનની દરેક કસોટીમાં ખરો ઉત્તરે છે. સંથારો વૈરાય્યમય જીવન તેમ જ સમભાવની સર્વોચ્ચ તપ અવસ્થા છે.

સાધક (સાધુ અને શ્રાવક) દરરોજ ત્રીજા મનોરથનું ચિંતન કરે છે કે તે દિવસ મારો ઘન્ય થશે, જ્યારે હું આલોચનાપૂર્વક સંલેખાળા-સંથારો કરીને સમાધિ મરણને પ્રાપ્ત થઈશ તે દિવસ મારો પરમકલ્યાણકારી થશે.

આવા ઉદાત્ત ચિંતન કરવાવાળા સાધક મૃત્યુને મહોત્સવના રુપમાં બદલી શકે છે. એવા સમાધિમરણને પ્રાપ્ત સાધક વારંવાર જન્મ-મરણને પ્રાપ્ત કરતા નથી તેમ જ જલદી મોકાને પ્રાપ્ત કરે છે. યાવજજીવન સંથારો ગ્રહણ કરતા પૂર્વે સાધક સંલેખના અંગીકાર કરે છે. જૈનદર્શનમાં સંલેખનાનું ખૂબ જ સુંદર વર્ણન છે. સંલેખના અર્થાત્ સમ્યક્ પ્રકારથી આહુર, શરીર, ઉપધિ (વચ્ચ, પાત્ર આદિ) તથા કખાયને કૃશ, પાતળા કરવા. સાધક ભમત્વ ભાવને છોડતા આત્મચિંતનપૂર્વક ધીરે-ધીરે સંથારાની તરફ આગળ વધે છે. સંથારાના બે પ્રકાર છે - (૧) સાગારી સંથારો, (૨) યાવજજીવન સંથારો.

૧. સાગારી સંથારો - આગાર સહિત એટલે અચાનક ઉપસર્ગ, આતંક, સંકટ, અસાધ્ય વ્યાધિ આદિ આવવા પર અથવા રાતે સૂતી વખતે તેને ધારણ કરવામાં આવે છે. જેમાં સંકટ વગેરે ટળી જવા પર અથવા નિદ્રા ત્યાગ કરવા પર નવકારમંત્રનું ધ્યાન કરીને સંથારો પારવામાં આવે છે. જો તેમાં વચ્ચે મૃત્યુ આવી જાય તો સંથારા સહિત સમાધિમરણને પ્રાપ્ત થાય છે.

વિધિ - સર્વ પ્રથમ દેવ, ગુરુ, ધર્મને વંદન કરતા, ક્રતોમાં લાગેલા દોષોની આલોચના કરીને, નીચે પ્રમાણે પ્રતિક્ષા ગ્રહણ કરવી જોઈએ.

આહુર, શરીર, ઉપધિ, પચ્યક્ફખું પાપ અઢાર.

મરણ પામું તો વોસિરે, જીવું જાગું પારું તો આગાર

૨. યાવજજીવન સંથારો - આ સંથારો જીવનના મૃત્યુ સમયે યાવજજીવન માટે ગ્રહણ કરવામાં આવે છે. શરીર મરણધર્મા છે. આ શરીર હુવે વધારે સમય સુધી જૈન સંસ્કાર પાક્યક્મ ભાગ-૪ ..... 115

ટકવાવાળું નથી. એવું જાણીને સાધક સંથારો ગ્રહણ કરે છે. ધર્મધ્યાનમાં તદ્દીન બની જાય છે એટલે કે દેહથી દેહાતીત થઈ જાય છે. તેમાં સાધક મૃત્યુથી ભયભીત થતો નથી કે મરવાની પાણ ઈચ્છા કરતો નથી અને તેના મનમાં શરીરનું પોષણ કરવાની પાણ ભાવના રહેતી નથી.

**વિધિ -** સર્વપ્રથમ પૂર્વ અથવા ઉત્તર દિશા સમુખ થઈને ત્રાણવાર વંદના કરીને – “અહો ભગવન્! સંલેખણા સંથારો કરવાની આપની આજ્ઞા છે?” એમ કહીને પછી નમસ્કાર મંત્ર, ઈચ્છાકારેણ, તસ્સ ઉત્તરી બોલીને એકવાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. ‘નમો અરિહંતાણં’ બોલીને કાયોત્સર્ગ પાળવો તથા નમસ્કાર મંત્ર તેમ જ કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ, એક લોગસ્સ પ્રગટપણે કહીને, ડાબો ઘૂંટણ ઉંચો કરીને, બે વાર નમોત્થુણં કહીને, પોતાના ધર્મગુરુ - ધર્મચાર્યની સ્તુતિ પાઠ કહેવો. ત્યારપછી મોટી સંલેખણાના પાઠ બોલીને સંથારાના પચ્ચક્ખાણ કરવા.

### જાણવા યોગ્ય :-

- ૧) તિવિહારો સંથારો હોય તો મોટી સંલેખણાના પાઠમાં ચઉંબિહંપિની જગ્યાએ તિવિહંપિ બોલવું તેમાં ‘પાણં’ શાબ્દ નહીં બોલવો તથા ગ્રાસુક જળનું સેવન કરવું. (સંથારાવાળાના નિભિતે નહીં બનાવેલું.)
  - ૨) સેવા કરવાવાળા સમલિંગી તથા સંવરમાં રહીને, વિધિ અનુસાર ઉચ્ચાર પાસવણ વગેરે પરઠેવું.
  ૩. સચેત વસ્તુઓને સ્પર્શ ન કરવો.
  ૪. સંથારા લેવાવાળાએ ખુલ્લા મોઢે બોલવું નહિં.
  ૫. ઉભયકાળ મતિકમણ, મોટી સાધુ વંદના, ધર્મ જાગરણ તેમ જ સ્વાધ્યાય, ભજન વગેરેથી આત્માને ભાવિત કરતા સંથારાના ભાવોનું ચિંતન કરવું.
  ૬. વખ્ત - પાત્ર આદિની મર્યાદા રાખવી.
  ૭. આ લોક, પરલોક વગેરેના સુખની કામના ન કરતા તથા જીવન-મરણાની ઈચ્છા ન કરતા આત્મસમાધિમાં લીન રહેવું.
  ૮. સાંસારિક, પારિવારિક, વ્યાપારિક વગેરે કાર્યોથી પૂર્ણ રીતે નિવૃત રહેવું.
  ૯. મારો કોઈપણ જીવની સાથે વેર-વિરોધ નથી. બધા જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ છે, એવું ચિંતન પ્રતિક્ષણ કરતા રહેવું. સંથારો આત્મહૃત્યા નહીં, આત્મકલ્યાણનો રાજમાર્ગ છે.
- નમોત્થુણં રામસ્સ ગળિંગરસ્સ મમ ધર્માયરિયસ્સ ધર્મોવઅસગસ્સ

જૈનાગમોમાં સંથારાનું મહત્વ તેમ જ વિધિ બતાવવામાં આવી છે. તેનું વર્ણન પૂર્વે કરેલું છે. સંથારો આત્માને આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત કરવાવાળું એક વિશિષ્ટ તપ છે, પરંતુ સંથારાને લઈને દુનિયામાં ખૂબ ઉદાપોહ ચાલી રહ્યો છે. જે મહાશય જૈનધર્મના મૂળભૂત અહિંસા આદિ સિદ્ધાંતોના જાગ્રકાર નથી, તેઓ આને આત્મહત્યા (suicide) કહે છે.

### (3) આત્મહત્યા અને સંથારામાં અંતર

	સંથારો	આત્મહત્યા
૧)	સંથારો ત્યારે કરવામાં આવે છે, જ્યારે જીવનનું ફૂલ મુરળાનું દેખાય. મૃત્યુ નજીક દેખાય.	આત્મહત્યા ત્યારે કરવામાં આવે છે, જ્યારે જીવન લાંબું દેખાય તથા દુઃખનો અંત ન દેખાય.
૨)	સંથારો એ વિશિષ્ટ તપ છે.	આત્મહત્યા મહાપાપ, દુર્ગતિનું કારણ છે.
૩)	શરીરથી જ્યારે વિશેષ ધર્મકિયા થતી નથી અથવા કોઈ મારણાંતિક ઉપસર્ગ આવે ત્યારે, બધાની માફી માળીને, જઘડાનું નિવારણ કરી, ક્ષમાયાચના કરી, સંથારો કરવામાં આવે છે.	દેવાળું નીકળે, પ્રેમમાં અસફળતા, પરીક્ષામાં અસફળતા, દેવું, ગૃહ કલેશ, જઘડા થવા વગેરે દુર્ભાવના આત્મહત્યાનું કારણ છે.
૪)	સંથારો કરવાવાળો, સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ક્ષમાભાવ રાખે છે.	આત્મહત્યા કરવાવાળા મનમાં અકોશ, દુર્ભાવ હોય છે.
૫)	સંથારો સાર્વજનિક રૂપથી - ગુરુજનો અથવા મોટા શ્રાવક-શ્રાવિકાઓના મુખેથી અથવા તેમની અનુપસ્થિતિમાં દેવગુરુ-ધર્મની સાક્ષીએ કરવામાં આવે છે.	આત્મહત્યા છુપાઈને, હોંશ વિના, અવિવેકી અવસ્થામાં, સાક્ષી વિના કરવામાં આવે છે.
૬)	સંથારામાં મરવાની ઈરદ્દી કરવી પણ દોષ છે.	આત્મહત્યા કરવાવાળા તત્કાળ મરવા ઈરદ્દી છે.
૭)	જૈનશાસ્ત્રોમાં વિષ સેવન, ફાંસી લગાવવી, ઝૂવા-નદીમાં દૂબીને આદિ મરણને અજ્ઞાન મરણ બતાવ્યું છે, તેની ઈરદ્દી કરવી પણ દોષ છે.	કૂવા-તળાવમાં દૂબીને, તીંચા સ્થાનથી ફૂદીને આદિ માધ્યમથી અજ્ઞાનપૂર્વક પોતાની જીવનલીલા સમાપ્ત કરે છે.

૮)	સંથારામાં કેટલાક પ્રકારની છૂટ હોય છે. ઉપસર્ગ આદિ ટળવા પર તેને પારી પણ શકાય છે.	આત્મહૃત્યામાં કોઈ છૂટ હોતી નથી. તે તરફડતા મરાણને પ્રામ થાય છે.
૯)	સંથારો એક આરાધના છે.	આત્મહૃત્યા દંડનીય અપરાધ છે.
૧૦)	સંથારાનું લક્ષ્ય આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ હોય છે.	આત્મહૃત્યા કરવાવાળાનું કોઈ લક્ષ્ય હોતું નથી. તે વર્તમાન દુઃખથી મુક્ત થવા ઈરંદ્ધે છે.
૧૧)	સંથારો કરવાવાળા શુભભાવોથી દેહ છોડતા હોય છે. સદ્ગતિને પ્રામ થાય છે. તે ભવિષ્યમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે અથવા મહિર્ધિક દેવ બને છે.	આત્મહૃત્યા કરવાવાળા અશુભભાવોથી દેહને છોડે છે. દુર્ગતિને પ્રામ થાય છે. તથા કેટલાક જન્મો સુધી દુઃખો પ્રામ કરે છે.
૧૨)	સંથારો જ્ઞાની અને સાહુસી વ્યક્તિઓના દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કાર્ય છે.	આત્મહૃત્યા અજ્ઞાની પુરુષોના દ્વારા કાયરતાપૂર્વક કરવાવાળું કુદૃત્ય છે.
૧૩)	સાધક રોજ પ્રસત્રભાવથી ચિંતન કરે છે કે 'હે ભગવન્ત! તે દિવસ મારો ધન્ય તેમ જ કલ્યાણકારી થશો, જે દિવસે અંતિમ સમયમાં સંથારો સ્વીકાર કરી, દેહનો ત્યાગ કરીશ.'	આત્મહૃત્યાનું ચિંતન કોઈપણ વ્યક્તિ દરરોજ કરતું નથી. એકમાત્ર દુઃખથી ગભરાઈને, એવો ઘૃણિત નિર્ણય લઈ લે છે.

ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે -

સંથારો આત્મહૃત્યા નથી, પણ આત્મસાધનાની એક કસોટી છે. બંનેમાં પરસ્પર કોઈ સાખ્યતા નથી તેમ જ સંપૂર્ણ વિશ્વમાં કોઈ પણ ન્યાયાલય દ્વારા કોઈને મૃત્યુંદં આપવામાં આવે તો તેને ફાંસી, ઝેર, વિજળીના કંરટના પ્રયોગથી મૃત્યુ આપવામાં આવે છે, અન્ન-પાણીનો ત્યાગ કરાવીને નહીં. મહાત્મા ગાંધી સહિત કેટલાક નેતાઓએ કેટલીવાર આમરણ અનશાન કર્યું છે. આજે પણ કેટલાક નેતાઓ આવું કરે છે. તે આત્મહૃત્યાનો પ્રયાસ નથી માનવામાં આવતો કરાણ કે અન્ન-પાણીનો ત્યાગ મૃત્યુ પ્રાપ્ત કરવાનો ઉપાય નથી. સંથારા અને આત્મહૃત્યાની તૂલના અજ્ઞાનતા છે, સાથે જ

અનંત તીર્થકરોએ સ્વયં આ ગ્રહણ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમ જ મૃત્યુ પૂર્વે ગ્રહણ કરવાનો ઉપદેશ આપે છે. મરાણ પણ એક કળા છે. અનેક ધર્મોમાં જીવન જીવવાની કળા બતાવવામાં આવી છે, પરંતુ જૈનધર્મમાં જીવવાની અને મરવાની બંને કળા બતાવવામાં આવી છે. અનેક આચાર્યો, ઋષિ મુનિઓ, ફુણ મહારાજની પહૂરાણિઓ, શ્રેષ્ઠિકની રાણીઓ તેમ જ શ્રાવકોએ આ ઉચ્ચ કોટિની સાધનાથી જીવનને સુવાર્ણ સમાન નિર્મળ બનાવ્યું છે તથા સિદ્ધગતિને પ્રાપ્ત કરી છે.

આથી મેધાવી સાધક, સકામ મરાણ (જ્ઞાન મરાણ), અકામ મરાણ (અજ્ઞાન મરાણ)ની તુલના કરી, એમાંથી વિશિષ્ટ સકામ મરાણનો સ્વીકાર કરી, મૃત્યુ મહોત્સવના રૂપમાં મનાવે છે.

## (૪) સમય

“સમયં ગોયમ મા પમાયાએ.”

હે ગૌતમ ! ધર્મ કાર્ય કરવામાં એક સમય માત્રનો પણ પ્રમાણ ન કર.  
બીજુ જગ્યાએ પણ કહ્યું છે.

સાંસ-સાંસ પર પ્રભુ ભજ, વૃથા સાંસ મત ખોયે ।  
કુણ જાણો ઈણ સાંસ કા, આણા હોય ના હોય      || ૧ ||

ક્ષાણ-ક્ષાણ, ક્ષાણ-ક્ષાણ કરતા, જીવન બીતા જાય.  
ક્ષાણ-ક્ષાણ કા ઉપયોગ કર, બીતા ક્ષાણ ફિર ન આય.      || ૨ ||

જો - જો ક્ષાણ બીત ગયા, શીશ પકડ કર્યો રોય ।  
થહુ ક્ષાણ આયા સામને, ઈસે વૃથા મત ખોય      || ૩ ||

ક્ષાણ નિકમ્ભો રહુનો નહીં, કરનો આતમ કામ ।  
ભાણનો ગુણનો શીખનો, રજાનો જ્ઞાન આરામ      || ૪ ||

અવસર વીત્યો જત હૈ, અપને બસ કદ્દુ હોત ।  
પુરુષ છતાં પુરુષ દોત હૈ, દીપક - દીપક જ્યોત      || ૫ ||

રાત ગંવાઈ સોવતા, દિવસ ગવાયો ખાય ।  
હીટો જેસો હર ક્ષાણ હૈ, કોઈ બદલે જાય.      || ૬ ||

## શ્રી સાધુમાર્ગી જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડ બીકાનેર

### જૈન સંસ્કાર પાઠ્યક્રમ પરીક્ષા ૨૦૧૧

(પ્રશ્ન - ઉત્તર પત્ર ભાગ - ૪)

પૂર્ણાંક - ૧૦૦

### સૂત્ર વિભાગ - ૩૪

પ્રશ્ન ૧	ખાતી જગ્યા પૂરો	૩૦
----------	-----------------	----

- ૧) મન, વચન તેમ જ કાયાના \_\_\_\_\_ પ્રવર્તે.
- ૨) તસ્સ \_\_\_\_\_ અઈયારસ્સ.
- ૩) કંદપે \_\_\_\_\_ સંજુતાહિગરણે, ઉવભોગ પરિભોગાઈરિતે.
- ૪) અસાંશ-પાણુ-ખાઈમ \_\_\_\_\_ પદિગ્ગાહ કંબલ-પાય-પુંછણેણું.
- ૫) સંથારાનો \_\_\_\_\_ દુરુણી દુરુણી પૂર્વ તથા ઉત્તર.
- ૬) સંભિમં સણિણવાઈયં વિવિહા રોગાયંકા \_\_\_\_\_ ફાસાફુસન્તુ.
- ૭) ૧૦૦૮ લક્ષણ અને ૩૪ અતિશાય છે?
- ૮) સકલ કરમ ટાલ, વશ કર લિયો કાલ મુક્તિ મેં રહ્યા \_\_\_\_\_ સવૈયા છે? કરી।
- ૯) સયેતના ત્યાગી, અયેતના ભોગી, લોય કરવા, ખુલ્લા પગે ચાલાવવાળા છે
- ૧૦) દેવસિય પાયચિદ્ધિત \_\_\_\_\_ કાઉસર્યા.
- ૧૧) શામ, સંવેગ \_\_\_\_\_ આસ્થા, સમકિતના પાંચ લક્ષણ છે.
- ૧૨) પ્રતિક્રમણ દેવસિક, રાત્રિક, \_\_\_\_\_ સાંવત્સરિક ઈત્યાદિ પાંચ પ્રકારના હોય છે.
- ૧૩) પ્રતિક્રમણના આસનમાં બંને ઘૂંટણ ઊભા રાખવા, શેનું પ્રતિક છે.

૧૪)	પ્રતિક્રમણના આવશ્યકોમાં પહેલો _____ બીજો છે.	૫
-----	--	---

૧૫)	રાત્રિ પ્રતિક્રમણ સૂર્યોદયથી કેટલા સમય પહેલા કરે છે? _____.	૫
-----	---	---

પ્રશ્ન ૨	પ્રતિક્રમણમાં પાંચમા આવશ્યકની વિધિનું વર્ણન કરો (૫૦ શાબ્દ)	૫
----------	--	---

ઉત્તર	_____	_____
-------	-------	-------

## તત્ત્વ વિભાગ - ૨૫

**પ્રશ્ન ૧** એક વાક્યમાં ઉત્તર આપો.

૨૦

૧) કુદર્શન વર્જનનો અર્થ શું છે?

ઉત્તર

૨) સમકિતના શુદ્ધિના પ્રકાર લખો.

ઉત્તર

૩) સમકિતીના લક્ષણમાં આસ્થા એટલે શું?

ઉત્તર

૪) સમકિતના દૂધણમાં પરપાંખડી સંસ્તવ શું છે?

ઉત્તર

૫) આણગાર એટલે શું?

ઉત્તર

૬) યતના એટલે શું?

ઉત્તર

૭) સમકિતના સ્થાન કોને કહે છે?

ઉત્તર

૮) જાતિ સ્થવિર કોને કહેવાય?

ઉત્તર

૯) તીર્થકર માપ્તિના ૨૦ બોલોમાંથી અગિયારમો બોલ લખો?

ઉત્તર

૧૦) પુણ્યવાનને પ્રાપ્ત થવાવાળી સામગ્રીમાં ચોથી કઈ છે?

ઉત્તર

**પ્રશ્ન ૨** નીચેના પ્રશ્નોના ઉત્તર ખાલી જગ્યામાં લખો?

૫

૧) સમકિતનો પહેલો બોલ? ( \_\_\_\_\_ )

૨) સમકિતનો બીજો બોલ? ( \_\_\_\_\_ )

૩) સમકિતનો ત્રીજો બોલ? ( \_\_\_\_\_ )

૪) સમકિતનો દસમો બોલ? ( \_\_\_\_\_ )

૫) તીર્થકર માપ્તિના બોલોમાં ૧૮મો બોલ? ( \_\_\_\_\_ )

કથા વિભાગ - ૧૦

પ્રશ્ન ૧ સાચું (✓) તેમ જ ખોટું (X) કરો. ૧૦

- ૧) ભગવાન ઋષભદેવનો જન્મ બીજા આરામાં થયો હતો. ( )

૨) ભગવાન ઋષભદેવને જન્મથી પ અતિશાય હતા. ( )

૩) ભગવાન ઋષભદેવના ૧૦૦ સંતાનો હતા. ( )

૪) ભગવાન ઋષભદેવ અવસર્પિણીકાળના પ્રથમ મહામુનિ હતા. ( )

૫) ભગવાન ઋષભદેવને ૬૪ ગાણધર હતા. ( )

૬) અર્જુનમાળીના કુળહેવતા મુદ્ગરપાણિ યક્ષ હતા. ( )

૭) સુદર્શન શ્રાવક, અર્જુનમાળીના પરમ મિત્ર હતા. ( )

૮) શ્રી કૃષ્ણના ભાઈના ભાઈનું નામ હેઠાળ હતું. ( )

૯) હેઠાળ મુનિના પૂર્વજન્મનું નામ ‘પારાસર’ હતું. ( )

૧૦) હેઠાળ મુનિના માથા પર ધઘકતા અંગાર રાખ્યા હતા. ( )

કાલ્પનિક વિભાગ - ૧૧

પ્રશ્ન ૧ કાચ્ય પૂર્ણ કરો. ૧૫

- १) દેખવા ભવન્ત - \_\_\_\_\_ કારં જલ જલનિધેર સિટું ક ઈચ્છેત?

૨) તુલ્યં નમાનિભુવ - નાર્તિ - હરાયનાથ |

• જિન ભવોદધિ શોષણાય.

- 3) मैंने नहीं \_\_\_\_\_ भ्रम से भवोद्धि धार में

4) अन्य मंत्रों से परम \_\_\_\_\_ मान लेना तू भुजे ।

5) किसी को भारे \_\_\_\_\_

જતન હજાર હૈ નહીં બચા સકેગા ————— એતબાર હૈ

## સામાન્ય જ્ઞાન વિભાગ - ૧૫

**પ્રશ્ન ૧ જોડકા જોડો જોડીને ખાલી જગ્યામાં લખો.** ૧૦

- ૧) કૃષણ લેશ્યા                          નમ્રવૃત્તિવાળો, અહુંકાર, માયા રહિત \_\_\_\_\_
- ૨) નીલ લેશ્યા                          વધ વચન બોલવાવાળો \_\_\_\_\_
- ૩) કાપોત લેશ્યા                          અદ્યકોધ, અદ્યમાન, અદ્યમાયા \_\_\_\_\_
- ૪) તેજો લેશ્યા                          ધર્મધ્યાન તેમ જ શુક્લધ્યાનમાં રમણ કરવાવાળો \_\_\_\_\_
- ૫) પંજ લેશ્યા                          ઈચ્છાણુ - કદાગ્રણી \_\_\_\_\_
- ૬) શુક્લ લેશ્યા                          પાંચ આશ્રવમાં મવૃત્તિ કરવાવાળો \_\_\_\_\_
- ૭) સાગારી સંથારો                          દુર્ગતિનું કારણ \_\_\_\_\_
- ૮) યાવત્જીવન સંથારો                          અલેશી \_\_\_\_\_
- ૯) આત્મહિત્યા                          આગાર સહિત \_\_\_\_\_
- ૧૦) સિદ્ધ ભગવાન                          જીવન પર્યન્ત \_\_\_\_\_

**પ્રશ્ન ૨ નીચેના દોહા પૂર્ણ કરો.** ૫

- ૧) આહાર \_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_ **પાણું તો આગાર.**
- ૨) સાંસ-સાંસ પર ગ્રલુ ભજ \_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_ **આણ્ણા હોય કે ના હોય.**
- ૩) રાત ગંવાઈ સોવતા \_\_\_\_\_  
\_\_\_\_\_ **કોડી બદલે જાય.**

## શ્રી અભિલ ભારતપર્વીય સાધુમાર્ગી જૈન સંઘ

### મુખ્ય ઉદ્દેશ્ય

- ◆ સમતા સમાજની રચના
- ◆ વ્યસન મુક્ત રાષ્ટ્ર નિર્માણ
- ◆ જીવદયા, સ્વધર્મ સેવા, ભાનવ સેવા ની વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન
- ◆ જૈન સંસ્કૃતિ, ધર્મ, દર્શન તથા આચારના શાશ્વત સિદ્ધાન્તોનો લોક ભાષામાં પ્રચાર-પ્રસાર
- ◆ જન કલ્યાણકારી સહજ-સુબોધ સાહિત્યનું નિર્માણ
- ◆ સભ્યક જ્ઞાન, દર્શન ચારિત્ર ની રક્ષા તથા વૃદ્ધિ માટે શિક્ષા-દીક્ષા ની સમુચ્ચિત વ્યવસ્થા
- ◆ સમાજ માં ધાર્મિક ચેતનાના અભ્યુત્થાન માટે આધ્યાત્મિક, નૈતિક, ચારિત્રિક તથા શૈક્ષણિક વિકાસ ના કાર્યો કરવા
- ◆ ધાર્મિક પરીક્ષા, સંસ્કાર શિબિર તથા સંસ્કાર પાઠશાલાના ભાધ્યમ થી સંસ્કાર જાગરણ તથા સ્વાધ્યાચી તૈયાર કરવા
- ◆ જૈન ધર્મના વિભિન્ન પાસાઓને જાળવા માટે પ્રચાસરત શોધાર્થીઓ તથા વિદ્રોનો ને યથોચિત સહયોગ પ્રદાન કરવો.
- ◆ ધાર્મિક, આધ્યાત્મિક તથા નૈતિક શિક્ષા માટે પાઠ્યકભ નિર્ધારિત કરી સભ્યજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવો.

# શ્રી અભિનત ભારતવર્ષીય સાધુમાર્ગ જૈન સંઘ

## પ્રભુજ પ્રવૃત્તિઓ

### ધાર્મિક પ્રવૃત્તિઓ

- ◆ શ્રી સમતા પ્રચાર સંઘ
- ◆ વ્યસન મુક્તિ તથા સંસ્કાર નિર્માણ
- ◆ ધર્મપાલ પ્રચાર-પ્રસાર તથા સિરીવાલ પ્રવૃત્તિ
- ◆ સમતા જનકત્વાણી પ્રન્યાસ
- ◆ આચાર્ય શ્રી નાનેશ દ્યાન કેન્દ્ર, ઉદયપુર

### સાહિત્યિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ

- ◆ શ્રમણોપાસક પત્રિકા (પાકિસ્ત)
- ◆ સત્તસાહિત્ય પ્રકાશન
- ◆ આગમ તથા તત્ત્વ પ્રકાશન
- ◆ આચાર્ય શ્રી નાનેશ સમતા પુરસ્કાર
- ◆ સ્વ. શ્રીપ્રદીપ કુમાર રામપુરિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર
- ◆ સ્વ. શ્રી યમ્પાલાલ સાંડ સ્મૃતિ પ્રતિભા ઉત્ત્ર્યન પુરસ્કાર
- ◆ શ્રી સુરેન્દ્ર કુમાર સાંડ શિક્ષા સોસાયટી, નોખા
- ◆ પ્રાકૃત તથા જૈન વિદ્યા વિભાગ, સુખાડિયા વિ.વિ. ઉદયપુર
- ◆ આગમ, અહિંસા-સમતા તથા પ્રાકૃત સંસ્થાન, ઉદયપુર
- ◆ શ્રી પ્રેમરાજ ગણપતરાજ બોહરા ધર્મપાલ જૈન છાત્રાવાસ, રતલામ
- ◆ શ્રી ગણેશ જૈન છાત્રાવાસ, ઉદયપુર
- ◆ શ્રી ધાર્મિક પરીક્ષા બોર્ડ, બીકાનેર
- ◆ શ્રી ગણેશ જૈન જ્ઞાન ભંડાર, રતલામ
- ◆ વિદ્ધત નિર્માણ પ્રકલ્પ, ઉદયપુર
- ◆ સમતા લુક બેંક